

# મુહુપતિ-યર્થાસાર

સંપાદક : -  
પં. કલ્યાણવિજયલુ

શ્રી લોખાલાલ સાકણચંદ  
શેઠ વિજયનીતિસ્કૃતીભૂર્જ જૈન લાધભેરી  
પતાસાની પોળ : અમદાવાદ.

---

મુદ્રણ :  
શેઠ દેખંડ ડામણ  
આનંદ શ્રી-ટ્રીની પ્રેસ  
દાવનગર.

---

પ્રથમાવૃત્તિ  
પ્રત ૧૦૦૦

## —પ્ર સ્તો વ ના—



મુખવિંકિકા ચારિત્રના અંગને બધારે પ્રકાશિત કરનાર  
હોવાથી અમોએ ચર્ચા-સાર નામતું પુસ્તક ઝડાર પાડેલ.

ચર્ચા-સાર ઝડાર પાડવાતું પ્રયોજન આપની નજરે  
તો આવી ગયેલ હશે, છતાં ‘હેવલક્ષ્મિમાલા’ ; વિગેરે  
અન્યકારોએ મુખવિંકિકાના ખંડનમાં પોતાતું માથું ઉંચકણું  
હતું. સાહિ અને સરલ નિર્વિદ્ય પ્રણાલિકાના ધ્વંસકારક  
અની માથું ઉંચકણારની અવસ્થાતું ધ્યાન પોતાની મેળે  
નીહાળે તો તે રસ્તો તે આત્માઓને સ્વીકારાય એમાં  
લગારે અતિશયોક્તિ નથી. પગ તળે મારી નિર્વિદ્ય પ્રણા-  
લિકા કે સાવધ એટલું જ મારી દૃષ્ટિએ હેખાય તો જ સલ્ય  
નજર આગળ તરી આવે. અસ્તુ.

અમોએ અમારી દૃષ્ટિની આગળ મુખવિંકિકાને ચારિ-

ત્રણ અંગ તરીકે સ્વીકારી તેની પુષ્ટિકારક પુસ્તિકા ચચો—સાર અમારે વગર વિલંબે જ્હાર પાડવી પડેલ છે. તેમાં કઈ કઈ જગ્યા પર મુખવિભિન્નાને વિશેષ સ્થાન અપાયેલ છે તે આખત અમારા વાચકોની દૃષ્ટિ આગળ રજૂ કરું.

૧. સ્વાક્ષર્યાચ, ૨. વ્યાગ્યાન, ૩. પડિલેહણ્ણા, ૪. કાંને, ૫. સ્થાંદિલ, ૬. સાંધુના મૃતક-વિગેરે સ્થળે મુખ-વિભિન્ના નાક પર રાખી કરને લરાવવાનાં સ્પષ્ટ અને નિર્બિંવાદ ઉલ્લેખો મળે છે; છતાં વીસમી સહીના જમાનામાં અમે જ્યારે સં. ૧૯૬૦ ની સાલનું ચાહુમીસ મુંખદ્યમાં કરેલ તે જ સાલમાં અસાડ સુદ ૧૫ના પાક્ષિક સિદ્ધ્યકુ પત્રમાં ખંડનાત્મક સ્વભાવને અભલંખી લેખ લખાયો. સંમેલનમાં સાથે એસનાર છતાં તે બાબતનો નિર્ણય કરવાની હિન્મત પ્રદર્શિત કરાઈ નહીં. સંખ્યાંધી સાધારણું જીહા-પોહ પણું ગ્રાગટ થયેલ નહીં, તેમજ વિચારણા પણું નહીં; છતાં સિદ્ધ્યકુકારે પાંચ માસની અંદર આ ચચો ઉપસ્થિત કરી જ્હાર ગ્રાગટ કરેલ અને અમોને આડ્ઝાન આપતાં અંક ૨, તૃતીય વર્ષ, આસો વદ ૦)) તા. ૭-૧૧-૩૪ ના સિદ્ધ્યકુમાં લખાય કે—“ હજુ પણું પ્રતિશ્રા કરી મધ્યસ્થેનાં નામ આપી જાહેર કરશો તો ધીનાયો તૈયાર જ છે.” આ આડ્ઝાન કેવું સુંદર ! આપનાર સિદ્ધ્યકુકાર, લખનાર સિદ્ધ્યકુના લેખક અને આડ્ઝાન જીલનાર ધીનાયો તૈયાર.

વાચકો વિચારો, લખનાર આત્મા ‘કોળા’ ‘નરો વા કુંજરો વા’ના ન્યાયે પોતાના માથા ધરથી કલંક ઉતારી અન્યના ઉપર નાંખવા તૈયાર ! અન્ય કોણું ? તેનો પણ અમારે વિચાર. અમારે કોના પર વિચારો હેંકવા ? આવી ચ્યાલખાળની રમતમાં રહેતો આત્મા સૂત્રના પાછોને પોતાની

મતિ પ્રમાણે અથો લગાવી ઓળ આત્માચોને ભર્મિત  
બનાવવા કુટિલતા શું સ્વીકારી ન શકે ? શાખને શાખના  
ઝપમાં શું કેરવી ન શકે ? ઉત્સર્ગ-સ્થાને વાપવાદ અને અપ-  
વાહને સ્થાને ઉત્સર્ગ બનાવવા કોશીશ નહીં કરાતી હોય ?

બધુંએ બુદ્ધિની વિષમતાના પ્રલાવે. ઉપરોગની  
શૂન્યતાના સહ્બાવે એ બને ને ? જાહી લેઇને કૂવામાં ચે  
પડેને ? તેમાં નવાઈ શું ? પણ અજાનાવસ્થાના મદમાં મસ્ત  
અની કદાચ કોઈ પણ આત્મા રસ્તાની લાઈનહોરીથી  
અલગ વિલાગમાં ચાલવા કદાચ તૈયાર થાય; પણ લાવિના  
યોગથી તે બાજુ છૂંધાર આવે તો તેનાં ફ્રલ કેવાં મળે ?  
તે જ વિચારાચ તો બધુંએ સમબન્ધ. પણ કર્માવલીને  
વધારવા જ્યાં કોશીશ કરાતી હોય લ્યાં સજજડ ઉપરેશક  
પણ હતાશ થઈ જાય છે, તો સામાન્યતું શું ગળું ?

આ ચચો ઉપાડનાર સિદ્ધયક્કાર, જીલનાર જૈના-  
ચાય્ય વિજયહૃષ્ણુરીખરળ મહારાજ આદિ.

રીતસર જે જે પ્રમાણેના મુદ્દાચો ઘડી લોકેની જાણ  
સારું અમોચે છૂંધાર મૂકેલ છે તેને વિચારી સત્ય વસ્તુના  
સંશોધકોને તેની શોધ કરવા ભલામણું કરું છું.

મુખવસ્તિકા ચારિત્રતું એક મહાનું અંગ છે. તેની  
બ્યવસ્થા કરવી તે અમારી ફરજ છે. તે અંગને બ્યવહાર  
પૂરતી રાખવા હાલ અમારી પ્રણાલિકા ચોનાચેલી હેખાચ  
છે, પણ તે અંગને જેઠલા પ્રમાણુમાં જે જે જગ્યાએ ઉપ-  
રોગમાં આવે તે તે જગ્યાએ વાપરવા અમારી ખાસ  
ભલામણું છે. પ્રમાદાવસ્થામાં કદાચ ઉપરોગ ન કરાય તો  
પ્રાચ્યિકિત્તના અધિકારી કહેલ છે પણ તે વસ્તુને

અંડનના રૂપમાં ફેરવી દેવા ડોશીશ કરાતી હોય ત્યાં  
પ્રાચીનીત કોતું ? તે જ વિચારણીય છે. વાસ્તે અમોએ  
સિદ્ધ્યકકાર સામે જે જે લખાણે લખાયેલાં હતાં તે તે  
લૈયોને પ્રશ્ન-જવાણ આમ બે નામો આપી આપી લૈખ-  
માળા રૂપમાં સંશેહ કરી પ્રકાશિત કર્યાં છે. તે બુકને વાંચી  
વિચારાશે તો પુસ્તક પ્રકાશનનો શ્રમ સાર્થક થશે.

ઇતિહાસ  
પંન્થાસ કલ્યાણવિજય



શ્રી જૈતમસ્વામિને નમઃ  
જૈનાચાર્ય વિજયનીતિસ્ક્રોધરાજસદુરૂષ્યો નમઃ

## મુહુપત્રિ ચર્ચાસાર



સં. ૧૯૬૦ની સાલમાં જૈનાચાર્ય વિજયનીતિસ્ક્રોધરાજ મહા-  
રાજ મુખ્ય શહેરમાં ચાતુર્માસ ભાઈ પધાર્યા હતા. તે દરમયાન  
'સિદ્ધચક' પાક્ષિકમાં સં. ૧૯૬૦ના અસાડ શુદ્ધ ૧૫ તા. ૨૬-૭-૩૪  
ગુરુવારના વર્ષ બીજું અંક વીસમાં સમાદોચના પ્રકરણમાં  
જૈનાચાર્ય સાગરાનંદજી મહારાજે એક ચર્ચી જિલ્લી કરેલ.

ચર્ચી જિલ્લી કરવી તે વિદ્ધાનોનું કર્તવ્ય છે. પૂર્વના સમયમાં  
વિદ્ધાનો દ્વારાએ અનેક ચર્ચાએ ઉપરિથિત થયેલ અને થાય છે. પણ  
સત્ય વરતું જે હાથમાં આવે તો તે વરતુને તરતજ રવીકારી ભૂલને  
કખૂલ કરતા હતા. આ એરી જમાનામાં ચર્ચી તો જિતપણ કરાય છે,  
પણ સત્ય વરતુને અમલમાં મુકાય નહીં, તેમ ભૂલ પણ કખૂલ  
કરાય નહીં. જ્યાં સુધી ભૂલને ભૂલ તરીકે મનાય નહીં ત્યાં સુધી  
ચર્ચા સમાપ્ત થાય પણ નહીં ?

જે ચર્ચાની સમાપ્તિમાં જેનું મન લગારે લાગેલું ન હોય  
તેવી ચર્ચામાં વિતંડવાદ સિવાય બીજું શું હોએ શકે ?

આ ચર્ચાસાર જે ચોપડી આકારે બહાર પાડવામાં આવેલ  
છે તે પેપર દ્વારાએ સવાલ-જવાબ કે વાદી-પ્રતિવાદી તરીકે લેખેલ

બહાર પડેલા તે વાયકજનોની આગળ રજૂ કરું છું. તે કેખાને મનત-પૂર્વક વંચાય તો જ પરિશ્રમ સક્રિય થશે એમ હું માનીશ.

કોઈ પણ આત્મા શંકા કરે કે આવા શુષ્કવાદમાં ઉત્તરું તે હાલના જમાનામાં વ્યાજભી છે? જવાયમાં મુખવસ્તિકા એક ચારિત્રનું ઉપહરણ શું આપણું દેખાતું નથી? દરેક બાધ કિયા-ઓઅં તપાસ કરતાં મુખવસ્તિકા મુખ્ય સાધન તરીકે ગણેલ છે, પણ અમારા કેખાનાં તો વ્યાખ્યાનાદિ સમયમાં મુખવસ્તિકાનું પ્રતિપાદન કરેલું છે.

વ્યાખ્યાનાદિમાં મુખવસ્તિકા બાંધવાતું પ્રયોજન શું?

તીર્થેકર પ્રક્ષુની વાણી અમેદ. તેઓના મુખદારાથી નીક-ગેલા શબ્દોને ગણુધર પ્રક્ષુંએ ગુંથણીમાં ગુંથેલ. તે ગુંથેલ આગ-માહિની આશાતનાને નાખુફ કરવા વ્યાખ્યાનાદિમાં મુખવસ્તિકા બાંધવાતું પ્રયોજન.

ઉપયોગવાન્ જીવો હાથમાં મુખવસ્તિકા રાખી વ્યાખ્યાનાદિ શું વાંચી ન શકે?

તીર્થેકર પ્રક્ષુંએ એક સમયમાં એક જ ઉપયોગ. ને સમયે વાણીદારાએ ભાષાવર્ગણાના પુહુગદો શ્રોતાવર્ગ આગળ ઇંકાતા હોય તે સમયે મોંભાંથી નીકળતા શુંકથી આગમ-શાઓની અગર પુરત-કોની આશાતના દૂર કરવા સારે મુખવસ્તિકા બાંધવાની જરૂર છે. ભીજું કારણ વ્યાખ્યાન વાંચનાર મુનિઓ એક હાથમાં પુરતક અને ભીજી હાથમાં મુખવસ્તિકા રાખી ઉપયોગ કરું રીતે રાખી શકે? તેની વાસ્તે પણ જરૂર.

નીજું કારણ મુનિઓ પ્રવચનમુદ્રાએ ધર્મદૈશના આપે. પ્રવચન-મુદ્રા જમણે હાથે કરાય અને ડાખે હાથે પુરતક રાખવામાં આવે તો મુહુરતિ કચાં રાખવી આટલા ખાતર પણ વ્યાખ્યાનાદિમાં મુહુરતિ બાંધવાની આવસ્યકતા રહેલી છે.

સ્થાનકવાસીપણાભાંથી ખુટા થએલા સાધુઓ મુહુરતિને તોડી સંવેગી પક્ષમાં આવ્યા વાસ્તે ફરી બંધાય કેમ?

જવાઅમાં મોચીસ કલાક મુહુપતિ બાંધનારો સ્થાનકવાસી વર્ગ તેમાંથી આગમોદારાએ જળુલી સત્ય વરસુને અમલમાં મૂડવા તેઓએ જ્યારે સત્ય વરસુના પ્રતાપે સ્થાનકવાસી પંથને ત્યજી સંવેગી પક્ષ રીકાર્યો. તો તેમાં પણ પૂર્વીચાર્યોના સંશોધનથી, પરાપૂર્વથી આવેલી સત્ય વરસુને અમલમાં મૂડવી તે આત્માર્થી જીવાની ફરજ છે. સત્ય વરસુને માટે આજ્ઞા સ્થાનકવાસી સંપ્રદાયને છોડી સંવેગી જ્યાનાય તો આ વ્યાખ્યાનાહિમાં મુહુપતિ બાંધવાની સત્ય વરસુને સ્વીકારાય તેમાં આશ્રય શું ?

તીર્થંકરની પૂજાવિધિમાં પણ મુખ્યકાર્ય બાંધવાનું વિધાન-પ્રતિપાદન કરલું છે, તેમ વ્યાખ્યાનાહિમાં મુહુપતિનું બંધન વિધિ-પ્રતિપાદન સ્વીકારાર્થું પડશે. કારણ મુખ્યકાર્યબંધનથી જિનેશ્વર પ્રશ્નુની આશાતના દૂર કરાય તેમ મુહુપતિ બાંધવાથી જિનેશ્વર પ્રશ્નુના આગમોની આશાતના દૂર કરાય. આ બંને વરસુએ આશાતનાને નાયુદ કરવા સ્વીકારાય તેમાં શું આશ્રય ? અરતુ.

સં. ૧૯૬૦ અસાડ સૂદ ૧૫ ગુરુવાર તા. ૨૬-૭-૩૪ વર્ષ  
ખીંગું અંક ૨૦મો, સમાલોચનાના પ્રકરણુમાં પ્રથમ ઉમલ કરનાર હોવાથી તે નીચે પ્રમાણે છે.

### પ્રક્ષો

(૧) લાંઘા તાડપત્ર ઉપરથી વ્યાખ્યાન વાંચના વખતે પૂર્વ-પુરુષોએ મુહુપતિ બાંધી, અને તે એક હાથે પાનાં વાંચાય તેવી પ્રતોના વખતમાં ચાલુ રહી, પણ તે નીકળી જવી યોગ્ય હોએ નીકળી ગઈ છે એમ ભાનવું શું જોડું છે ?

(૨) ચર્ચાસારના ત્રણે હોટા એઠે મુહુપતિના છે માટે તે કણિપિત છે અને જૂઢા હોએ કેખક અને પ્રકાશકને તુકશાન કરવા સાથે ધર્મને હાનિ કરનાર છે.

(૩) પ્રદર્થનમાં સેંકડો પ્રતોભાં હંજરો ચિત્રો વ્યાખ્યાન પ્રસંગનાં હતાં ને તેમાં એકેમાં મુહુપતિ બંધન ન હતું.

(૪) તથું તથું ચાર કલાક બાંધીને વાંચનારા આપો। દિવસ મુખ બાંધનારને સંમુચ્ચિતમાં મનુષ્યની હિંસા કરનાર કેમ કહેશે ?

(૫) અણુવતધારીને પણ અતિચાર કરનાર એવો કર્ણ-વૈષ સાંધુને પણ કદાચ અનુચિત છતાં કરવો પડશે.

(૬) એક પણ શાખ પાઈ વ્યાખ્યાનના મુહુપત્રિઅધનને વિહિત કરતો નથી, (શાલાંકાચાર્ય ને જિનભદ્રની વિધિગ્રથા ક્યા ભંડારમાં છે ? ) (ચર્ચાસારમાં એટા અર્થો અને એટા પાડો છે.)

(૭) પંચ બસ્તુમાં ૮૫૭ માં ગાથાની ટીકામાં મુખવલ્લિકા યા વિધિગૃહીતથા સ્થગિતમુખકમલઃ

એ પઢો હાથમાં પડકેલી મુહુપત્રિ જ વ્યાખ્યાનમાં મુખ ટંકવાનું રૂપણે લખે છે.

#### જવાણ

ઉપરના ચર્ચાપત્ર સામે પ્રથમ લૈનાચાર્ય વિજયનીતિ-સૂરીક્ષરજી મહારાજના શિષ્ય લૈનાચાર્ય વિજયહર્ષસૂરીક્ષરજી મહારાજના શિષ્ય પંચાસ કલ્યાણવિજયજીનો લેખ નીચે પ્રમાણે છે:-

એક જ શાસ્ક્રીય લીટી પકડી અનર્થ કરનાર એક લેખક શાસ્ક્રીય વાતનો નિર્ણય પ્રત્યક્ષ ભળ્યા છતાં ખુલાસો કરવા મન લક્ષ્યાયું નહીં, અને પેપરો દ્વારા મન લક્ષ્યાય તે કેવું આશ્ર્યો ? પેપરો દ્વારાએ અત્યાર સુધી શાસ્ક્રીય એક ભાષતનો નિર્ણય થએલો વાયકાએ સાંભળ્યો છે કે ?

ફાગણ ભાસમાં અમદાવાદમાં સાંધુ સંમેલન એકન થયેલ હતું. સિદ્ધયક્ષના લેખકે ને ચર્ચા હાલ ઉપસ્થિત કરેલ છે તે ચર્ચા ભાસ અમારે મુનિસંમેલનમાં ઉપસ્થિત કરી નિર્ણય કરવા વિચાર હતો. પરંતુ નગરશોઠના પ્રથમ પ્રવચનમાં '( ભાષણમાં ) ધન્કાર થએલ સાંભળી હૃદયમાં દિક્ષગીરી પેદા થએલ હતી.

અમદાવાદના નગરશોઠના માનની ભાતર અમોએ મુહુપત્રિની ચર્ચા સંમેલનમાં ઉપસ્થિત કરેલ નહોંતી, તે જ વાત સિદ્ધયક્ષનાં

અસાડ સુદ્ધ ૧૫ના અંડમાં ઉપરિથિત કરેલી અમોએ જોઈ, વાંચી, વિચારી, અને પ્રત્યુત્તર આપવા મન પ્રેરાયું છે.

કૈન ડેમમાં અર્થારના સમયમાં અનેક દાવાજિનાં જાગેલી દેખાય છે. તેમાં મારે નવીન અગ્નિ પેદા કરવો તે માઝે કર્તાઓ નથી, છતાં પ્રત્યુત્તર અપાય નહીં તો સત્ય વાતને અસત્યના ઇપમાં સોડો ઘસડી જાય, તેવા જ કારણે મારે પ્રત્યુત્તર આપવાની ક્રમ પડેલી છે.

સત્ય વરતુને અસત્યના ઇપમાં બદલવા ડોછ વ્યક્તિ તૈયાર ચતી હોય તો તે વ્યક્તિએ શાખીય અણુલિકાનું ઉલ્લંઘન કર્યું કહેવાય ને ?

શાખીય ભર્યાદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પ્રમાણિકતાના ઇપમાં હરી શકે કે ? અપ્રમાણિક ઇપમાં આવતાં લખાયો. જનતાને અવળા રરતે હોરી અભોન્નીયાં ઘસડે છે, તેવી જ રીતે ‘સિદ્ધયક્ત’ પાક્ષિકે અસાડ સુદ્ધ ૧૫ તા. ૨૬-૭-૩૪ ગુરુવારના અંડમાં સમાલોચનાના પ્રકરણુમાં ૩૭૬મા પાને એક જ શાખીય લીટી લખી જનતાને અવણે રરતે હોરી છે.

ડોછપણું સાધુ સુહપત્તિ વ્યાખ્યાનાદિ સમયે બાંધે અગર ન પણ બાંધે તેવો અમને કદાયહ કે હક નથી. કારણ દરેક જીવો જે હ્યે તે પ્રમાણે કરી શકે છે, પરંતુ સત્ય વરતુને અસત્યના ઇપમાં ફેરવાની ચાલબાળ ખેલી કોડાને હોરવા માગે ત્યાં તરત જ સંજીવન ભાણુસેણે સત્ય વરતુની ઓળખાણું કરાવવા આ કેખિની તૈયાર થઈ છે. તે વાંચકગણો વાંચી વિચારશે.

સિદ્ધયક્તના કેખક પંચવરતુમાં ૬૫૭મી ગાથાની ટીકામાં—  
“ સુખવાણીકયા વિદ્યગૃહીતયા સ્થગિતસુખકમલઃ ” આ  
લીટી સ્વીકારી અર્થ કરે છે કે “ હાથમાં પકડેલી મુહૂરતિથી જ  
વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટપણે લખે છે.”

ઉપરની લીટીનો ઉપર બતાવેલો અર્થ લખી સિદ્ધયક્તના કેખક  
વ્યાખ્યાનમાં સુહપત્તિ બાંધવાનું વિધાન નથી એમ ૨૫૪૪ણે બતાવે

છે. વાંચડો ! એક જ લીલીમાંથી કેખક મહાશય ! તારવણુ કાઠી જનતાને અવળે રરતે દોરવા પ્રેરાય છે. 'એક ભાણુસ અસત્ય બોલતો હોય તો ભીજને અસત્ય બોલાવવા પ્રેરણુ કરે ને ?'

ધાલ દસકામાં ટેટલાક અધૂરા કેખડો અધૂરં લખી બેન દ્રામભાં વૈભનસથે ઉત્પન્ન કરે છે. અધૂરા લખાણથી અનસ્ય કલેશા હિનપ્રતિહિન ઊડાં ઉત્તરતાં લય છે. વાંચડો ! જ્યાં સુધી સૂત્રોની કે અન્યોની અડધી કે આખી ગાથાએ આગળ કે પાછળના સંઅંધ સિવાયતી લખી, અનઅમતા અર્થો લખી જનસમ્રૂદ આગળ મૂકે તો જનો ભ્રમિત બને કે નહીં ? ભ્રમિત બનાવનાર ભાણુસ કેવો કહેવાય ! તેનો ન્યાય કરવાનું કાર્ય વાંચડોને સોંપું છું.

વાંચડો ! હવે પંચવસ્તુનો પાડ કેવા સ્વરૂપમાં બતાવેદો છે તે પર આપતું ધ્યાન બેંચું છું.

### પંચવસ્તુની ૮૫૭ મી ગાથા—

ઝરો વિઠિઓ સંતો સુણેદ પોત્તાદ ઠદ્દ સુહકમલો ।

સંવિગ્રહ ઉવવચો અચ્ચંત સુદ્ધપરિણામો ॥૯૫૭॥

ટીકા—ઇતરોડપિ—શિષ્ય: સ્થિત: સન્—ઊર્ધ્વસ્થાનેન, શૃણોતિ,  
મુખવસ્ત્રિકયા વિધિગૃહિતયા, સ્થગિતમુખકમલ: સન્ ઇતિ સ એવ  
વિશિષ્યતે—સંવિનો મોકાર્થી, ઉપરુક્ત: તત્ત્વોકાગ્રતયા અનેન પ્રકારેણ  
અત્યન્તશુદ્ધપરિણામ: શુદ્ધાશય: ઈતિ ગાથાર્થ: ॥

**ભાવાર્થ**—સાંભળવામાં તક્ષીન થયેલ, અત્યન્ત શુદ્ધ પરિશુભવાલા, મોકાના અભિલાધી શિષ્યે મુહૂર્તિવડે મુખકમળ સ્થગિત કરીને જિભા જિભા સાંભળવી. શું સાંભળવી ? તે અધ્યાહાર છે.

ઉપરની ગાથાનો અર્થ ગુરુ શિષ્યને ડાંઢક સાંભળવે છે કે શિષ્ય વિનયપૂર્વક, ઉપરોગ સહિત, વિધિપૂર્વક સાંભળવા તક્ષીન થાય છે. આવા ભાવનાળી ગાથાને સિદ્ધયકના કેખક જિલટા

સ્વરૂપમાં ગાથાના ભાગને એક લીટીમાં રથાપિત કરી શું ચિતરે છે !  
 ‘હાથમાં પકડેલી મુહૂરતિથી જ વ્યર્ષભાનમાં મુખ ઢાંકવાનું’ રૂપજી-  
 પણે લખે છે’ આવા અર્થવાળી લીટીને સિદ્ધચક્કામાં લખી જનતાને  
 અવળે રસ્તે હોરવા ચાહે છે ને ? આવા અનેક ક્રોણે  
 અભિત બનાવવા શું પાલિકામાં નહીં આવતા હોય ? વાંચડો !  
 જુઓ શાસ્ત્રીય પદ્ધતિને કંઈ રીતે વર્ણવી લાંબા લખાણો લખાય  
 છે. ભાધાઓ ! અભિત બનતા નહીં, ‘જે થાય તે સારા માટે’,  
 આ સાદી કહેવત યાદ રાખશો.

વાંચડો ! સિદ્ધચક્કના ક્રેબ્ઝક અમેને મુહૂરતિ ચર્ચા-સારમાંની  
 સૂચના કરે છે કે તેમાં ખોટા અથો અને ખોટા પાડો છે. “ચોર  
 કોટવાળને દાઉ છે.” મહાશયો ! ખોટા અથો ડોષ કરે છે ! તેને  
 આ ગ્રથમ પુરાવો જનતાની આગળ રણ્ણ કરેલ છે. તે જનતા  
 વિચારશે તેમજ સિદ્ધચક્કના ક્રેબ્ઝકને પણ જણ્ણાનું છું કે ચર્ચા-સારમાં  
 જે જે સ્થળોએ ખોટા પાડો તેમજ અથો તમેને લાગતા હોય તે  
 અમેને જણ્ણાવશે તો અમે પણ ઉત્સુકમાંથી બચશું. તેનો લાભ  
 તમેને ભળશો, પરંતુ ઉપર પ્રમાણે એક જ લીટી લઈ અમેને સૂચના  
 કરશો. તો તે સૂચના તમેને જ સુપરત કરાશો.

ક્રેબ્ઝક મહાશય ! તમારી થએલી આ ભૂલને તમો પણ  
 સ્વીકારી ખરી વરતુને બહાર પાડશો તો જ જનતા તમારા પર ઝીદા  
 ઝીદા થશો.

ખરી વરતુને છુપાવવી તે સનજન માણુસનો ધર્મ નથી.  
 વ્યાખ્યાનાદિમાં મુહૂરતિ બાંધવી તે અવશ્ય શાસ્ત્રાધારે અમે  
 દેખાડવા તૈયાર છીએ; અને ક્રયાં સુધી, કંઈ વ્યક્તિથી છૂટી તે  
 પણ દેખાડવા તૈયાર છીએ, હજુ પણ બહુતતાએ અમુક સંધાડા  
 સિવાય બધાએ બાંધી રહ્યા છે. નહીં બાંધનારને ડેટલું તુકશાન  
 થાય છે. તેનો તાજો બનેકો દાખલો જનતાની આગળ મૂકું છું.

અમદાવાદ શહેરમાં અમુક... ઉપાશ્રમમાં સ્થિરતા કરતા  
 અમુક... આચાર્ય મહારાજ વ્યાખ્યાનની પીઠ પર બેસી વ્યાખ્યાન

ખૂબ જેરહાર કરી રહ્યા હતા. જુસસાર્માં ચાલતાં વ્યાખ્યાનમાં ભક્ષિકાએ મુખમાં પ્રવેશ કર્યો. કરતાં વ્યાખ્યાનનો ધ્વનિ અટકે છે અને વમનનો ધ્વનિ ઝગ્યે છે. ભાઈઓ ! વિચારનો ! વીતરાગના વચ્ચનામૃતતું પાન કરતાં શ્રોતાએ શું સાંભળે છે ! આ પ્રતાપ કોણો ? વ્યાખ્યાનમાં મુહૂરતિ નહીં બાંધનારાઓના મુખમાં ભક્ષિકા પ્રવેશ કરી શકે કે ? એવા અનેક કારણોએ શાબ્દકાર મહારાજે મુહૂરતિ બાંધી વ્યાખ્યાનાદિક કરવા ભલામણું કરેલ છે.

રીખભદ્રાસ ડવિના હિતશિક્ષાના રાસમાં નીચેનાં પહોના અર્થો કરવા સિદ્ધ્યકના લેખકને મારી ભાવામણું છે.

મુખે બાંધી તે મુહૂરતિ, હેઠી પાઠા ધાર,  
અતિ હેઠી દાઢી થધ, જોતર ગવે નીરધાર;  
એક કાને ધ્વજ સમ કઢી, ખલે પછેડી હામ,  
કુદે જોસી કોથળા, નાવી પુષ્યને કામ !

ઉપરનાં હિતશિક્ષાનાં પહોને વાંચી વિચારશો કે પરાપૂર્વથી ચાલતી આવેલી પ્રણાલિકાનો ધ્વંસ કરી ઉપરતી ખરી વરતુને જોસી બનાવવા કોશીશ કરવી તે સન્જગ્ન માણુસનો આચાર નથી. આટલો દ્રોંક ઉલ્લેખ વાંચી-સમજ પોતાની ભૂલને રમરણું રાખી અટકશો એવી મને આશા છે; છતાં ભાવીના ઉદ્યથી અટકશો નહીં તો વાંચકાને અવળા રસ્તે જવા દેવા તે મારી ભાવના નથી, એમ લખી વિરસું છું. તથારતુ

દી.

લૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજ મહારાજના  
પ્રશિષ્ય પં. કલ્યાણવિજય  
કોટ, વોરા ખલર, મુંબઈ.

: ૬ :

## સિદ્ધુચેઠના પ્રશ્નો.

[ સં. ૧૯૬૦ ના શ્રાવણ સુદી ૧૫ તા. ૨૪-૮-૩૪ શુક્રવાર  
અંક. ૨૨ વર્ષ ખીજું. ]

૧. પંચવરસુની દીક્ષામાં—“ વિભિન્હીતયા સુસ્વર્ગિકણા સ્વર્ગિ-  
તમુખક્રમઃ ” આનું રૂપષ્ટ વ્યાખ્યાન છતાં બાંધવાનો અર્થ કર્યો  
તે ખોટા નથી ? કેખમાં સંરક્ષિતપાઠ આપ્યા છતાં આ વાક્યનો તો  
અર્થ જ નથી આપ્યો.

૨. અમદાવાદના શ્રીમાન નગરશેઠની પાસે મુહુપતિની ચર્ચા  
સંમેલનમાં નંદી કરાવવાની કખૂલાત મુહુપતિ નંદી બાંધનાર પણે  
લીધી નથી.

૩. ભાષાસમિતિ અને વચનગુમિના પ્રસંગો ભાગ વંધનમાં  
જોડવ્યા છે તે ખાદું છે.

૪. આ ચર્ચાપત્ર લખાવીને અને ઉપાડેલી છે. પાક્ષિક તેમાં  
નિષ્ઠળતા અને શાન્તિના ભંગના ભયે ઉત્તરવા માગતું જ ન હતું.

૫. પંચવરસુની ગાથા ગુરુના નંદી વ્યાખ્યાનના કથનને  
શિષ્યના તે અવણુ વખતની ને અધિ શબ્દના યોગ્યે સમાનતાને  
સુચ્યવનારી છે તે જેથું હોત તો ભાલમ પડત.

( કેખકે અન્ય જોયો જ નથી તેથી કંઈક સંભળાવવનું છે  
એમ લખે છે )

**દીર્ઘબુદ્ધિ—**પ્રથમ અને પાંચમાં નંબરમાં કેટલો તદ્વાત દેખાય છે.  
પંચવરસુની ગાથામાંની દીક્ષા પ્રથમ નંબરમાં લીદીમાં પકડી અવળા અર્થની  
પુષ્ટિ અને પાંચમાં નંબરમાં ગાથામાં રહેલો ભાવ ગુરુના નંદી વ્યાખ્યાનનું  
કથન ને શિષ્યનું અવણુ છતાં અર્થને કેવો મરડે છે તે જ પોતે પોતાના  
આતમાને અવળા અર્થ કરતા દેખાડી આપે છે. આ તે લિઙ્ગતાને ? આવી જ  
વિદ્વત્તાવાળા જીવોને વિદ્વાન તરીકે કૈન શાસુન ગણું હોય તેમ વાંચકોને  
લાગે છે ?

પ્રશ્ન તા. ૧૨ એણસ્ટ ૧૯૩૪ ના જૈન પત્રના અંકમાં

એક જૈન મુનિકારાએ મુહુપતિ ચર્ચાનું સ્પષ્ટીકરણ કરતાં  
સોલ મુદ્દાએ રજૂ કર્યાં છે તે નીચે પ્રમાણે—

( હાથમાં જ્યારે ડિયાવિધિની નિરર્થક ચર્ચાનો અમલ નથી  
ત્યારે મુહુપતિ ચર્ચાનો અન્ય અંડાર પડવાથી નીચેના ખુલાસાથી  
આવી ચર્ચાનો અંત આવે તેમ આશા રાખીએ.)

૧. કુવનભાતું ચરિત્ર અને ભવનભાવનાની વૃત્તિમાં વિકથા  
અને પરપરિવાદના ત્યાગને આવિકાએ મુખઅંધન ગણ્યું છે, છતાં  
તે અન્યો અને તે ઉપરથી અથેલ રાસના નામે સ્વાધ્યાયમાં મુહુ-  
પતિ બાંધવાતું ગોડવાનું નિરર્થક છે.

૨. ચર્ચા ઉપાસક યા પૂર્વપુરુષો કે કોઈની પણ સાધીએ  
સ્વાધ્યાય પ્રસંગમાં મુહુપતિ બાંધે છે ?

૩. ડિલ શિક્ષાના રાસમાં હાથમાં મુહુપતિ રાગી વ્યાખ્યાન  
કરવામાં અનિષ્ટતા ક્યાં અતાવી છે !

૪. અનેક સૂત્ર અને અન્યોભાં પડિશેષુનો વિધિ સવિસ્તર  
છતાં તેમાં નહી જણ્ણાવેલ મુખઅંધન અદ્ધાળુને નવા અન્યોથી અદ્ધા  
કરવી કેમ થાય ?

૫. વચનગુમિમાં મુખનું આચછાદન કલ્યા છતાં બાંધવાતું  
કલેનારે વચનગુમિના વખતમાં સર્વત્ર મુખ-અંધન કરવાતું કેમ  
પાલનતું નથી ?

૬. મુહુપતિની જણ્ણાવતાં દોડ શાબ્કાર એક મુહુ-  
પતિ જણ્ણાવે છે. તો વ્યાખ્યાનમાં મુહુપતિ બાંધવારને મુહુપતિએ એ  
રાખી પડે છે; માટે તે સર્વ તો તે શાબ્કોથી વિરુદ્ધ છે, એમ  
નણ્ણા છતાં કેમ આગ્રહ કરાય છે ?

૮. વિચાર રત્નાકરતું કાણ્ણ વ્યાખ્યાન વખતની દશા માટે છે.  
એનો કોઈ પુરાવો નથી. સભાતું ત્યાં નામનિશાન પણ નથી.  
તેમજ તેની મુદ્દાતું વર્ણન હોવાથી હાથથી મોઢે મુહુપતિ રાખી  
એમ સ્પષ્ટ થાય નહી.

૬. કેવળ હાથથી જ ચોગમુદ્રા થતી હોવાથી ને તેમાં મુહુપતિ ધારણું કરવાનો વિશેષ જણાવવાથી રૂપણ થાય. છે કે વ્યાખ્યાન વખતે આચાર્યો હાથમાં જ મુહુપતિ રાખતા હતા.

૭૦. કાળે કાઢવાનો જે રૂપણ પાડ સ્ક્રો અને અન્ધોમાં છે તેને ડોધ પણ કણુલ ડર્યો વિના રહેતું નથી. વ્યાખ્યાનમાં મુહુપતિ બાંધવાતું વિધાન કરનારો તેવો એક પણ પાડ અપાણો નથી, પંચવસ્તુ અને અહિન્દ્રાજ્ય નેવા અન્ધો તો વ્યાખ્યાનમાં મુહુપતિ હાથમાં રાખવાતું રૂપણપણે જણાવે છે.

૭૧. આચાર્યાદિત, અંચિત, રથમિત શખદો બંધન અર્થવાળા જ છે એમ કહેનારે શાસ્ત્રો અને ડોશાદિ તપાસવા. વસતિ પ્રમાર્જન ને મૃતકને અંગે તો ચોકણો બંધનનો પાડ જ છે.

૭૨. વાચના કેનારે મુખવસ્ત્રિકા બાંધવી એ હકીકત નવાધની હોવા સાથે મુખ બંધનવાળા પણ તેમ કરતા નથી.

૭૩. પ્રવચન મુદ્રા એક હાથે હોવાથી પુસ્તક સાપડા ઉપર કે ઝોળામાં રાખી એક હાથે મુહુપતિ રાખી શકાય.

૭૪. શાલાંગાચાર્યનો પાડ નિવેશિતનો છે તથા કાનથી લઈને મુહુપતિ મહેાડે રાખવાનો છે; પણ છાડવા માટે કે બાંધવા માટેનો તે પાડ નથી.

૭૫. મહાનિશિથમાં વંદન, પ્રતિક્રમણ, અગાસુ વિગેરેની માદ્રક જ સ્વાધ્યાય અને વાચનાદિ (વાચના, પૃષ્ઠના, પરાવર્તના, અનુ-ગ્રેક્ષા અને ધર્મસ્ક્રિય વ્યાખ્યાનમાં) મુહુપતિ રાખવાતું રૂપણ સૂચવે છે.

૭૬. ધન્દ મહારાજ ધર્મદેશના વખતે મુખ અને નાક બાંધતા હતા એવી નવી શોધ આ ચર્ચા-સારમાં ભણે છે, જ્યારે ઉપાધ્યાયજી તો પૂજા અને દેશના વખતે ધન્દ મહારાજ મુખ ટાંકે છે એટલું જ કહે છે.

**દેખકાની મુનિ**

**શ્રીરૂપણ:**—દેખકાના હૃદયમાં પોલ લાગે છે. નહી તો પોતાતું નામ શાને છુપાવત ? ચર્ચા-સાર મનતપૂર્વક વાંચેલ દેખાતું નથી એટલે જરૂ.

: ૧૨ :

તા. ૨૬ મી ઓગસ્ટ ૧૯૩૪. એક ખુલાસોનો।

જવાબ.

તા. ૧૨ મી ઓગસ્ટ ૧૯૩૪ ના શાવણુ સુદ્રિ ૨ “જૈન” પત્રમાં “મુહુપત્તિ ચચૌતું રૂપણીકરણુ”ના ભથાળા નીચે જે ૧૬ મુહાઓ “જૈન સુનિ” ના નામથી પ્રગટ થયા છે તે વાંચતાં નનામા કેખનોનો જવાબ આપવો તે જે કે ઉચિત નથી; કારણ કે નામ-વિનાની પ્રગટ થતી કેખભાળા બદે અગે તેટલી ઉચ્ચા હોય કે અર્થ વિનાની હોય એમ છતાં તેની કિંમત એક કુટી અદામ કરતાં વધારે ગણી શકાય નહીં.

આ ચચૌ એવી રીતે રજૂ કરવામાં આવી છે કે તેમાં નથી શાખાદિષ્ટે પ્રક્રષ્ટ કે નથી કોઈ પ્રાચીન પ્રમાણુ. ભાત્ર તર્કની દષ્ટિએ આ અધા પ્રક્રો તૈયાર કરવામાં આવ્યા હોય એમ જણાય આવે છે. ભાત્ર શાખોના નામો આપી કેખક એઠલું જ જણાવે છે કે “મુહુપત્તિ હાથમાં રાખી વ્યાખ્યાન વાંચવાતું રૂપણ વિધાન છે, અને મુહુપત્તિ બાંધી વ્યાખ્યાન વાંચવાતું નથી.” પરંતુ શાખાના પાડો વિનાતું આ વિવેચન શા કામતું !

ભાત્ર એક જ દલીલથી કેખનો જવાબ આવી જય તેમ મને લાગે છે. આર ભાતસની સંપત્તસરીના હિવસે સુનિમહારાને ભારસા સુત્રતું વાંચન સભા સમક્ષ કરે છે. વાંચનાર સુનિરાને એક સમયમાં એ ઉપયોગવાળા બને છે. એક હાથમાં ભારસા સુત્ર, બીજી હાથમાં મુખ્યાંબિકા. ગૃહરથો બઢાવો બોલી ભારસાનાં ચિત્રો અતાવવા બેભા રહે છે. ચિત્રો અતાવવા બેભા રહેનાર ગૃહરથ મુખ-ક્રાય બાંધી ચિત્રો અતાવે છે. આ બંને જણાઓમાં મહાવીરનો આરાધક ડોષ ? તે પ્રશ્નનો કેખક વિચાર કરશે કે ? ગૃહરથને ચિત્રો અતાવતી વખતે બોલવાતું નથી છતાં પણ મુખોકાશ અંધા-વાય છે. અને સાધુને સભા સમક્ષ ભારસા “જોાકતું” વાંચન કરવાતું છે તો તે સાધુઓનો ઉપયોગ પાનામાં કે હાથમાં રહેલી મુહુપત્તિ-માં ? આ બધોએ વિચાર વાંચકગણને સુપ્રતી કરે છું.

‘ચોર ડાટવાળને દાડુ’ એ ન્યાયે હાલની પ્રવૃત્તિ ચાલી રહેલ છે. સત્ય વાતને અસત્યમાં ફેરવા ડારીશ કરાવાય છે.

અસાડ શુદ્ધ ૧૫ ના સિદ્ધચુકના અંડમાં પંચવરસુની ગાથાની ટીકા અનર્થ કરનારી બાતાવેલી હતી. તેવું ન અને ! તે ધ્યાનમાં રાખશે.

અર્થી ઉપરિથિત કરનારાયોગે જે જે પાડો આપવા વિચાર હોય તે પાડો સંબંધ વગરના આપવા મહેરભાની કરશે. નહીં; નહીં તો ઉત્કુષ્ણભાષી અનશે.

અમારું સુહપત્તિ ચર્ચા-સાર નામતું પુરતક સંમેલન પહેલાં જહાર પડેલ હતું. મને પુછનારાયોગને મેં સંમેલનમાં વાત કાઢવા સ્થયના કરેલ હતી, છતાં પેપરોદારા ચર્ચા ચલાની રહ્યા છે એ અમે યોગ્ય માનતા નથી, કારણું કે આવી ચર્ચા પેપરોના પાને અઠાવી નકારો નિધ્યવાદ વધારવામાં લાભ શું ?

ઉપરના સંબંધમાં મુનિરાજે પૂછેલી કલમોને સમાવેશ થઈ જાય છે, છતાં જુદી જુદી કલમોના પ્રત્યુત્તરો આપવા મન લલચાય છે, પરંતુ બેખડ મુનિરાજ ચોતાતું નામ જહેર કરે તો અમે જવાય આપવા ખુશી છીએ. અને પાહાના ફકરાઓ સહિત અવસ્થ ચાસ્કીય દિશિએ વાતને સિદ્ધ કરવા મારું મન પણ દોરાય છે. નનામા બેખડાને માટે નહીં, કારણું કે આ ચર્ચાના નેખમદાર ડોણું ?

બેખડ મુનિ મૃતકને મુહૂરતિ બાંધવાતું સ્વીકારે છે એટલી તેમની સરલતા લાગે છે.

અરસુ.

કુટુંબ	}	બેખડ:	બેખડ:	બેખડ:
વેરાઅનાર				

મુંબઈ સમાચાર શનિવાર

તા. ૧૩ અક્ટોબર ૧૯૩૪

લેખક:—જૈન

પ્રલૃપૂજન વખતે અને શાસ્ત્રવાંચન વખતે જૈનોને એક ભાગ મુખ ઉપર એક લુગડું આંધે છે. અથવા ખરા કષ્ણો મૂકીએ તો પ્રલૃપૂજન વખતે સુખદોષ આંધે છે અને શાસ્ત્રવાંચન વખતે સુહપત્તિ આંધે છે. આ મુખ આંધનાર વર્ગ તે શૈતાભર મૂર્તિપૂજક વર્ગ. એ સિવાય જેઓ મૂર્તિપૂજક નથી તેઓ આખો નિવસ અને રાત દરેક પ્રમંગે મુખ ઉપર સુહપત્તિ આંધેલી રાખે છે અને જ્યારે આહાર આને પાણી પીકું હોય ત્યારે જ તે સુહપત્તિ દૂર કરે છે. ઉપલા સુહપત્તિ આંધનાર વર્ગમાં એ પક્ષ છે. એ આ વીગતોથી ખુલ્લું જણાશે કે પહેલો વર્ગ શાસ્ત્ર વાંચતી વખતે જ સુહપત્તિ આંધનાર વર્ગમાં એ પક્ષ છે. એ આ નિગતોથી ખુલ્લું જણાશે કે પહેલો વર્ગ શાસ્ત્ર વાંચતો વખતે જ સુહપત્તિ આંધે છે, જ્યારે બીજો વર્ગ આખો નિવસ. રાત-માત્ર આહારપાણી કેવાના વખત સિવાય સુહપત્તિ આંધે છે. આ બંને વર્ગ વચ્ચે સુહપત્તિની ચર્ચા આશરે ૩૦-૩૫ વર્ષો અગાઉ થતું હતી. તે વેળાએ સ્થાનકવાસી સમુદ્ધાયના શ્રી વાડીલાલ મોતીલાલ શાહે તેમાં ભાગ લઈને એવું અતાવવા પ્રયત્ન સેવ્યો હતો કે જેઓ આખો નિવસ રાત સુહપત્તિ આંધે છે તેઓ જ મહાવીરના ખરા અતુયાયાઓ છે; જ્યારે જેઓ થોડા વખત સુહપત્તિ આંધતા હતાં તેઓ અને તે સિવાય સુહપત્તિ નહીં આંધવા. હતાં શાસ્ત્રો વાંચનારાઓ શ્રી મહાવીરના ધર્મથી વિમુખ હતા. આ ચર્ચાએ અહુ ઉચ્ચ સ્વરંપ લીધું હતું અને સામસામે અહુ લખાયો થયાં હતાં, પણ તેનો અંત આવ્યો ન હતો. થોડા વર્ષો અગાઉ એક પુરઠક એક સ્થાનકવાસી સુનિરાજ તરફથી અહાર પડ્યું હતું તે પુરઠકમાં શ્રી મહાવીર અને તેમના ગણધરો તેમજ તેમના પછીના આચારો સુહપત્તિ આંધતા હતા તેવું દેખાડનાર તેઓનાં ચિત્રો આપવામાં આવ્યા હતાં. અને જેઓ તેમ નહીં કરના હોય તેઓને ધાણું જ ઉંડેરણી કરનારા વિશેષજ્ઞો લગાડવામાં આવ્યાં હતાં. આ પુરઠક સામે ચેતાંગરો તરફથી મેટો ખગભગાટ થયો હતો.

અને તેમો તરફથી તેનો વિરોધ કરનારા લેખો પણું પ્રગત થયાં હતાં. પણું ડોચ વ્યવસ્થા પ્રમાણે કામ નહીં થવાથી તે બાપ્ત પણ પાછળથી પડતી મુકાઈ હતી. શેવેતાંઅર મૂર્તિપૂજાને અને સ્થાનક-વાસીઓ વર્ષોની સુહૃત્તિ ચર્ચા, આ ઉપરથી જણ્ણાંશે કે વર્ષોં અગાઉ પડતી મુકાઈ હતી અને સૌ સૌના વિચાર સ્વાતંચ્યમાં ધૂમી રહ્યા હતા, એ ચર્ચા દરમીયાન અને તે અગાઉ ૧૦-૭૦ વર્ષું પર શૈતાંચરોમાં એક નીળ પક્ષે જુદી જ વળણું બતાવી હતી. એ શીળ પક્ષની ભાન્યતા એ હતી કે શાસ્ત્રો વાંચતી વખતે સુહૃત્તિ બાંધવી જ જોઇએ એવો આશ્રદ્ધ રાખવાની જરૂર નથી. શાસ્ત્રોની આશા-તના નહીં થાય તેવી રીતે જે શાસ્ત્રોનું વાંચન. કરવામાં આવે તો આશાતના દાળવાનો જે હેતુ રાખવામાં આવો છે તે પાર પડતો હેવાથી, સુહૃત્તિ સુખ આગળ, શુંક પુસ્તક પર નહીં પડે, તેવી રીતે રાખી શકાય અને તેમ કરવાથી શાસ્ત્રોની આશાતના ટણે છે. સ્થાનકવસીઓની સાથે ચર્ચામાં ઉત્તરી તેમોને પોતે માનેલું સત્ય સમજાવવામાં નિષ્ઠાન નીવડેલો પક્ષ શાસ્ત્રવાંચન વખતે સુખ આગળ સુહૃત્તિ રાખવા જણ્ણાવનાર પક્ષ તરફ. આ વખતે શાસ્ત્રાજ્ઞા બંગ કરનાર તરીકે જોવા લાગ્યો અને તે કારણથી અરસ્પરસ ચર્ચા ચાલી. દરેક પક્ષે પોતાના સમર્થનમાં શાસ્ત્રના પોથા તે વખતે આગળ કર્યા. એમ કહેવાય છે કે શ્રી વિજયાનંદસુરીજીની હૃયાતીમાં આ ચર્ચા પંન્યાસળ શ્રી રત્નવિજયજી મહારાજને ચોડીએ. મારફતે શ્રી સુણયંદળ મહારાજ સાથે સર્વ ફરેલી અને તે બાદ શ્રી વિજયાનંદસુરીજી સાથે પણ થએલી. એમ કહેવાય છે. શ્રીમાન બુટેરાયજી મહારાજને જે શાસ્ત્રોના પાઠ બરાબર સમજાવવામાં આવ્યા હોત તો તેમો સુહૃત્તિ બાંધવાની તર-ફેણું કર્યા વગર ન રહેન. વળો શ્રી આંતમારામજી મહારાજના હરતે સં. ૧૯૪૭ના વર્ષમાં લખાએલો એક પત્ર રજુ કરીને એવું દર્શાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. છે કે તેમોએ એ પત્ર મારફતે જણ્ણાંયું છે કે “સુહૃત્તિ બાંધવી સારી છે અને જે રિવાજ પરંપરાથી ચાલ્યો આવ્યો છે તેનો લોએ કરવો હીક નથી.” આ બધું એમ કહેવાય છે

ક આ 'દેવ ભક્તિમાળા'માં પંન્યાસજુ દેવવિજયજુ મહારાજે એણું જણાયું છે કે સુહપત્તિ બાંધવાનાર પક્ષની હાર થવાથી એ ચર્ચા બંધ થઈ હતી. જ્યારે પંન્યાસજુ રલવિજયજુ મહારાજ કે જેઓએ શ્રી મૂળયંદજુ મહારાજ સાથે ચીડીએ લખીને ચર્ચા શરૂ કરી હતી તેઓ એમ જણાવે છે કે સંધમાં ડાઇપણ રીતે વિક્ષેપ ન પડે આટે ચર્ચાનો અંત લાગવાની અમારી છંદળ હતી, પરંતુ અમોએ ઘણો પ્રયત્ન કર્યો છતાં તેને અંત આવી શક્યો નહી અને તેનું પરિણામ વિશેપ વિખવાદમાં આવશે એમ ધારીને અમોએ એ ચર્ચા છોડી દીધી." બનનાનોંગ છે કે પંન્યાસજુ દેવવિજયજુ મહારાજે આવી રીતે આવેલા અંતને હાર તરીકે વર્ણવી હોય. પંન્યાસજુ શ્રી રલવિજયજુ મહારાજની સંકલના ઉપર જણાવેલી વિગતો પરથી જણાશે કે વિરોધી પક્ષને જીતવાને બદલે શૈતાંખર મૂર્તિપૂજકોમાંથી એ પક્ષ શ્રી મૂળયંદજુ મહારાજ અને ભૂટેરાયજુ મહારાજના વખતમાં પડ્યા અને વિજ્યાનાંદ્સ્કુરિજુ પણ સુહપત્તિ બાંધવાની પરંપરાને વખાણુનાર છતાં, તેઓએ સુહપત્તિ હાથમાં રાખીને અશાંતના ન થાય એવી રીતે શાસ્ત્રો વાંચવાની પ્રથા ચાલુ રાખી. સુહપત્તિ બાંધવાની ચર્ચા ચીડીએ લખીને શરૂ કરનાર પંન્યાસજુ મહારાજે એ વખતે ચર્ચાનો અંત લાગવામાં સંધવિક્ષેપ નેચુ એ ચર્ચા પડી મુક્તી હતી, એમ તેઓએ લખ્યું છે એમ ઉપર જણાવવામાં આવ્યું છે પણ એ ચર્ચા પડતી મુક્તા છતાં પોતે જ નીડીએ લાગી હતી. તેને અને તેના જ જવાએ મળ્યા હતા, તેને તેમજ શાસ્ત્રના સુહપત્તિ બંધનના પોથાને એક પુરલક્ષમાં તેઓએ એકડા કર્યી અને તેને નોંધી રાખ્યા. એ વખતે ખુલ્લા એ પક્ષ પડ્યા. એક પક્ષ વાંચન વખતે મેં અને નાક ઉપર બંધાય એવી સુહપત્તિ કાનના છેદમાં તેના છેડા ખોસીને શાસ્ત્ર વાંચતો, જ્યારે ખીંચે પક્ષ હાથમાં સુહપત્તિ સુખ આગળ રાખીને, શાસ્ત્ર આશાંતના ન થાય એ રીતે શાસ્ત્ર વાંચતો. આ બંને પક્ષો હજુ પણ વિઘ્નમાન છે અને તેમાં પહેલા પક્ષમાં મુખ્યત્વે શ્રી વિજયસિદ્ધિસ્તરીશ્વરજુ મહારાજ, શ્રી વિજયનિતિસ્તરીશ્વરજુ મહારાજ, શ્રી વિજય હર્ષસ્તરીશ્વરજુ મહારાજ અને તેમના શિષ્ય સમૃદ્ધાય સુખ્ય છે. ખીંચ પક્ષમાં ઉપરોક્ત આચાર્યો સિવાયના આચાર્યો અને તેમના

સાધુએ મુખ્યને જણાય છે. આ આચાર્ય મહારાજેમાં મુહુપતિને મનુષે છતાં તેઓ અમદાવાદખાતે છેંદા ગેલા સાધુ સંમેલનમાં એકત્ર એહા હતા અને સુલેહ-સંપત્તિ દેડ કાર્બનાં એક સાથે મળેને કામ કર્યું હતું, પણ એ છતાં પહેલા પક્ષને બીજે પક્ષ મુહુપતિ આંખોને ન હતો, રેથી શાસ્ત્રજ્ઞનો જંગ કરતાનો અને તે કારણે બીજાનો આઠત્સાનો દ્રોહ થવાનો બધું લાગ્યો. અને તેઓને સત્ત્વ ધર્મ પર લાવવા માટે તેઓએ સાધુ સંમેલન મળવા આમાં આગળ જણ્યું વેલે. પંનાસજ મહારાજ શ્રી રલપિંડયણને એકત્ર કરેલ વિગતેના અન્થનો સાર તૈયાર કરીને “શ્રી મુહુપતિ જર્ણી-સાર” નામે પુસ્તક અસરાને તે પ્રગટ કર્યો. એ પુસ્તક પ્રગટ હતાં બીજું પણ તે સાથે અગ્રાહી અભિહૃ મૂળચંદજી મહારાજના વખતમાં જાન્મું હતું તેમ બાટો કરવા માંણી અને મુનિ સંમેલનના વખતે પહેલા પક્ષના એ આગેવાન આચાર્યેની બીજી પક્ષના આગેવાન આચાર્યોને ચોટે માનેલો સાર ધર્મ સમજાવવા ચર્ચાભાં કિનરવા તૈયારી કરતાની. એબ કહેવાય છે કે મુનિસંમેલનને, પહેલે જ હિસે, મુનિ સંમેલનને આંગંખુ આપનાર, અમદાવાદના નભરશૈઠ, મુહુપતિની કે ગચ્છની સમજારીની ચર્ચા નહીં હસ્તા સર્વેને વિનિતિ ડરવાથી મુહુપતિની ચર્ચા થાક ઘરાધ નહીં, અને તે જાંક મુનિ સંમેલન પૂર્ણ થતાં એક પક્ષ મુંખાદમાં આવ્યો. અને આતુરીસની સ્થિતિ મુંખાદમાં કરી કિપર જણાયા પ્રમાણે શ્રી મુહુપતિ જર્ણી-સાર નામનું પુસ્તક એ અગ્રાહી પ્રગટ થઈ ગમું હતું. અને તેનો આધાર વખતાથી સામે બીજા પક્ષે ગોતાની હસ્તકના એક ભાસિકમાં ડટલાક બહુ કુંડા લખાયો. ડાધના નામ લીધા વગર પ્રગટ કર્યો અને તેમાં એવું જણ્યાવવાની ડાસેણ કરી કે મુહુપતિ હાથમાં-રાખીને આસ્તાતના ન થાક તે રીતે શાસ્ત્રો વાંચવાના પાઠ શાસ્ત્રોમાં ભણ્ણી આવે છે.

ઉપરોક્ત ભાસિક પત્રમાં મુખ્ય ક્રેચ તરીકે આચાર્ય શ્રી આગરાનંદસુરિણ છે. અને તે ભાસિક પત્રનું નામ શ્રી ‘સિદ્ધચંદ્ર’ છે

એ ભાસિકમાં ભાત્ર કૈન ધર્મને લગતી આખતો ચર્ચવામાં આવે છે અને તે ભાત્ર કૈન ડોમમાં ફેલાયલું જ પત્ર છે. એ પત્રમાં જે ટીકા ડાઇપણું સાંધુ કે 'આચાર્યતુ' નામ લીધા વગર થાય છે. તે ખાડું દુંડી હોય છે અને તે શંકાના સમાધાન તરીકે જ શાખાવારે લખાય છે એમ તેમના સંચાલક જણાવે છે. શ્રી "મુહુપત્તિ ચર્ચા-સાર" ના પુસ્તકમાં આશરે દોઢસે પૃષ્ઠો બરીને ભાખ્યાદી વિગતો સામે ઉપરોક્ત 'સિદ્ધયક' માં ડાઇ એકાદ લીટી લખતાં પહેલા પક્ષના એક સુનિરાજે સુંબદ્ધ સમાચારના તા. ૮ એગણના અંકમાં જૈન સમાજ સાવધાન એકજ શાખીય લીટી પક્ષી અનર્થ કરનાર એક બેખ્ક એ ભથ્થાળા હેઠળ એક લીટીની સામે એ કોલમનો એક બેખ્ક પ્રગટ કરાવ્યો, એક લીટી લખનાર એક આચાર્ય હતા. એ ડોલમ લખનાર એક સુનિરાજ હતા. આચાર્યની એક લીટી સામે લખતાં સુનિરાજશ્રીએ જે કેટલીક આખતો લખી હતી તેને શાખાપોથા સાથે કે મુહુપત્તિની ચર્ચા સાથે શું સંબંધ છે તે સમજ શકાતું નથી, પણ તેમણે સુંબદ્ધમાં શાંત વાતાવરણમાં જવાળા પ્રગટાવી છે અને આચાર્યો અને સુનિરાજને પોતાના જેવા બીજા આચાર્યો સામે ડેવી રીતે લખ્યો શકે છે તે જેવાતું ભાગ્ય સુંબદ્ધના કેનોને પ્રાપ્ત થયું છે. "એક જ શાખીય લીટી પક્ષી અનર્થ કરનાર બેખ્ક" વિષે લખતાં જે પ્રથમ વાક્ય લખાય છે કે આવી ચર્ચા છાપાઓમાં કરવી નકારી છે એમ લખનારની મનોદાશ જણાવે છે તેથે લખે છે કે "શાખીય વાતનો નિર્ણય કરવા મળ્યા છતાં ખુલાસો કરવા મન લલચાયું નહીં અને પેપરો દ્વારા મન લલચાય તે કેવું આશર્ય ! પેપરો દ્વારા આત્માર સુધી શાખીય એક બાખતનો નિર્ણય થયેદો વાંચકોએ સાંભળ્યો છે ? અને તે છતાં પેપરો દ્વારા જ બેખ્ક લખ-વામાં જ નિર્ણયો આવી જશે એમ ભાનીને સુનિરાજશ્રી એક શાખીય લીટી લખનાર આચાર્ય મહારાજને અનર્થ કરનાર બેખ્ક તરીકે જણાવી, તેમના ઉપર શુર્સો ઢાલવતાં જણાય છે. સુનિરાજશ્રીને સંમેલનમાં સાથે એસીને અનેક નિર્ણયો કરનાર સુનિરાજે જૈન શાખીય વાતાને કૈન છાપાઓમાં ચર્ચો તો જૈન ડોમ તેનો વધુ

લાભ મેળવી શકે. સાગરાનંદજી મહારાજે તેમના લખાઓલા પુસ્તકમાં પ્રગટ થયેલી બાધ્યતોની સમાચોચના જૈન છાપા સિહ્યકમાં કરી હતી, અને જે તે છાપામાં તેનો પ્રત્યુત્તર અંગત ફુમલાઓ કથી વગર અપાય તો તેમાં જેઓને સત્યનો પ્રકાશ કરવાની હેંથ છે તેઓને તેમજ જૈન જનતાને લાભ થયા વગર રહે. નહી તેમ ન કરતાં અન્ય છાપાઓમાં તેને લગતી શાખીય ચર્ચા કરવામાં જેઓને જૈન શાખો વિષે માહિતી નથી, એથી આગળ વધીને જણ્ણાવીએ તો સુનિરાજશ્રીના પોતાના લઘ્યા પ્રમાણે છાપાઓમાં વેખો લખીને આવી ચર્ચાઓનો અંત આવ્યો. નથી તો તે જ સુખ તેઓશ્રી પોતે જ શા માટે કરે છે ? આવી શાખીય ચર્ચા રખ્યાં મળાને જ કરવાનું છદ્ધ હોય તો ચાહુમીસ પછી ડોર્ડ સ્થળે તેઓ બંને પક્ષો મળે અને સાંભસાભા શાખાના પાડો શ્રીમહા નેમીસરી-શ્રેણી કે શ્રીમહા વિજયસિહ્યસ્તુર્ભિ સમક્ષ રજૂ કરીને, તટસ્થ દાષ્ટિએ જીત મેળવવાની છદ્ધા આંભસાક્ષીએ રજુ કરીને તેના અર્થ સમજવા ડોરેશ કરે તો અત્યારે જે મતબેદ, અભિમાન અને કુસંપત્તી તરફદોરી રહ્યો છે તે જુદો જ માર્ગ કે અને બંને પક્ષો એક એકના દાષ્ટિબિંદુ અને અર્થ સમજ શકે. તેમ કરવાથી પ્રેમ વખવાનો સંભવ છે; જ્યારે હાલની રીતિ તેથી જીલઠી સ્થિતિમાં તેમને અને તેમના અનુયાયીઓને સુકરે.



## જૈન લેખકને પ્રત્યુત્તર

મુંબઈ સમાચાર તા. ૨૭ અક્ટોબર ૧૯૩૪

લેખક:-પણ. કલ્યાણવિજય

મુંબઈ સમાચાર તા. ૧૩ અક્ટોબર ૧૯૩૪ આસો શુદ્ધ  
પઠા રોજ જૈન ચર્ચામાં મુહૂરતિની ચર્ચા વિષેનો લેખ જૈનના  
નામથી અંકિત થયેલો છે. મેં તે લેખનું અવલોકન કર્યું. વિચાર્યું  
આ મુહૂરતિ ચર્ચાની સ્થાનકાવાસી સાથે અસરાંધવાળી છે. સ્થાન-  
કાવાસી સાધુઓ આખે હિસ્સ મુહૂરતિ બાંધી રાખે છે. જૈન  
દ્વેતાબાં મૂર્તિપૂજા સાધુઓ તો વ્યાખ્યાન સમયે સ્થાનિલ  
ભૂમિમાં, મૃતક મુનિને અને સ્થાપનાર્થી પ્રતિક્ષેપનમાં વિગેર  
સ્થળોએ મુહૂરતિ કાને લગાવી, નાક પર રાખી, બાંધવાનું સ્પર્શ  
વિધાન કરે છે સ્થાનકાવાસી મુનિઓ તો હોરી મુહૂરતિએ બાંધી આડે  
પહેંચ રાખે છે. બંનેમાં આટલો બધી તદ્દનત હેખાય છે, તેથી  
બંનેનો મુકાયદો અસ્થાને છે. મુહૂરતિ ચર્ચા હિયા વિષયક છે.  
જેટલી હિયાની શિથિલતા તેટલી ધર્મની શિથિલતા તમોને શું  
નથી લાગતી? પૂર્વે જેટલા હિયોદ્ધારો થયા તે શાથી થયા?  
સતતરમા ચૈકામાં પંન્યાસળ સલવિજયજી મહારાજે હિયોદ્ધાર  
કર્યો તે શાથી કર્યો હતો? એના પૂર્વે અક્ષર બાદથાહ પ્રતિષેધક  
સુરિસાદ્ર જગતયુર વિજયહીરસ્ફુરીશ્વરજી મહારાજે નિયમાવલી  
તૈયાર કરેલી તે શાથી કરેલ હતી? એના પૂર્વે આનંદવિમળજી  
મહારાજે હિયોદ્ધાર કરેલ હતો. તે પણ શાથી કરેલ હતો? આવી  
રીતે પરંપરાપ્રથમાલિકાનો વિચાર કરીએ તો આત્મવિકાસી  
માણુસો અવશ્ય શિથિલતાને નાયુદ કરી વિકાસ ભાવનાને પેદા  
કરે છે, તો વિકાસ ભાવનાને પેદા કરવા સિદ્ધયક્તિરે મુહૂરતિનું  
પ્રથમ પગથિયું સ્વીકારી ભનની ભાવનાને હોરી હોય એમ તમો-  
ને શું નથી લાગતું? સિદ્ધાચ્છકના લેખક તમારા લખવા પ્રમાણે  
આનંદસાગરજી મહારાજ છે, પરંતુ સાગરાનંદસ્ફુરીશ્વરજી મહારાજ  
મારા અનુભવ પ્રમાણે હોય, પગ વગરની એક લીટી પકડી અન્ય  
અર્થ કરે તેનો મને સંભવ નથી, અન્ય અર્થ કેવો તેનો પુરાવો

જે કે મેં આપેલ છે, હતાં આ સ્થળે વાંચકોની જણુ ખાતર  
આપું શું,

પંચવસ્તુ અન્ય તે સુરતવારી શેડ હેવચાંડ લાલભાઈ પુસ્તકાદાર  
તરફથી બહાર પડી ચૂકેલ છે. ગા. ૬૫૭ મી છાપેલ પાતું ૩૪૫.  
ઇથરો વિડિઓ સંતો સુણેદુ ગોતાંડ ઠાંડ અમુઢુકુમલો,  
સંવિઝો ઉવવતો અચ્ચંતસુદુપરિણામો ॥ ૬૫૭॥  
ઇતરોડપિ શિષ્યઃ સ્થિતઃ સન્-ઉદ્વિસ્થાનેન શૂણોતિ,  
મુખ્યવિનિક્યા વિધિગૃહિતયા સ્થગિતમુખકુમક્ષઃ સત્તુ  
ઇતિ। સ એવ વિશિષ્યતે-સંવિનો મોક્ષાથી ઉપયુક્તઃ  
તત્ત્વૈકાયતયા અનેન શુદ્ધમકારેણ અત્યન્ત પરિણામઃ  
શુદ્ધાશયઃ ઇતિ ।

### ગાથાથો :

ઉપલી ગાથા તેમજ રીકાનો આપેલ ભાવ આ પ્રમાણે છે.  
“ સાંભળવામાં તફીન ચિત્તવાળા, અત્યન્ત શુદ્ધ મનોવૃત્તિવાળા,  
મોક્ષના અભિલાષી શિષ્યે વિધિઓ અહણુ કરેલી મુહુપતિવડે મુખ-  
કુમળ સ્થગિત કરીને ( શ્રીનંદી ) જીભા બેભા સાંભળવી.

આવા ભાવવાળા ગાથાના અર્થને ડેવી રીતે શુંલાટ અવરાણે છે  
તે આપણે તપારીએ. “ મુખ્યવિનિક્યા વિધિગૃહીતમાં સ્થગિતમુખ-  
કુમક્ષઃ ” આ પછે વયસોથી સ્વીકારી અસાડ સુદ ૧૫ના સિદ્ધ્યક  
પાક્ષિકભાં ડેવી રીતે અર્થને લખાય છે તે બુઝો:- “ હાથમાં પહેઢેલી  
મુહુપતિથી જ ધ્વાખ્યાનમાં મુખ ઢાંકવાનું રૂપષ્ટખણે લખે છે.” આમ  
હાથ-પગ વગરની એટલે પૂરીપરના સંખ્યા વગરની લીટી આપવી  
તે; તેમજ લીટીના ભાવને અન્યાય અપમાન તે; અને હરિભરસૂરી-  
ભરજ મહારાજના અન્યનું અપમાન કરનાર મને તો સામરાનંદ-  
સૂત્રરીશરજી મહારાજ લાગતા નથી. સામરજ મહારાજ સિદ્ધાન્તવાદી  
છે અને આગમોહારક પણ કહેવાય છે, તેથી એવી ગેરસમજુતી  
દેખાવવા તેઓ કદિઅદ્ધ થાય એમ કેમ સંભવે ? કદાચ ભાવીના

યોગથી મતુષ્ય ભૂલે તો છે પણ સાગરજી મહારાજ જેવા નર અવશ્યક  
ભૂલ સુધારી બહાર પાડે તેવું આર્દ્ધ અતુમાન છે.

આસાડ સુદ્ધ ૧૫ના સિદ્ધયજ્ઞના અંકમાં તેઓશ્રીએ સમાકોચના  
લખેલી હોય એમ મને લાગતું નથી. કદાચ હોય તો આગ-  
મોકારકેના ગિરદને અવશ્ય ડલંડ લાગે એમ મને લાગે છે. અરતુ.  
જે હોય તે ! આગળ વખતાં તેમો લખે છે કે મુનિક્ષમેલનમાં  
સાથે એસીને અનેક નિર્ણયો. કરનારા સુનિરાને જૈન શાખીય  
વાતને છાપાયોમાં ચર્ચે તો જૈન કોમ તેનો વહુ લાભ મેળવી  
શકે. આના મુલાસામાં લખવાતું કે આપણી જૈન કોમની હાલની  
રિથિતિનું અવદેહાન કરીએ તો માલુમ પડશે કે આપની  
સાંધારણું વાત પણ જાહેર પેપરોમાં બહાર આવે છે. શાખીય,  
જીતની કે સમાજની ગમે તેવી બાબતો આધુનિક જમાનામાં બહાર  
પેપરોમાં આવવા લાગી છે દાખલા તરીકે એ એક અઠવાડીઓ પહેલાં  
મહાવીર વિદ્યાલય સંબંધી જાહેર પેપરોમાં સ્થાન આપાયું હતું ને !  
મહાવીર-વિદ્યાલય સંબંધી ભાર વિચારો નથી. મહાવીર વિદ્યાલય  
જેનોની કે જાહેર જનતાઓની ? એક સંરથામાં ગમે તેવી વાત  
અનેલ હોય છતાં તે વાત જાહેર પેપરોમાં સુંદર લાગે કે જૈન  
પેપરોમાં ? આ વાત યાદ કરાયલી હોતા તો આવી પેપરો સંબંધી  
વાત તમો લખત નહી. ગાંડી સાસરે જથ નહી અને ડાહીને  
શિખામણું આપે-આ ક્રોક કહેવત યાદ તો છે ને ? સંભારો,આપણી  
દસ વરસની ગ્રણ્યાલિકા. ભાઈ એમ જ ચાલે છે ! જાહેર પેપરોમાં  
આપવાની આપની મનોદશાતું સુયવન કરાય છે તે મનોદશા  
નિર્મૂળ જ્યાં સુધી નહી થાય ત્યાં સુધી સારા કે ખોટાની  
પરીક્ષા ભાર જૈન કેખડો કરી શકશો નહી સત્યને સ્થાન આપશે  
નહી. પત્થર અને મણીની કિંભત ત્યાં સુધી અંકાશે નહી. આગળ  
જતાં કેખક ભારી જ વાતને પુછ્યા આપતાં લખે છે કે શાખીય વાતનો  
નિર્ણય પ્રત્યક્ષ ભયા છતાં મુલાસો કરવા મન લલચાયું નહી  
અને પેપરો દ્વારા મન લલચાય તે કેવું આપણ્યું ! વાત સત્ય  
છે. હજુ પણ જનતાના ડાન ખોલવા, કેખડોની મનોદશા કુલા-

વતા મારે લખવું પડે છે કે અત્યાર સુધી પેપરો દારાએ જે જે ચર્ચાઓ ઉત્પત્ત કરેલી હતી અને છે. તે ચર્ચાઓનો અંત અસાર સુધી આવેલો કેખકાને થાં છે કે ? પૂર્વે દેવદૃષ્ટની ચર્ચા ઉપરિથિત થયેલી હતી. અમદાવાદમાં વિજયાળાના હોલમાં કૈનાચાર્ય વિજયનિતિસૂરીશ્વરજી મહારાજના પ્રમુખપણું નીચે સભા એકત્ર થયેલ હતી. સભામાં આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ તથા ઉપાધ્યાયજી પ્રેમવિજયજી મહારાજ, તેમજ પંન્યાસજી રામ-વિજયજી મહારાજ આદિ સુનિમંડળ એકત્ર થયેલ હતું. પ્રમુખ સાહેબે પોતાના વ્યાપ્તિયાનમાં એમ જાહેર કરેલ હતું કે આજા સમયમાં દેવદૃષ્ટની ચર્ચા ઉપરિથિત થયેલ છે તે ચર્ચા પેપરોદ્વારા નહી ચર્ચતાં ચાતુર્માસની સમાચિ થાં સાહુઓને એકત્ર કરી સમાધાન કરતું તે જ આપણું કર્તાં છે. " આ કર્તાંને ભૂલતા નહી. પેપરોથી ડાઈપિયુ નિર્ણય થાય એમ મને લાગતું નથી. આમ રૂપદ્વારે વ્યાપ્તિયાન કરેલ હતું. છતાં આપણું મન પેપરો દારાએ નિર્ણય કરવા ચાહતું હોય ત્યાં હોય કોનો ?

અત્યાર સુધી પેપરોદ્વારાએ જે ચર્ચાઓ ઉપરિથિત થયેલી હતી. અને છે તેમાં મને કલેશાની રૂદ્ધિ સિવાય કાંધ બીજું દેખાતું નથી. અને જે સમયમાં ચર્ચાઓ વિભાગ દ્વારા દેખાડી છે તે અદ્યાપિ સુધી વિભાગ દ્વારા તરી આવતી હોય એમ મને લાગે છે, એથી જ આ ચર્ચા પણ પેપરદ્વારાએ ઉત્પત્ત થાય નહિ તે માટે અમોએ સાહુ સંમેલનના પહેલા સાહુ-સંમેલનમાં નિર્ણયક કરવા ચર્ચા-સાંચ અહાર પાડેલી હતી. ચર્ચા ઉપરિથિત કરવા મેં સંમેલનમાં પ્રેરણું કરેલી હતી, છતાં દિલ લલચાયાં નહિં અને તે જ ચર્ચા સિદ્ધયકમાં ઉપરિથિત થાય છે તો કેખક મહાશય, હોય કોનો ?

છેવટે કેખક લખે છે કે આ ચર્ચા નિજયનેમાસૂરીશ્વરજી કે વિજયસિદ્ધિસૂરીશ્વરજી સમક્ષ રજૂ કરી તટસ્થ દિશિએ, અત મેળ-વવાની ધર્ઢા વગર, આત્માક્ષીએ રજૂ કરીને તેને અર્થ સમજવા કોણેપ કરે તો અત્યારે જે મતલેદ, અભિમાન અને કુસંપ તરફ હોરી રહ્યા છે તે જુદો જ માર્ગ છે. આ વાત મને પણ ઠીક

લાગે છે. ચર્ચા ઉપરિથિત કરનારને અવસ્થા ઉપરની બધી વાત ધ્યાનમાં ઉત્તરી જય તો જ મતભેદના અળે અભિમાન અને કુસંપણે નાંદું: થાય એવું અને લાગે છે. અભિમાનના અળે કુસંપણે સ્થાન આપણી ડાખમાં રહેણું હોય એવું અને ભાસે છે. ઉપરનો પંચવરતુની જાથાનો અર્થ કાઈ વિજ્ઞાન પંડિત પાસે વંચાતી, સત્ય વરતુને એઓએઓ ભારા કેનેન લોખક, વિચારો તો જ આપણું મતભેદ મટશે એવી ભારી ભારી છે.

અમોએ સુખવિભિન્નાના સ્થાનને જ્યારથી ગુમાંયું છે ત્યારથી જ રીખભાસ કરીનું કાબ્ય થાડ અમોને આવે છે.

“કેડ એસી કેથળી, નાવી પુષ્ટને કામ ” આ વાક્યાનુસાર સુહૃપત્તિ યાદી રહેલી છે. તે તમારા ધ્યાનમાં નહી હોય કે? જ્યાં કદાશહેને સ્થાન અપાયેલ હોય ત્યાં અવસ્થા સત્ય વરતુ બોણુ પરરહી જય છે, આ ચોક્કસ જાણુશો આટલું લખી હાલ ત્રિસું છું, અરતુ.

### સિદ્ધયક અંક ૨૨, વર્ષ થીજું.

આવણું સુધ ૧૫, તા. ૨૪-૮-૩૪, શુફ્તવાર.

૧. નાનાં ને કાખળાં મુસ્તકો પહેલાં હતાં તેનો મુરાવો હેવો.
૨. મુસ્તકની પ્રતિમાળ માઝક વગર બાંધે આથાતના ગણુનારે દરેક વાંચન વખતે બાંધું. સ્નાનનો પ્રસંગ પણ હેવો.
૩. તે ઓઠ ઉપરની સુહૃપત્તિ બાંધ્યાના દેટા જૂડા અને ધર્મહાનિકર નહીં તો થીજું શું?
૪. સુહૃપત્તિ બાંધનારની સુહૃપત્તિ ભીની થાય ને થાય પણ છે.
- ૫ સુહૃપત્તિ માટે કાન વિધવાતું પ્રાયશ્ક્રિત કચા સ્કુત્રમાં છે?
૬. ચર્ચાસારમાં તો જ ગાથાનો અર્થ બાંધવામાં જણ્યાંથ્યો છે.
૭. દાથથી જ ચોગમુદ્રા છે અને તેમાં સુહૃપત્તિ રાખવાની હોય તો જ ભાષ્યકારના વચન પ્રમાણે કિશિષ્ટના થાય.

## સિદ્ધયકુ અંકે રહેય વર્ષ થીલું.

તા. ૮-૯-૩૪. શાનિવાર.

૧. શાચના પાડો અને અથેં અસંગત હોય તેના ઉપર કરેલા પ્રશ્નોને તર્ક કરી ઉદાહરણને ઉત્તર ન દેવા એ અચ્છોસારતી ચોપડી લખી, અચ્છો ઉપાયા પઢી યોગ્ય છે?

૨. આરસે દેખાડનાર એ હાથે પકડે છે, સનાન કરી વન્નાન લંકારથી સનજ થાય છે ને તે પણ જિનેશ્વરના ગભારા માછક શુરૂદેવ પાસે મુખડોશથી મુખ બાંધે છે. મુહુપત્તિનાં આઠ પડ નથી હોતાં ને તે મુખડોશનાં તો આઠ પડ હોય છે, છતાં આવકતું અનુકરણ એથા લાગે છે.

૩. આરસે આટિનાં બ્યાળ્યાન વખતે એ ઉપયોગ: ટાળાવા મુહુપત્તિ બાંધી પણ બાકીના બાધથૂરેં વાચનાના પ્રસંગેભાં. એ ઉપયોગવાટી બનલું ધિષ હરો તેથી આખો હિન્સ નહી બાંધતા હોય. (એ કિયાના રથાને ઉપયોગ કહેતારે શું વિચાર્યું હરો? સમજને ફરની હું કઈ?)

દીર્ઘય—૧. દરેક સ્વચોમાં આખકતું અનુકરણ સાથે કરે કે- સાધુનું અનુકરણ આનક કરે? એ જ વિચારણા કરાય તો જ. વાત સમજ થકાય ને?

૨. એ કિયાભાં એ ઉપયોગ રૂપાચ-તે કિયા કેવી? તે જ સમજય તોઓ સમજને અણ ને?

ઃ ૨૬ :

### જવાય

મુંબદ્ધ સમાચાર. તા. ૧૮ ઓક્ટોબર, ૧૯૭૪. ગુરવાર.  
જૈનાચાર્ય વિજયહર્ષસ્કુરીધરલુ મહારાજનો વધુ ખુલાસો.  
ગાડીલુ ઉપાશ્રય મુંબદ્ધ.

શ્રી સિદ્ધયક્ત પાલિક અંક ૨૨, તથા ૨૩ની સમાચેચનાનો વિષય. મુહૂરતિમાં નાના અને કાગળનાં પુસ્તકો પહેલાં હતાં તેનો પુરાવો માંગવામાં આવ્યો છે. તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું ને જરૂર-ભરેન ભગવાને આલીને લીપીએ શિખની તારથી લીપીનાં વિધાનના ક્ષેત્રની અંદર અભાવ થયો. નથી; ચાલુ જ રહેલ છે. એમકે અસી, અસી અને કૃષિ એ નણું નયાં પ્રધાનતા વર્તતી હોય તેને જ કર્મભૂમિનાં ક્ષેત્રો કહેલ છે. એનું વર્ત્તમાન ભારતનો તેમાં સમાવેશ થતો હોધને એ નણે વસુએ પૂર્વે પ્રવર્ત્તતી હતી, વર્ત્તમાનમાં મોણુદ છે અને અવિષ્યમાં રહેશે એ નિર્વિંબાદ છે.

વળો વર્ત્તમાન યુગના મતુષ્યો કરતાં પૂર્વ સમયનાં મતુષ્યો આત્મિક શાનનાં ધારક હતા. પુરુષની વહેંતર અને સ્ત્રીએની ચોસદ કળાએના સંપૂર્ણ નહીં તોપણું બણે અંશે તો ભીબેલી હતી જ. અને બેખનકળા ભીબેલી હોય એ તો સ્વાભાવિક જ છે. વળો ગંડી, કર્દાધી, આદિ પુસ્તકોનાં પાંચ બેઠો સૂત્રમાં કહેલા છે. આગમ પુસ્તકાઙ્કા થયા પહેલાનાં છે. વળો વિકુલની અગ્યારમી શતાબ્દિમાં દૂંડા બોજપત્ર અને દૂંડા તાપનો પર લખાયેલી પ્રતો અત્યારે પણ પુનાની બાંડારકર લાયાયેરીમાં મોણુદ છે. તેમજ શ્રી કાલિકાચાર્યની કથા ઇંગ્લીશમાં ડેઝટર નોર્મન આઉને જ્હાર પાડેલ છે તેમાં વિકુલની ૧૨ મી શતાબ્દિમાં લખાયેલ દુંડા પાનાની પ્રતોભાહેનાં ફોટોએના જ્યોકો આપેલ છે. તથા શોધકોની એ માન્યતા છે કે ઇસુની શ્રીજ સહીમાં કાગળોની ઉત્પત્તિ થઈ છે. સંશોધકોની દર્શિએ જોઈએ તો શ્રીમાનું દેવર્દીગણી ક્ષમાક્ષમણુણના વખતે કાગળ હોવા સંભવે છે. દલીલને ખાતર માની લઈએ તો કાંબા પાનાની પ્રતો હોય તો પણ એકલું પાતું હાથમાં લઈને વાંચી રહકાંતું નથી, પણ પાટલીમાં રાખ્યાને વાંચાય છે કે નેથી એક હાથે વાંચવામાં કરો બાધ આવી શકે નથી.

આ ઉપરથી એ સ્વતઃ સિદ્ધ થાય છે કે પૂર્વે મોટા પાનાની પ્રતોના કારણુથી એ હાથે જાહીને વાંચવું પડે એટલા માટે જ મુહુપત્તિ બાંધવાની પ્રથા હતી, એમ કહેનારની વાત ચોગ્ય નથી. વાસ્તવિક રીતે જોઈએ તો જ્ઞાનની આશાતના ટાળવા માટે જ તે પ્રથા હતી અને છે એમ માનવું પડશે. મોઢું ઢાંકાચા સિવાયતું કર્નિતું વચ્ચન પણ સાવદ્રા (પાપવાળું) કર્ણું છે.

“પુસ્તકની પ્રતિમાળ માફક વગર બાંધે આશાતના ગણુનારે દરેક વાંચન વખતે બાંધવું અને સ્નાનનો પ્રસંગ પણ કેવો ?”

આ પ્રમાણે વગરમાંગી સલાહ આપવામાં આહી છે. તેના જવાયમાં જણ્ણાવવાનું કે પૂર્વના મહાપુરુષોએ જે જે રથસે મુહુપત્તિ બાંધવાતું દર્શાવેલ છે તે તે રથસે બાંધવાતું રૂપીકારીએ છીએ. ઓછી જગાએ બાંધાતી હોય તેને પ્રમાદ જ ગણું શકાય છે. ‘સત્યતું’ પાલન તો દૂર રહ્યું પણ સત્યને અસત્યતું રથાપન કર્યું તે શું ચોગ્ય છે ?’

મૂર્તી એ રથાપના તીર્થેકરનું બિંંબ છે. સિદ્ધયકના ધનત્રની અંતર્ગત જ્ઞાનની રથાપના હોય છે તો તેતું પૂજન પણ ગૃહસ્થો સ્નાન કરીને જ કરે છે. સાધુએ તો સ્નાનના અભાવે દ્વય પૂજનનો નિષેધ હોધને ભાવપૂજન જ કરે છે. તેવી જ રીતે વાંચનને અગે પણ સાધુએને સ્નાનની જરૂર ન જ હોય એ સૌ કાઢી સમજ થકે તેવી રૂપદ્ધ વાત છે.

શ્રી દશવૈકાલિક સ્ત્રોમાં ભમરના દૃષ્ટાંતે સાધુએને ગૌચરીએ જવાતું જણ્ણાવેલ છે, અથીત જેમ ભમર પુણોને કીલામણું ઉપાનવતો નથી, ધળ કરતો નથી અને જુદા જુદા પુણોમાંચી પરિમલ ગ્રહણ કરી સ્વાત્માને સંતોષે છે, તેમ મુનિ પણ જુદે જુદે રથયાએ ભમી, ડોધને પણ કીલામણું ઉપાનવા સિવાય ગૌચરીએ નાય અને તેવા વિશુદ્ધ આહારથી સ્વાત્માને સંતોષે. હવે આ ઉપરથી સર્વાંશે મુનિની સાથે ધટાવીએ તો અયુક્ત જ બની જાએ છે, કેમકે ભમર તો અવિરતિ છે, તો મુનિને પણ અવિરતિ બનનું પડશે. વળી ભમર પુણ્યનાં દીક્ષા સિવાય ચોતાની મેળે જ સુગંધેને ગ્રહણ કરે છે, તો અહીં મુનિએ પણ ગૃહસ્થોના વહેરાભ્યાં

સિવાય જ આહારાદિક કેવા જોઈએ, પરંતુ તેમ ન જ હોઠ શકે. દ્રષ્ટાંત સહાયે એકદેશી જ હોય. સર્વ ધર્મથી દૃષ્ટાંતમાં સમાનતા સંભવી શકે જ નહીં. શ્રી તીર્થ્કરોએ શ્રી તીર્થ્કરો જેવું કર્યું એમાં પણ બધા ધરોની સમાનતા નથી.

મુહુપત્તિ બાંધનારની મુહુપત્તિ બીની થાય ને થાય પણ છે. "જે લખ્યું છે તેના પ્રત્યુત્તરમાં જણ્ણાવવાતું" કે અમો બાંધનારા હોઠને અમારો અતુભવ છે કે મુહુપત્તિ નાડ ઉપર રહેતી હોવાથી બીની થતી નથી. જે મુહુપત્તિ હાથમાં રાખીને મુખ પાસે રાખવામાં આવે તો પણ જેઓને થુંક લાગતું હશે તેને તો લાગશે જ. અહિ માનીએ કે બીની થતી હોય તો પણ તેને મુકાયે પહેરેલ કપડાં પરીનાથી(પરસેવાથી) વધારે બીનાં થાય છે, અને આપો વખત શરીર પર જ રહે છે જ્યારે મુહુપત્તિ તો અસુક વખત જ સુખ પર જ રખાય છે. અને તેમાં પણ વચ્ચેમાં છુટી કરાય છે. 'તો કપડામાં જીવોપત્તિનો સંભવ છે. કે નહીં? અને તો તો વખતોવખત કપડા બફ્ફલવાનો રિવાજ હોત તેમજ તેના અંગે વિધાન પણ હોત અને વધારે સંઘયા કહી હોત; પરંતુ તેમ નથી. એ ઉપરથી માની શકાય છે કે એમાં તેવા સંભવ નથી.

"મુહુપત્તિ માટે કાન વીધવાતું પ્રાયશ્વિત કયા સુત્રમાં છે?" તેના જવાયમાં જણ્ણાવવાતું'કે સાધુના મૃતહેઠને મુહુપત્તિ બાંધનાના સૂત્રપાઠનો સ્વીકાર તો સહુએ કરેલ છે, તો જેઓને કર્ણવેદ ન થયેલ હોય તેઓને તે વખતે કરવો પડે છે તો પછી હ્યાતીમાં પણ આશાતના ટાળવા તેમ કરે તેમાં શું તુકશાન છે? તે જ નથી સમજ શકતું.

વળી દરેક જાતના પ્રમાણું પ્રાયશ્વિત દેવું હોય તો અપરાધના પ્રમાણુંમાં 'જીતકલ્પ તથા છેદસુત્રો'ના આધારે આપી શકાય છે તેમજ લઈ શકાય છે.

યોગમુદ્રાના વિષય પરતે જણ્ણાવવાતું કે બન્ને હાથની દશ આંજળીઓને અન્યોન્ય બીડાવવાથી યોગમુદ્રા અને છે. યોગમુદ્રા સુખ પાસે રાખવાતું જણ્ણાંયું નથી. વાંચતી વખતે યોગમુદ્રા કરવાતું જણ્ણાંયું છે. તે યોગમુદ્રા સુખથી દૂર તારે જ રહી શકે કે જ્યારે સુખ પર મુહુપત્તિ આધેલ હોય.

તે ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે આગમ પુરતકારણ થાય તે પહેલાંની મુહૂરતિ બાંધવાની પરિપરો છે. આ વાતને વિધિ પ્રથાનો પાઠ પણ સિદ્ધ કરે છે. જેનો તમો નિર્વેશ અર્થ કરો છો તેનો પ્રકરણથી બાંધવાનો અર્થ જ રૂપણું થાય છે, અને તે ઘટે પણ છે, તેમજ તેની પરિપરા પણ ચાલુ જ છે. દ્વાલાની આતર તમારી નિવેશ અર્થ લઈએ તો પણ નાક ઉપર રાણી કાનના છિદ્રોમાં ભરાવ્યા વિના ધરશે નહીં; કારણું કે નિવેશનો અંદો સ્થાપન છે અને તે સ્થાપન કાનમાં ભરાવ્યા સિવાય બની કાકશે નહીં. એટલે નિવેશથી પણ બાંધવાનો અર્થ સિદ્ધ થાય છે.

પરંતુ તેમ ન કરતાં ને ચોગમુદ્રામાં મુહૂરતિ રાખે અને બંને હાથને મુખ પાસે લઈ જાય તો વિવેકભરેલું જાણ્યાતું નથી. વળા પાના ઉપર મુહૂરતિ આવવાથી વાંચી શકશે નહીં, અંટે ને ચોગ-મુદ્રાને અખંડિત રાખ્યાને વાંચલું હોય તો નાક ઉપર મુહૂરતિ રાખ્યી, કાનમાં ભરાવવી જ આવસ્યક થઈ પડે, એ નિઃશાંક છે.

ચર્ચાસારમાં આપેલ પંચપસ્તુની જાથી ફર્જ મી નંદીસુત સાંભળવા તથા સંભળવાને અગે છે તેમજ સેમાં આપનો આવી શાખ ગુરુની માફા જિભા રહીને સૂત સાંભળવાની સમાનતાનો સૂચક છે, પણ મુહૂરતિ કાશમાં ચાપવાની સમાનતાનો સૂચક નથી.

“ શ્રી ભગવતી શ્રુતીની આરામાં શ્રીમતીની સુધૂરોદવામિ મહારાજે પ્રથમ આલી લીપીને નમેરસ્ટોર કર્યો છે. આ ઉપરથી શાંખ-લિપિ ડેટલી આનન્દી છે તે સમજ કરાય તો છે.

આરસામાં દર્શાન કરાવનાર જયારે મુખકાશ બાંધીને દર્શાન કરાવે છે તો પછી વાંચનાર બાંધીને વાંચે તો તેમાં શું વાયો હોઈશકે? તે સમજાતું નથી.

બાકી મુહૂરતિના અંગે બાઠ પડતું વિધાન કર્યાંથી પણ જ નહીં. દષ્ટાં સંહાએ એકદેશાય જ હો. સર્વ ધર્મથી સેમોન ન જ હોય તે પૂર્વે દર્શાવી જયા છીએ એટલે પુનરદિત કરવી વ્યર્થ છે.

प्रश्न—

लाल्हरवा वहि ॥) ता. ८-१०-३३ सेमवार

द्वितीय वर्ष, अ.क-२४

१—सामान्य रीते ताडपत्र मोटां ज ने धण्ही प्रतो मोटा ताडपत्र उपर ज छे ने तेथी ज वयमां तथा ऐ छेडा उपर डोरी जग्या होरीने स्थाने रहे छे. ने मोटानी अपेक्षाए ते वंधन इल्पाय छे.

पुस्तक उपर ज वांचन छतां पुस्तक संअडने संयम गण्डाव्यु त्यां पण्डु वंधननो लेख नथी, भाटे क्षाच ते कारण्डु हेयने ! प्रभाद होय तो गानी जाणे. कारण्डु अने विधाननो रप्श लेख डेम नथी अपातो ?

२—प्रसंगापाहनने सलाहनो हेर न समजे तेने शुं कहेवुं ?

३—शुंक्थी क्लाङ्को सुखी बीनी अलग रहेती मुहुपतिमां ज्ञोतपति न भानवा शरीरे लागेला परसेवाथी बीनां कपडां आगण करनारने शुं कहेवुं ?

४—पंचवस्तुनी ६७५ गाथाना अर्थमां यची-सारमां वांधवानो अर्थ ओटा जण्डाव्यो छेने ?

५—साधुना भृतक्ने रोडुं पडे तो कहेलुं मुझमध्यन करवा ते वधत कान विंधवा येम कहेनारे ते पाठ आपवो अंगुलीनो छेद तो क्लो छे ने ते क्षतपण्डा भाटे छे. जे कान वो ध्या होय तो तेनी जळू शा ? )

६—आचारदिनिकरने आवस्यक भालभोध विग्रेमां मुहुपतिना आठ पडनो लेख छतां ने वंधनवाणानी अपेक्षाए आरसे वधते आडपडे वंधाता छतां तेनो अनियम करतां पाठनी जळू छे

---

टीपणी—२ आचारदिनिकर पा. १७, भा. १ दो. क्षुवेध संस्कारविधिमां आल्यावयथी क्षुवेध संस्कार यथा छे छतां क्षुवेध कर्वो पडे तो प्रायश्चित देवुं पडे आवा प्रक्षो अस्थाने छे. भृतक्ने

તા. ૧૭ નવેમ્બર ૧૯૭૪

## વિજ્ય હર્ષસુરીશ્વરજી મહારાજનો ખુલાસો—

સિદ્ધચક્ર પાદ્ધિકનાં દ્વિતીય વર્ષના રઘુભા અંકમાં આવેલ પ્રશ્નો-  
ની વિરોધ સમાવેશના નીચે પ્રમાણે છે.

કે વસ્તુ પરંપરાથી ચાલી આવેલ છે, વિવેકદશ્ઠિથી જેતાં  
પણ સાધુધર્મમાં જેતું સ્થાન મહત્વતું છે, જેના સતત ઉપરોગથી  
ઉચ્ચચારાએલું વચન નિર્વિશ્વ ગણ્યાય છે એવી ‘મુખ્યનાભિકા’ ને વ્યા-  
ખાનાદિક વખતે મુખ ઉપર ન વાંદવાનો આગ્રહ કેટલાક આચારો-  
દિકો અને મુનિવરો તરફથી થઈ રહ્યો છે, તે ખેઢનનક છે. સત્ય  
વસ્તુસિદ્ધતિનો રહીએ કરવાના શુભ આશનથી જ આ અને આ  
પૂર્વના બેખો લખાએલ છે. અસ્તુ ! તેઓઅની તરફથી અમ લખા-  
એલ છે કે “સામાન્ય રીતે તાડપત્ર મોટા જ હોયને ! ધણી પ્રતો  
મોટા તાડપત્ર ઉપર જ છે” ને તેથી વચનાં તથા ઐ છેડા ઉપર  
કારી જગ્યા હોરીને સ્થાને રહે છે તે મોટાની અપેક્ષાએ તે બંધન  
કલ્પાય છે. પુરસ્તક ઉપર વાંદન છતાં પુરસ્તક સંગ્રહને સંયમ ગણ્યાંયું  
ત્યાં પણ બંધનનો બેખ નથી, માટે કદમ્બ તે કારણ હોયને ? પ્રમાદ  
હોય તો શાની જાણું. કારણ અને વિધાનનો સાંક બેખ કેમ નથી  
આપાતો ?

આના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે “તાડપત્ર મોટા જ હોય અને  
ધણી પ્રતો તાડપત્ર ઉપર જ લખાએલ છે.” આ વાતનો અમે સાંક  
ઈન્કાર કરીએ છીએ. અર્થાત તે પાત જૂલભરેલી છે.

દશવૈકાળિક ચૂણ્યો વાધ્યયન બીજું પૃષ્ઠ ૮૧માં

પણ કલ્યાણ કરવાની આવસ્પદતા દેખાતી નથી, જ્ઞાં જે આત્મા વ્યાખ્યા  
નહિમાં મુખ્યનાભિકા બંધનનો અભાવ દેખાડે છે તેઓને જરૂર તો પડેને ?  
આગ્રહી જોને જરૂર શી ?

૩. પંચ વસ્તુની ગાયાનાં અવળા અર્થ કરી અન્યાય કરનાર આત્મા  
ચર્ચા-સારમાં અર્થ મોટા જણાયો કહેનાર પોતે જ મોટા ઠરે છે. મોટા  
અર્થ કરનાર પ્રાયશ્ચિત્તના અધિકારી હોઇ શકે ને ?

“ ચાણુકો આગમો ભવદીધી ન દેખ તાહે ચાણુકો વિતેછ  
સથે અહું ગયાજિતિ કહું દયં પુત્ર પોતાણું દાખિણું સંગોવિતાય  
ગંધા સંઝોધાયા, પતાયં ચ લિહિદિલું સોધિ જેગે સમુદ્રે છુઢો.”

આ ચન્દ્રગુમ્ફ રાજને ગાઢી અપાવતાર અને પાછળથી તેના  
તથા પુત્ર મિંહુસાર રાજના પ્રધાન તરીકે કંઈ કરનાર શ્રી ચાણુકયું  
વિષે આ પ્રમાણે વર્ણન આવે છે. (ચન્દ્રગુમ્ફ રાજને સંપ્રતિ મહા-  
રાજની પાંચમી પાટે પૂર્વે થાંબે છે તે જ સૂત્રની હરિબદ્ધસ્થરિએ કરેલી  
દીકામાં અદ્યથત ભીજું પાને ૧૧માં ચાણુકય વિષે નીચે પ્રમાણે  
વર્ણન આવે છે.

“ ચાણિકો ચિત્તેદ રુદ્રો,

અહું ગયાજીતિ કાડં દવં પુત્રયોત્તાણ દાઉણાં ।

સંગોવિતાય, ગંધા સંઝોધાય,

પતાયં ચ લિહિદિલ સોધિ જોગો સમુદ્રે છુઢો ॥

ચાણુકય વિચારે છે કે આ રાજ ઇષ્ટ થયો છું; હું ગતાયુ  
થયો છું એમ ધારીને દયં પુત્ર-પ્રપૌત્રોને આપીને, જોપવીને, સુગંધી  
વસ્તુઓ. મેધાવી પત્રને લખીને, તે પત્ર અને થોળ હાખડામાં મુક્યો.

આ પાઠ ઉપરથી એ સિદ્ધ થાય છે કે પૂર્વે કાગળો હતા.  
અને વપરાયેલ પત્ર (પતાયં) શણદ કાગળના અર્થમાં જ ચોઝાયેલ  
છે. ચાણુકભની ભીના આગમ પુરતકાશદ થયા પહેલાની છે. એટલે  
તે વખતે કાગળો હતા તો ત્યાર પછીના કાલમાં અર્થાત્ જ્યારે શાન  
લાખું ત્યારે તો ખાસ કરીને કાગળાનું અસ્તિત્વ સંભવે છે: આ  
તો ભગવાન મહાવીરના પદ્ધીના સભ્યની વાત છે, પરંતુ ખુદ ભગ-  
વાન મહાવીર દેવતે તેમના માતાપિતા નિશાળ બેસાડે છે. ત્યારે  
પણ કાગળવાચક શણદ શ્રી કલ્પસુત્રની દીકા તથા આલાવણોધમાં  
વપરાયેલ છે. વળી વર્તમાનમાં પણ પાટણું, અમદાવાદ, જેસલમેર  
કે બીજે ગમે ત્યાંના પ્રાચીન જ્ઞાન બંડારોનું અવલોકન કરવામાં આવે  
તો તેમાં પણ તાઉપત્ર પર લખાયેલ ગ્રંથો તો બહુ જ અદ્ય સ ઘ્યા-  
માં જણાશે; પરંતુ મોટા પ્રમાણુમાં તો કાગળ ઉપર લખાયેલ પ્રાચીને  
પ્રતો જોઈ શકાશે. પુરતક અને તેના ગાંડી આદિક બેદોથી જ કાગળ

આદિક સાધનો પૂર્વે હતાં એમ રૂપણ સમજાય છે. આ સર્વ ઉપર્થી જ સ્વતઃ કુલિતાર્થ થાય છે કે પૂર્વે કાગળો અવશ્ય હતા જ અને તેથી જેઓ એમ કહે છે કે તાડપન પર જ વધારે લખાએલ છે તેઓની એ વાત આ પ્રમાણોથી ટકી શકતી નથી. અરતુ!

એ જ પેરેઆઇમાં તેઓ જણાવે છે કે ‘પુરુષક સંઅહને સંયમ ગણ્યાયું’ તાં પણ બંધનનો ક્ષેભ નથી.” આ વાત પણ વારતવિક નથી તે આપણે જોઈએ. દશવૈકાલિક સૂતની ચૂણી પાના ૨૧મા ઉપર જણાવેલ કે-

કાલं પુણ પડુષ્ટ ચરણકરળદ્વા અવ્યોચ્છક્ષતિ નિમિત્તં  
ચ ગેણહમાણસ્સ પોત્થરા સંજમો ભવદ્દ।

વળો કાળને આશીને ચરણકરણુને માટે અને અભ્યુચ્છતિને માટે પુરુષકને અંહથ્ય કરતાં સંયમ થાય છે. આ પાઠ્દારા શાસ્ત્ર-કાર મહર્ષિ રૂપણ રીતે જણાવે છે કે અવિચ્છેદના નિમિત્તે જ પુરુષ-કના સંઅહને અળ્યુવ સંયમ કહેલ છે.

મુવચનસારોષ્યાર પા. ૧૩૫.

“ અજીવરૂપાણ્યયિ પુરુષકાદીનિ દુષ્મમાવિદોષાસથા-  
વિધપ્રણાઽયુષ્કભદ્રાસંવેદોદ્યમબલાવિહીનાઽશકાલીવિવેકજના-  
નુગ્રહાય પ્રતિલેખનાપ્રમાંનંદપૂર્વ યતનયા ધારણસેઽજીવ  
સંયમઃ ”

અજીવરૂપ પણ પુરુષક વગેરેને દુષ્યમાહિ હોષ્યથી તથાપ્રકારસી યુદ્ધ, આયુષ્ય, શ્રદ્ધા, વૈરાગ્ય, ઉદ્ધરણ, અષ્ટાદિકની હાનિથી વર્ત્ત-  
અનાંકાળના શિષ્યના ઉપકારને અર્થે પ્રતિસેખના તથા પ્રમાર્જના-  
પૂર્વક અજીવરૂપ પુરુષકને યતનાવડે ધારથ્ય કરતાં સાધુને અજીવ-  
સંયમ કહેલ છે, જે ઉપરના પાઠ્યી સિદ્ધ થાય છે. આમાં વાંચતાની  
વાત નથી, તેમ વ્યાખ્યાનનો પ્રસંગ પણ નથી.

તાં બાંધવાતું ન કહેવાથી વ્યાખ્યાનમાં બાંધવાતું અમાર-  
કહેતું જોકું નથી. કારથ્ય અને વિધાનના રૂપણ લેખોની માંગસી

કરનારને જણાવવાતું કે-અમોએ તો ચર્ચીસારની બુકમાં વિધિ પ્રથા આદિ શાખોના રૂપણ પાડો આપેલા છે. એટસે હવે અમારે નવેસરથી શાખપાડો આપવાના રહેતા નથી. મુહુપત્તિ બાંધવાની ના પાઢનાર તરફથી અત્યાર સુધીમાં અમારા પાઠના વિરોધી પાડો અપાયેલા નથી, તેમજ એક પણ પાક મુહુપત્તિ હાથમાં રાખીને બ્યાઘ્યાન વાંચવા વિષેના ફાડાર પાડવામાં આવેલ નથી કે નેથી અમારે વધારે પાઠ આપવાની જરૂર પડે.

હસ્તકિભિત પ્રાચીન તાત્પત્રની પ્રતો વિષે તેઓશીનો એવા પ્રકારનો અભિપ્રાય તેમના લખાયું ઉપરથી જણ્યા છે કે “ તાત્પત્રનાં પાનાની પ્રતો પર વચ્ચે અને બન્ને બાળુએ રહેલી ખાલી જગ્યાના અંગે દોરીથી બંધન કર્યાય છે.”

આ વાત પણ અવાસ્તવિક જણ્યાય છે, કેમકે કાગળની નાના પાનાની પ્રતોમાં પણ તેવી જ વચ્ચે અને બન્ને બાળુએ ખાલી જગ્યા હોય છે. દોરીથી વીધિને બાંધવાતું એક પણ પ્રતને અંગે અતુભવાયું નથી. વળી આપણું વંચે મુખ્યત્વે કરીને મુખ પર મુહુપત્તિ બ્યાઘ્યાન પ્રસંગે બાંધવા વિષેની ચર્ચી છે, એટસે તે વિષયને ચર્ચતાં વિષયાન્તર કરીને પ્રતની વાત કર્યી તે કેવળ અસ્થાને જ છે. તે જ સમાલોચનાનાં આગળ ચાલતાં તેઓશી લખે છે કે પ્રસંગાપાદન ને સલાહનો હેર ન સમજે તેને શું કહેણું ? તેના જવાબમાં જણ્યાવાતું કે પ્રસંગતું આપાદન તથા સલાહનો રહોટ કર્યો વિના ન સમજયાતું લખે તેને અમારે શું કહેણું ?

તેમની એક હલીક એ છે કે “ થુંકથી કલાકો સુધી ભીની અભિગ રહેલી મુહુપત્તિમાં જીવોત્પત્તિ ન માનવા શરીરે લાગેલા પરસેવાથી ભીનાં કપડાં આગળ કરનારને શું કહેણું ? ” આ પ્રથમના પ્રત્યુત્તરમાં જણ્યાવાતું કે પૂર્વે પણ લખાઈ ગયેલ છે અને હજુ પણ અમારું રૂપણથે માનવું કે મુખ પર આંધવાથી મુહુપત્તિ ભીની થતી નથી. આ અમારા સ્વાતુભવની વાત છે, તેમ છતાં ડોછને થુંક ઊડતું હોય તો હાથમાં રાખીને મોઢા નજીક રાખવાથી પણ ભીની અરોજ.

મુખથી છેટે રાખે તો મોઢા પર રાખી ગણ્યાય નહીં તેમ જ સંપાતીમ જવો નિર્વિદ્ધ, વચ્ચન તથા વાયુકાયના જવો, સચિત રજ. આદિ પૃથ્વીકાયના જવો, ઉદ્દક બિન્ડુર્ઝ અપકાયના જવો અને ગ્રાનાશાતના પણ ટાળી શકાશે નહીં. અથીત મુખથી મુહુપતિ દૂર રાખવાથી આ સર્વ પણ દૂર થઈ શકશે નહીં, એ સમજ શકાય તેવી વાત છે. કાચ એમ કહેવામાં આવે કે ભાવાના પુહગદો ચાર રૂપર્શ્વાળા હોવાથી વાયુકાય આહિની હિંસા નહીં થાય, તે કહેતું પણ બ્યાજથી નથી, કેમકે ભાવાના પુહગદો શરીરના અચિત પવનની સાથે નીકળે છે એટલે તે પવન ઉંણા ( ગરમ ) રૂપર્શ્વાળા હોઠને તથા આઠ રૂપર્શ્વાળા હોઠને ફડારના વાયુકાયના જવોનો નાશ તેનાથી થાય છે.

દ્યાવૈકાલિક સૂત્ર, તથા આચારાંગ સૂત્ર વિગેરેમાં રૂપષ્ટપણે વર્ણિત છે કે બિન બર્ષુ, ગંધ, રસ અને રૂપર્શ્વાળા જવોના મેળાપથી અન્યોન્ય સંભાળિય જવોનો નાશ થાય છે, કેમકે સ્વકાય શબ્દ પણ કહેલ છે. એના પ્રગટ દ્યાંતો આપણી સન્મુખ મોળુદ છે; જેમકે એક ઝેવાતું જલ બીજા ઝેવામાં પડે અથવા ખારા પાણીના જવો ભીડા પાણીમાં ભળે તો તેઓનો નાશ થાય છે. એ દ્યાંતો મુખમાંહેના પવનથી વાયુકાય આહિની હિંસાનો સંપૂર્ણ સંભવ છે.

આન્તે કહેવાનો ભાવાર્થ એ જ છે કે મુખથી મુહુપતિને દૂર રાખવાથી આ સર્વ હોષેતપતિનો સંભવ છે; જ્યારે હાથમાં રાખી મુખ નજીક રાખવાથી જેઓનું થુંક ઉત્તું હશે તેઓની મુહુપતિ તો બીતી થશે જ; તે સર્વ કરતાં નાક ઉપર રાખી મુહુપતિના અને છેડા કાનમાં લરાવવાઝ્પ પરંપરાગત પ્રવત્તિ શું ઘોટી છે? તે જ નથી સમજ શકાતું. અરસુ.

આગળ ચાલતાં આપ જણ્યાવો છે કે “ પંચવરતુની ૬૭૫ ગાથાનાં અર્થમાં ચચીસારમાં બાંધવાનો અર્થ ઐટો જણ્યાયો છે ન? પરંતુ ચચીસારમાં દ્યાંપણી ગાથા જ નથી ત્યાં તેનો જવાબ શું આપવો ?

ત્યારપણી આપ જલ્દુવો છો કે—“ સાહુના મૃતકને રોકવું  
પડે તો કહેલું સુખ બાંધવા કરવા તે વખત કાન વિંધવા એમ કહે  
નારે તે પાઠ આપવો ( અંગુલીનો છેદ તો કથો છે ને તે ક્ષતપણું  
માટે છે. જે કાન વિંધ્યા હોય તો તેની જરૂર શી ? ) આના  
પ્રાચુરંમાં જલ્દુવવાતું કે સ્થાપનાળું, પડિલેલણું, ઉપધી, પાત્રા-  
દિકના પડિલેલણું વખતે સુહપતિ મોઢે બાંધવાતું કહું છે તે  
ઉપરથી જેઓ વિધિ જગતના હશે તેઓના તો કાન વિંધાયેલા જ  
હશે. હોરાથી બાંધવાનો નિર્ધેખ કર્યો છે, એટલે ન વિંધેલ હોય તેને  
વિંધવાનો અર્થ—સામર્થ્ય સ્વયં સિદ્ધ થઈ જાય છે. વળી જેઓના  
કાન વિંધાયેલા હોય છે તેઓ પણ સુત્રપાડના અનુસારે અંગુલીનો  
છેદ તો કરે જ છે; કેમકે અંગુલી-છેદ તે જ ક્ષત માટે છે; તેમજ  
તે પ્રથા પરાપૂર્વથી ચાલી આવેલી છે, એટલે તેમાં ડાઢનો કેશ પણ  
દનંકર નથી જ, પડિલેલણું, સ્થાપના, પડિલેલણું, બ્યાઘ્યાન આદિ  
સમય પર બાંધવાતું કહેવા છતાં જેઓ ન જ બાંધતા હોય તેઓને  
જરૂરરજૂરતી કોણું કરે છે ?

વળી એઓએ અમુક પ્રસંગેઓ બાંધવાના વિધાન પરથી  
આએ. દ્વિસ બાંધી રાખવામાં શું વાંદો ! એમ કહેતા હોય તેઓને  
જલ્દુવવાતું કે પ્રસંગે પ્રસંગે બાંધવાતું કહેલ હોવાથી આએ.  
દ્વિસ તો બાંધવાતું નથી જ કહેલ એ વિપાક સુત્રના પાઠથી સ્વતઃ  
સિદ્ધ થાય છે. વળી જલ્દુઓાતું એમ કહેવું છે કે તમે બ્યાઘ્યાનાદિ  
પ્રસંગે માટે સુહપતિનો આગ્રહ રાખો છો. તો ત્યાર પણીના પ્રસં-  
ગેામાં સુહપતિનો જેદ્ધાંતે તેટલો ઉપયોગ કેમ રાખતા નથી ? આ  
પ્રશ્ન વર્તમાન સાધુ સંરથાના વાતાવરણનો સૂચક અને વારતનિક  
પણ છે, પરંતુ કદાચ અધો. વખત ન જગતી શકાય તો તે ઉપરથી  
એવો. નિર્ણય ન થાય કે જેટલો વખત જગતા હોઈએ તેટલો  
વખત પણ જગતવું. જે આમ કરીએ તો સર્વથી ભાગ્યથી  
પરાજીમુખ થવાનો વખત આવે માટે બાકીના સમયમાં બની શકે  
તેટલો ઉપયોગ રાખવો એમ અમે સાધુઓાતું જરૂરી કર્તવ્ય સમજુએ  
છીએ. પણ પૂર્વના મહાન મુર્ઝોની જે સંસ્કૃતિ વારસામાં મળી

હોમ અને તેનું ચોંમ પાલન થતું હોય જેમાં શિથિસ અનતું એવો  
અર્થ તો લઈ શકાય જ નહીં. અરતુ ! લારખાઈ આપ જણ્ણાવો છો  
કે આચારદિનકર ને આવશ્યક વાલાવણેધ વિગેરભાં જ મુહુપત્તિના  
આઠ પડનો ક્ષેમ છતાં તે બંધનવાળાની અપેક્ષાએ આરસા વખત  
આઠ પડે બંધાતા છતાં તેનો અનિયમ કરતાં પાઠની જરૂર છે.  
આના જવાયમાં લખવાતું કે આચારદિનકર વિગેરભાં લખવાતું  
કે આચાર દિનકર વિગેરભાં આઠ પડની મુહુપત્તિનું વિધાન હાથમાં  
રાખવાને અંગે છે, પણ મુખે બંધાતી મુહુપત્તિને અંગે નથી.  
આવક તો મુખકોશ બાંધે છે સાંધુ મુખકોશ બાંધતો નથી; પણ  
મુહુપત્તિ બાંધે છે, વળી સાંધુતું અતુકરણ આવકને હોય પણ આવ-  
કનું અતુકરણ સાંધુને કરવાતું ન હોય તેનું કારણ સાંધુ સર્વ-  
વિરતિ છે અને આવક દેખવિરતિ છે. આઠ પડની-મુહુપત્તિ બંધવાતું  
વિધાન જો આપના જણ્ણાવામાં છે તો મુહુપત્તિના આઠ પડના એ  
પાડો આપને વાતનો રહોટ શા માટે કરતા નથી ? અને શા  
માટે ના કહો છો ? શા માટે બીજી પાડો માંગો છો ? આપે  
આપેલા આચારદિનકર આવશ્યક આળાવણેધ વ્યાખ્યાનાદિકમાં  
મુહુપત્તિ બાંધવાની સિક્કિમાં બસું છે. હવે ભાત્ર આઠ પડ કે ચાર  
પડની વાત રહી તો જણ્ણાવવનું કે ચાર પડ બાંધવાની તે પરંપરા  
છે અને હાલમાં એનું આચરણ પણ છે, એટલે આપ આઠ પડની  
મુહુપત્તિ સાંધુને વ્યાખ્યાનાદિકમાં બાંધવાના પાડો આગો કે જેથી  
અમો પણ વિચાર કરીએ.

આપ મુખ પર મુહુપત્તિ બાંધવાના નિષેધની ચચો કરો છો  
તો તેમાં આઠ પડની મુહુપત્તિ બાંધવાના પાઠને જણ્ણતાં છતાં કરો  
છો તે આપને વ્યાજખી જણ્ણાય ખરિં ?

સુ. સુ'બદ્ધ બંદર } લી. આચાર્ય વિજયહર્ષસુરીશ્વરજ  
ગ્રાડીલુ ઉપાશ્રય. }



પ્રશ્ન—આસો સુધી ૧૫ તા. ૨૦-૧૦-૩૯ સોમવાર

તૃતીય વર્ષ અંક ૧ શે।

૧—તાડપત્રોની પ્રતો દૂંડી થાડી ત્યારે લાંબી ધણી હોય છે.

૨—પાટલી સાથે પાનું રહેતો પણ લાંબી પાટલી એક હાથે રહે નહીં અને વંચાય પણ નહીં.

૩—બાંધનાર પક્ષ વધારે ચચ્ચી ન વધારવા માગતો હોય કે સત્યનું સમર્થન કરવા માંગતો હોય તો બાખ્યાનની વખતે બાંધવાનો પુરાવો આપે શે જ સારું છે.

૪—આશાતના ટાળવા ભાઈ જ મુખડોશ બાંધવાની જરૂર ગૃહસ્થના અનુકરણે થાઓના વિધિપાઠ વગર જણ્ણાવી તેથી તેની માફક પ્રસંગ આવે.

૫—ભારતનું દ્રષ્ટાન્ત છે નહીં કે અનુકરણ તમારે તો ગૃહસ્થોના મુખડોશનું અનુકરણ ક્રેનું છે. તેમ જ આશાતનાના ભયથી તે માનીને અનુકરણ કરો છો.

૬—બાંધનારની મુહૂરતિ ભીની થાય તે શ્રોતાને દ્રષ્ટા દેખી શકે છે, ને તે નાક ઉપર હોવાથી અધર રહે છે.

૭—મૃતકના કાન વિંધવાના પાઠ તો આપો કે કેથી બીજી પ્રસંગે તે છવિછેદનું ચોગ્યપણું છે કે કેમ ? તે વિચારાય.

૮—શ્રી ભગવતીજના વાક્યથી ભોકાતાં મુખ ઢાંકવું એટલું જ નક્કી છે. જો તેથી સાવદ્ર વચનપણું ટાળવા બાંધવાનું હોય તો બધી વખત ભોકાતાં બાંધવી પડશે.

૯—નમુખુણું કહેતાં મુખ આગળ હાથને મુહૂરતિ રાખી મુખમુદ્રા અને છે. હાથમાં હોવાથી જ નિઃશરની ચોગમુદ્રથી આ જુદી પડે.

૧૦—મુખ આગળ મુહૂરતિ હાથે રખાય તે સ્થાપન નહીં ?

૧૧—ચચ્ચીસારમાં દ્વયજના અર્થમાં જુદું કહેલ છે.

૧૨—મુખડોશ બાંધનાર મૌન હોછ તમારે વાંચવું છે.

### તૃતીય વર્ષ અંક ૨ બ્લો

આસો વદો)) તા. ૭-૧૧-૩૪. સુધ્વનાર

૧. સુહૃપતિ ચર્ચાસારમાં પંચવરસુની ઇયરોડળિ એ જાથા અને તેની ટીકા આપને તેના તાત્પર્ય તથા ભાવાર્થમાં સુખ બાંધવાનું જણાવેલું હોનાથી સત્યતા માટે—‘ વિધિગુહીતયા સુખવિનિકયા સ્વગિતસુખકમલાઃ’ એ પાઠ અર્થ સાથે જણાવી સુખખંધનને। અર્થે ખોટા છે એ જણાવાયું છે ( એમાં ભાત્ર લીટી હાથ પગ વગરની કલેવું તે ઉપયોગી વરસુને નહિ સમજનારાનું કાર્ય છે.)

૨. ૨સુહૃપતિ ચર્ચા-સાર ખાલ પાડીને જો વાસ્તવિક નિર્ણય કરવો હતો તો નગરશોઠની પાસે બ્યાખ્યાન વખતે સુહૃપતિ બાંધવાના વિષયને કેમ બાદ કરાયો ? તથા સંમેલનમાં એક વિદ્ધાન સુનિએ તમને તે ચર્ચા કરવાનું કહ્યું હતું છતાં કેમ ખસી ગયા ? કેજી પણ પ્રતિશા કરી ભધ્યરથોનાં નામ આપી જાહેર કરવો તો બીજાઓ તૈયાર જ છે.

ચર્ચાસારની ભાફું ખોટા પાડો અને અર્થો ન આપતાં બ્યાખ્યાનની વખતે સુહૃપતિ બાંધવાના વિધાનનો પાઠ અપાય તો તે પક્ષને શોભાવાળું છે. કાને કાઢવા વિગેરેમાં કાન વિંધ્યાનો પાઠ હોય તો પણ લેખકે આપવો જોઈએ કારણું કે ત્યાં તો ગરફને ગાંઠ વાળવાની વાત છે.

**દીર્પણું-૨.** એક હાથની આખી ટીકા હયાતીમાં વિધમાન છતાં તે પહુંલા મૂળની ભાફું પોતાના છક્કાને સત્તે કરાવવા પ્રયત્ન કરાય તે જ મિથ્યા તમેને નથી લાગતું ? આવા અનથી ઉપલવનારા અર્થી કરનાર પંદ્રિતવર્ણી તેઓને કેવા કહે ? તે જ વિચારણીઃ

૨. નગરશોઠની પાસે બ્યાખ્યાનાદિની ચર્ચા બાદ કરાવનાર બીજાને કહેછે

‘ કે બાદ કરાવેલ, વાઢ ! શુદ્ધિનો ઉપયોગ ખૂબ હેખાડાય. બાદ કરાવનાર કખનાર તો નથીને ? અને વિદ્ધાન એક સુનિએ સંમેલનનો વખત ખૂલ્યું થતાં કહ્યા બાદ ચાલતાં કાઘેલ તેનો જવાબ ચર્ચા કરવાનો જ આપવામાં આવેલ તે તો તમો ભક્તી ગયા હયો ને !

સત્ય વરસ્તુ તો આ જમાનામાં ભૂલાબ, તેમાં વીસભી સહીનો જ હોથ  
ને ? આ બાઅત પ્રથમથી જ ચર્ચા-સાર ઘડાર પાડી ચેલેંજ ફેલ છતાં  
કાયરથી ચેલેંજ સ્ટીકારાય નહીં અને આધે રહી પેપર કારાએ થકા તકા  
લખી કરી ગાંધે તેમાં હોથ કોનો જ ને નિષ્ઠુર્ય કરવાની કાવળા હોત  
તો વાતને સંમેલનમાં ડ્પાડી. અવક્ષ્ય સત્ય વરસ્તુનો નિષ્ઠુર્ય કરત, પણ  
ન્યાં ગુરુ પર શક્ષાનો અભાવ દિક્ષિતાચર થતો હોથ ત્યાં અન્ય પર  
શક્ષું કેવી રીતે સંભવે ? આપના જ ગુરુ વ્યાખ્યાદિમાં મુહૂર્પત્રિ  
બાંધતા હતા કે ?



: ૪૧ :

### જવાણ

તા. ૨૫ નવેમ્બર ૧૯૩૪

#### સમાલોચના પર દિશાપતાઃ—

ટૂંકા કાગલ ઉપર ગ્રતો લખવાની શરૂઆત વિકભની ૧૧ મા સદીથી શરી થયેલી જણ્ણાય છે. શાસનમાન્ય પરમ ગીતાર્થ હીરસ્થીશ્વરજી મહારાજ બાળ્યાન સમયે સુહપતિ બાંધતા હતા એમ તે સમયના વિદ્વભાન કવિ રૂષભદ્રાસજી હીરસ્થીરિરાસમાં લખે છે. હરિયલો એક પ્રશ્ન પૂછ્યો. “કંપડા કર્યું બંધેઈ” થુંક પ્રિતાય ઉપર જર્ઝ લાગે તણે બંધ્યા હે એહિ ॥ ૧ ॥ હરિયલો હિર એમ પૂછ્યો “થુંક પાક કે નાપાક ?” હીર કહે “સુખમાં તવ પાકી, નીકળે નામ નાપાકી ” ॥ ૨ ॥ વાયક, એ ગલની અંદર તાડપત્રના લાંબા પાના કે લાંબી પાઠલીની ગંધ સરળી પણ નથી. હરિયલ મચ્છી રાસમાં તો સાધુઓ મેઠે સુહપતિ બાંધી બાળ્યાન કરે એવા ચોક્કા અક્ષરો છે. બીજે બંડ, ક હી દાલ.

સૂલભણોધી જીવા, માડ તિજ ખટ કર્મ,

સાધુજન સુખ સુહપતિ, બાંધી કહે નિનધર્મ ॥ ૧ ॥

સમાલોચની પરંપરામાં થઈ ગયેલા પૂર્વપુરુષોએ પણ સુહપતિ બાંધેલી છે, તે સમાલોચક અને બીજી વૃદ્ધ માણુસો પણ જાણે છે. પૂર્વપુરુષોએ સુહપતિ બાંધી એટલું સ્વીકાર કરીને એમાં જીવાત્પતિના સંભવની કલ્પના કરી, પૂર્વધર મહારાજ આહિ મહાપુરુષે ઉપર હોષ્ટનું આરાપણ કરતું એ પૂર્વપુરુષોની મસ્કરી નહિ તો બીજું થું કહેવાય ? સુહપતિ બાંધનારા હાલ પણ વિદ્વભાન છે.

સમાલોચક પ્રત્યક્ષ જુઓ છે છતાં “નીકળી ગઈ છે” એવું કહે એ હડહડતું અસત્ય નહિ તો બીજું થું ?

૧. બાળ્યાન પ્રસંગના ચિત્રોમાં સુખના દેખાવની ખાતર સુહપતિ બંધન ન કર્યું હોય તેથી સુહપતિ નથી બાંધતા એમ શી રીત કહેવાય ? જુઓ લુવારની ચોળે પં. મણ્ણુવિજયજહાની

છથી છે તેમાં મુહુપતિ બંધન નથી કર્યું એટલે તેઓશી મુહુપતિ નહોતા બાંધતા એમ ડાણું કહી શકે છે ?

૨. જેના હૃદયમાં એવી ભાવના હોય કે સાચું તે જ માઝને મુહુપતિ ચર્ચાસારની અંદર મુહુપતિ બંધનને વિહિત કરનારા ધાર્યા પાડો છે. બાઝી જેને એમ જ હોય કે હું કહું તે સાચું, માઝાં તે સાચું તેને માટે એક પાઠ નથી. પંચવરસુતુમાં ૬૫૭ મી ગાથાની ટીકામાં મુખ્યવિનિક્યા વિધિગુહીતયા સ્વાગિતમુખકમલ:- એ પહોને અર્થ સાગરજી હાથમાં પડકેલી મુહુપતિથી જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાતું રૂપદ્ધયે લખે છે. એ પહોને સાગરજી ને અર્થ કરે છે તે હરિભદ્રસરીશરના અભિપ્રાયને અનુસરતો નથી એમ અમારે કહેણું પડતે. ઉપરોક્તા પહોનાં વ્યાખ્યાન સાંભળનારને મુખ્યબંધન કરવાતું હોતું નથી એ જમણહેર છે, છતાં ચર્ચાસારની અંદર આપેલ મુહુપતિ બંધનને લગતા પાડોને, અસત્ય કરવાની ખાતર વ્યાખ્યાન શર્ષદ ઉમેરીને, મનમાન્યો અર્થ કરે છે તેથી ખુલાસો કરવાની જરૂર રહે છે.

વાચક ! પંચવરસુતુની ઉપરોક્તા ગાથા આચાર્ય પહૂંચાન પ્રસંગને અનુસરતી છે. આચાર્યપદ અપાય તે વખતે આચાર્ય શિષ્યને નંદીસ્ત્ર સંબલાવે છે, અને શિષ્ય ડેવી રીતે નંદી સંબલે, તે, વિધિને નિર્દેશ આ ગાથામાં કરેલો છે. એનો સંખ્ય પૂર્વની ગાથાની સાથે છે, ટીકાના ઉપરોક્તા પહોનો સાગરજી ને અર્થ કરે છે તેની સાથે વિચારિએ. મુહુપતિ એ સાંદુણું ચિહ્ન છે. પંચવરસુતુમાં સાંદુણે, એ પ્રકારની, મુહુપતિ રાખવાતું કર્યું છે : હાથમાં રાખવાની અને મોઢે બાંધવાની, એનું પ્રમાણું ત્યાં આપેલ છે. મોઢે બાંધવાની મુહુપતિનો અવસરે ઉપરોક્ત થાય છે અને હાથમાં રાખવાની મુહુપતિ તો હમેશાં દરેક સાંદુણા હાથમાં જ રહે છે એટલે ‘મુખ્યવિનિક્યા સ્વાગિતમુખકમલ :’ એ પહોને ઉપરથી હાથમાં પડકેલી મુહુપતિથી મુખ ઢાંઢવું એ અર્થ રૂપદ્ધ આની જામ છે એટલે વિધિગુહીતયા પદની જરૂર રહેતી નથી; પરંતુ આચાર્યપદ પ્રસંગે શિષ્યે પણ નંદીસ્ત્ર સાંભળતી વખતે મુહુપતિ બંધન ‘કરવું નેછાં

તે માટે જ હરિલદસરિએ મુહુપતિના વિશેપણું તરીકે ‘વિબિશુહોત્યા’  
પદ મુડેલ છે. એ પદ ઉપરથી મોઢે બાંધવાની જ મુહુપતિ બેવાય  
પણ હાથમાં રાખવાની બેવાસે નહીં. તેથી ચૈચીસારભાં ‘બાંધવાતું’  
લખ્યું છે તે જોડું નથી. એક વિદ્ધાન ‘પણ ઝાંગ્રીદ્ધથી વસુ’ થઈ  
સત્ય ‘વાતને જનતાની આગળ ડુની રીતે અસત્યના ઇપમાં ફેલાવેં છે  
તે જણાવવા માટે ‘આઠલું’ લખ્યું પડ્યું છે,

### જવાય

તા. ૫ ડિસેમ્બર ૧૯૩૪

સિદ્ધયક પાક્ષિક વર્ષ ઉન્નું, આંક લાલભાં આવેલ સમાવેચનાનો  
બેનાચાર્ય વિજયહર્ષસુરીશરજી તરફથી મુલાકે.

ડોધે સમજદાર, અને સરલ વ્યક્તિને અપવાહ તરીકે આદ  
કરતાં પ્રાયઃ કરીને સર્વત્ર એ જ નિયમ પ્રયોગિતે થયેદો. જણ્ણાય છે  
કે મોતાની વાતને સિદ્ધ કરવા માટે મનુષ્ય દૈક પ્રકારના પ્રયત્ને  
કરે છે. અને ડેટલીક વખત ‘ઇલતો માણુસ તણુખલાને પકડે’ એ  
ન્યાય વ્યાખ્યાનાંહિક પ્રસંગે મુહુપતિ બાંધવાની પ્રથા સનાતન અને  
સત્ય હોવાથી તેની વિરદ્ધ બોલતાં ધણ્ણી વાર અસંબંધ હલીબો થતી  
નેવાભાં આવે છે.

જનસમાજ સત્ય વર્તુલિથિતથી શાત થાય. તે હેતુથી ‘આ  
ચ્યાં પરત્વે અમારી તરફથી અવારનવાર પ્રકાશનમાં ડિરણો હેંક્લોઓ  
આવે છે. અરણુ !

તેમના તરફથી લખવાભાં આવેલ છે કે “તાડપત્રની પ્રતો  
કંડી થાડી ત્યારે લાંખી ધણ્ણી હોય છે.” આના જવાયમાં  
જણાવવાતું કે આ વિષય પરતે અન્ય બેખમાં સવિસતર રહીએ આપેલ  
છે તો પણ તે વિષે કંડામાં જણાવવાતું કે-પ્રાચીન શાનભાડારો  
જેતાં રપણ જણ્ણાય છે કે તાડપત્ર પર લખાયેલ પ્રતો જ થાડી છે,  
જ્યારે મોટા પ્રમાણુમાં કાગળ ઉપર પ્રાચીન પ્રતો ઉપલખ્ય થાય  
છે. વળી તાડપત્ર ઉપર જે થાડે અંશે લખાયેલ છે તેમાં પણ  
ડેટલેક રથાને નાના તાડપત્ર પર તથા કોઝપત્ર પર પણ લખાયેલી

પ્રતો અમારા સંભળવામાં આવેલ છે. આ ઉપરથી વેખણી વાત ટકી શકતી નથી.

આગળ ચાલતાં તેઓ જણાવે છે કે “પાટલી સાથે પાતું રાખે તો પણ લાંબો પાટલી એક હાથે રહે નહીં, અને વંચાય પણ નહીં.” આના પ્રત્યુત્તરમાં જણાવવાતું કે એ તો સૌના સર્વસામાન્ય અનુભવની વાત છે કે એક હાથમાં પાટલી ખુશીથી રાખી શકાય અને વંચવામાં પણ કરેલા બાધ આવી શકશે નહીં.

તેઓશ્રી લખે છે “બાંધનાર પક્ષ વધારે ચર્ચા ન વધારવા માગતો હોય કે સત્યતું સમર્થન કરવા માંગતો હોય તો બ્યાખ્યાનની વખતે બાંધવાનો પુરાનો આપે એ જ સાહેં છે.” આના જવાબમાં જણાવવાતું કે ચર્ચાસારની ખુકમાં રૂપદ્વિષે શાખી પ પાડો અપાયેલા છે. તેમ છતાં જો નહીં બાંધનારાઓ બાંધતા થશે તો તે વિષેના અન્યો રજૂ કરવાનો પ્રયત્ન કરશું.

આગળ ચાલતાં આપ જણાવો છો કે “આશાતના ટાળવા માટે જ મુખ્યકાશ બાંધવાની જરૂર ગૃહસ્થના અનુકરણે શાખાના વિધિપાઠ વગર જણાવી તેથી તેની માઝક પ્રસંગ આવે.” આના પ્રત્યુત્તરમાં જખવાતું કે શ્રી તીર્થંકર ભગવાનના મુખેથી ત્રિપદી સંભળને ગણુધર મહારાજાઓ અંતર્મુહૂર્તમાં દ્વાદ્શાંગીની રચના કરે છે, તેમ જ સાધુની રચાપના પ્રથમ જ છે અને મુહૂર્પતિનો સ્વીકાર દીક્ષાની સાથે છે. ગૃહસ્થના મુખ્યકાશના અનુકરણથી સાધુએ બ્યાઘ્યાનાદિક સમયે મુખ પર મુહૂર્પતિ બાંધે છે, એમ લખવું એ બ્યાજખી નથી. પ્રશ્ન અને શાનાદિકની આશાતના સર્વવિરતિ ચાલે છે એના અનુકરણે દેશવિરતિ પણ ટાળે છે. સર્વવિરતિ મુહૂર્પતિનો ઉપયોગ રાખી બોલે છે. એના અનુકરણે દેશવિરતિ પણ મુહૂર્પતિ અથવા વખતો ઉપયોગ રાખી બોલે છે. વળી મુખ્યકાશ જુદી વરતુ છે એટલે અનુકરણ જણાય જ કંઈ રીતે? અથીત તે વાક્ય તફન અયોગ્ય અને અસંખ્ય છે. એ ફરેક સુંગ વિવારક સ્વભાવે સમજ શકે તેમ છે અને તેવા વાક્યદારા પૂર્વ-પુર્વધોની પણ આશાતના થાય છે, જે ફુલખ ખીના છે. આ પ્રથા

એ કાંઈ આજકાલ શરૂ થયેલ પ્રથા નથી, પરંતુ પૂર્વના શ્રી ગણુધર મહારાજાનિઃ સુવિહિત પૂર્વધર મહાપુરુષો તરફથી પરંપરામાં ભગેલ વારસો છે તેમજ શ્રી યુદેરાયજુ મહારાજનાં પહેલાના અધાના પૂર્વને બાંધતા હતા એ નિઃસંશય જીવા છે.

શ્રી યુદેરાયજુ મહારાજનાં પરિવારમાં પણ શ્રી નીતિવિજયજી મહારાજે બાંધેલ છે, તેમ તેમના પરિવારે પણ બાંધેલ છે. બહુશુદુત પંન્યાસજી શ્રી ગંગીરવિજયજી મહારાજે પણ અમદાવાદમાં લુચારની પોળના ઉપાદ્યાન સમયે બાંધેલ હતી એટલું જ નહીં પણ એ પ્રથા સત્ય અને વાસ્તવિક છે તેમ તઓશ્રીએ લખેલ પણ છે. બહુશુદુત સુરિવરોએ પણ પરંપરાથી બાંધવાનું સ્વીકાર્યું છે. તેમના હસ્તાક્ષરો પણ જનતાની લણું માટે પ્રસિદ્ધ થયેલા છે. પ્રસિદ્ધ સૂરીશરોએ પણ કહેલ છે કે ગુરમહારાજ નહોતા બાંધતા એટથે અમો નથી બાંધતા; પણ બાંધવાનો રિવાજ જોડો નથી ગણુતા. કર્મનું સારું શાન ધરાવતાર પ્રસિદ્ધ ઉપાધ્યાયજીએ પણ અમારા એક સાધુની સાચે વાતચીત દરમ્યાન કહેલ છે કે-મુહુપતિ બાંધવા વિષેના પાડો તમારો કરતાં પણ અમારા વાંઘવામાં વધારે આવેલ છે. પ્રસિદ્ધ પંન્યાસજીએ પણ અમારા એક સાધુ સાચે વાતચીત દરમ્યાન કહેલ છે કે-મુહુપતિ બાંધવાનું ખંડન કરનાર વિરાધક છે. આ સર્વ નક્કર હકીકતો ઉપરથી દેરકે સુધી મનુષ્યો સમજ શક્શો કુ તે વસ્તુ સ્વયં પ્રકાશિત અને સત્ય છે. કદાચ મુહુપતિ ન બંધાતી હોય તો મૌન રહેનું ડચિત, એ, પરંતુ તેનું ખંડન કરવાથી તો અલાર સુધીના રાનીઓની અવરૂઢ કરવા જેવું થાય છે.

સૂત્રોમાં સાધુનું અનુકરણું ગૃહણયોને હોય છે પણ ગૃહસ્થનું અનુકરણું સાધુઓએ કર્યું તેવું જેવામાં કે સાંભળવામાં આવેલ નથી. શ્રી બગવતીજી તેમજ શ્રી ગાતાસુત્રાદિમાં આથાતના ટાળવાને અંગે જમાલી, મેધકુમારની દીક્ષા પ્રસંગે તેમનું ભરતક સુંડનાર માથુસ મુખે સુખકોશ બાંધીને સુંડન કરે છે તેવા પાડો છે. આ ઉપરથી જાણી શકાય છે કે સુંડનાર વ્યક્તિ ગૃહસ્થ એવા રાજપુત્રોની અવરૂઢ ટાળવા માટે મોઢે સુખકોશ બાંધે છે તો સાધુઓ

ગાનની આશાતના ટાળવા મુખે મુહૂરતિ આંધે એ તો સ્વાભાવિક જ છે.

એ જ સમાલોચનામાં આગળ ચાલતાં ગૃહરથના અતુકૃષ્ણની એની એ વાત વળી દરીને લખે છે કે-અમરનું દિશાંત છે, નહીં કે અતુકૃષ્ણ તમારે, તો ગૃહરથના મુખડોશતું અતુકૃષ્ણ લેવું છે, તેમજ આશાતનાના ભયથી તે ભાતીને અતુકૃષ્ણ કર્યો છે ! તેમના જ્ઞાન વાક્યોનો સવિસ્તર જવાબ ઉપર અપાઈ રહેલ છે, છતાં કુંડામાં જણાવવાનું કે અમારે ગૃહરથના મુખડોશતું અતુકૃષ્ણ કર્યું જ નથી. પણ અખંડ-ઠેડ પૂર્વધરોથી ચાલી આવતી પ્રથા તથા આગમ તેમજ ચાલવયનોને ભાન આપીને જ બાંધીએ છીએ, નહીં કે કદાઅહવશ.

તેઓશ્રી લખે છે કે “બાંધનારની મુહૂરતિ ભીની ખાય તે શ્રોતા ને દિશા એમ દરેક જાણી શકે છે,” બાકી હાથમાં રાખીને વાંચનારની તે વિષે ડેટલી ઉપયોગશન્યતા છે તે વિષેની જૂલ કુખુલ કર્યોના દિશાતો મોળુદ છે અને શ્રોતાએને પણ સુવિદિત રહેલ છે. હાથમાં રાખીને વાંચનારની ઉપયોગશન્યતા હોય છે.

તેઓ લખે છે કે “મુતકાં કાન વીધિવાના પાઠ તો આપો કે નેથી ખીલ પ્રસંગે તે છવિછેન્ટું યોગ્યપણું છે કે કેમ તે વિચારાય.”

આના જવાબમાં લખવાનું કે આવસ્યક અહૃતૃતિ હરિભદ્રસ્થિરિ-તમાં જણાવે છે કે તુંદસે સુહોવિત્તિયારા બન્ધા “જાળિ સંચાળાણી બંગ્લો અંતરાણી તચ્છહ હરિં ફાલિજાદ,” અર્થ-તેનું રહેં મુહૂરતિથી બાંધે છે કે આંગલીના વચ્ચા સાંધા છે તેમાં ચામડીમાં જરા ચીરો પાડે છે, પગ અને હાથના અંશુઠા બાંધે છે.

અથીત તેનું રહેં મુહૂરતિથી બાંધે છે એ વચ્ચનથી મુહૂરતિ બાંધવાનું જણાવેલ છે. તથા દોરાથી બાંધવાનું વિધાન નથી, આ ઉપરથી કાન વિંધીને પણ સુહૂરતિ મુતકાના મુખે બાંધવી એવો અર્થ સામર્થ્યથી રહેને, આવીજ જાય છે.

આગળ ચાલતાં તેઓ લખે છે કે “શ્રી લગ્નવતીજનાં વાક્યથી બોલતાં મુખ ઢાંખું એટલું જ નક્કી છે, ને તેથી સાવદ

વચનપણં ટાળવા બાંધવાની હોથ તો બધી વખત બોલતાં બાંધવી પડ્યો. ” આના પ્રત્યુત્તરમાં જણ્ણાવવાતું કે ‘શ્રી બગવતીસ્તુતિ’ શ્રી મહાનિશિથસ્તુતિ આહિના શાસ્ત્રપાઠો પ્રમાણે જોઈજો તો બેદાં ઉદ્ઘાટ મુખે ‘ઉગ્રચારાચેલું વચન સાવધ વચન-પાપવાળું’ વચન છે: બધી વખત બાંધવાતું નથી કહું, પરંતુ વ્યાખ્યાનાંધિક નિયત કરેલ સમયે જ બાંધવાની છે. બાકીના સમયમાં હાથમાં રહેલી મુહૂરતિનો ઉપયોગ રાખવાનો છે.

તેઓ લખે છે કે “નમુદ્યુણં કહેતાં મુખ આગળ હાથ ને મુહૂરતિ રાખી ચોગમુદ્રા અને છે.” હાથમાં હોવાથી જ જિનેશ્વરની ચોગમુદ્રાથી આ જુદી પડે છે. ” વ્યાખ્યાનની અને જિનેશ્વરની ધર્મહેષણનાની ચોગમુદ્રા ચૈત્યવંદન બૃહૃદબાધણા પાઠથી જુદી નથી એમ સિદ્ધ છે, છતાં જુદી પડે છે એમ કહેનારે વ્યાખ્યાનની ચોગમુદ્રાના રૂપણ પાડો આપવા.

આચારહિનકરનાં ડા મા ઉદ્ઘાટનાં પ્રવચન મુદ્રાએ ધર્મહેષણ કરવાતું જણ્ણાવેલ છે. વિધિપ્રથા શ્રી જિનભદ્રસુરિફુત ૨૧ મા દારમાં ‘પ્રવચનમુદ્રા સરિણ ધર્મદેશના કાર્યા’ ’ અર્થ-સુરિએ ‘પ્રવચન મુદ્રાએ ધર્મહેષણના કરવી. ’ ‘પ્રવચનમુદ્રા ગુરુણ ધર્મદેશના કાર્યા’ ’ અર્થ-ગુરુએ પ્રવચન મુદ્રાએ ‘ધર્મહેષણના કરવી. ’ ‘દક્ષિણાઙુષેન તર્જની સર્યોજ્ય શેશાઙ્ગલી પ્રસારણેન પ્રવચનમુદ્રા’ ’ અર્થ-જમણા હાથના અંગુઠા સાથે તર્જની આંગળી જોડવી અને બાકીની જુદી રાખવાથી પ્રવચનમુદ્રા થાય છે. વાચનાર મુહૂરતિ નાક પર રાખી કાનમાં ભરાવ્યા વિના વાંચે તો કર્છ રીતે પાનાં અને મુહૂરતિ હાથમાં રાખનારથી (અને હાથ અવરૂઢ હોવાથી) શારીરે મુદ્રા થઈ શકે?

આગળ ચાલતાં તેઓ લખે છે કે “મુખ આગળ મુહૂરતિ હાથે રખાય તે સ્થાપન નહી? ” આના જવાખ્યમાં લખવાતું કે મુખને અડાડીને જ રાખી શકાય અને વાસ્તવિક યતના જળવાય. પરંતુ મુખથી દૂર રાખવાથી પૂર્ખી યતના જળવાતી જ મથી. વ્યાખ્યાનમાં તો નાક પર રાખીને કાનમાં ભરાવવાતું જ કહું છે.

વળા તેઓ લખે છે કે— “ચર્ચિસારખાં હૃપજના અર્થમાં બાંધવાનું જુદું કહેલ છે” તેના પ્રત્યુત્તરમાં જણ્ણાવવાનું કે તે ગાથાનો અર્થ ખાડો છે જ નહીં, પરંતુ વાસ્તવિક છે. ભાગ આણુખાણુના જુદા જુદા શાસ્ત્રોના પાડોનો જ્યાલ રાખીને બાંધવાનો અર્થ ક્ષેવાનું સૂચયનું છે એ સમાલોચનાને સમાપ્ત કરતાં છેવટે તેઓશ્રી લખે છે કે—“સુખકોશ બાંધનાર મૌન હોય, તમારે વાંચવું છે. આ વાક્યના પ્રત્યુત્તરમાં જણ્ણાવવાનું કે એ તો સર્વમાન્ય અને સામાન્ય બાળક પણ સમજ શકે તેવી રૂપણ વાત છે કે જે મૌન રહેનાર પણ બાંધે છે. તો ખોલનારે તો ખાસ કરીને સુહપતિ બાંધવી જ જોઈએ. મૌન રહેનાર આવકને તો જીના શાતતાનું કારણ નથી. સુખમાં કાંઈ પણ બાનો સંભવ નથી. તેમ છતાં પણ જે સુખકોશ બાંધે છે, તો મુનિઓને તો વાંચનને અંગે જીનની આચાતના ટાળવી હોય છે, તેથી વાયુકાયાદિક જીવોની રક્ષા કરવાની હોય છે, તે કારણ માટે આવકથી પણ સાધુની જવાબદારી વિશેષ વધે છે; માટે મુનિઓએ તો જ્યાણનમાં સુહપતિ બાંધવી જ જોઈએ.

વળા આપ વારંવાર રૂપણ પાડોનું જણુવો છો. તો તેવા પાડો અપાયા છે અને જરૂર પડુચે અપાશો, તેમ છતાં ધણી બાંધતો એવી હોય છે કે જે વધારે પ્રસિદ્ધ અને નિયન્ત્રણ આચરણમાં મૂકાયેલ હોય છે. તેના પાડો થોડામાં જ હોય છે. તે ઉપરથી વરતુનો નિષેધ નથી થધું શકતો. દફ્ફાન્ત તરીકે—નવકારવાળીની અંદર પરમેષ્ઠીના ‘૧૦૮’ ગુણો દ્વારા ‘૧૦૫’ પારા નીચે ‘૩’ પારા મેરની જગાએ. એ પ્રમાણે રાખવાનો જુનો રિવાજ છે. મેળને નહીં ઉત્ત્સવવાના પાડો તો છે, પરંતુ મેરને જણ્ણાય નહીં એવા નિષેધક પાઠ છે? નહીં જણ્ણાતા પારા રાખવા ડેવળ નિર્દ્ધિક છે, તેમજ તેથી કાળાતરે કરીને ‘૧૦૮’થી અધિક પારાનાં સંબંધથી પરમેષ્ઠીના ગુણોનું પણ વિરસતાનું થવાનો સંભવ છે. આ વિષયમાં પણ જ્યાં સુધી મેળને નહિં જણ્ણાવાનો પાઠ રજૂ ન થાય ત્યાં સુધી તો દ્વારાંધ્યા વિચારો જ યોગ્ય અર્થાતું મેહના પારા સહિત નવકા-

: ૪૬ :

રવાળી પૂરી ગણ્યા પછી ફેરવીને નવકરવાળી ગણ્યવાથી મેરુ ઉત્ત્સંધનનો હોષ આવતો નથી, અર્થાત् '૧૦૮'થી વધુ પારા રાખવા ડેક જણ્યાતા નથી, તેમજ આ વરતુ પણુ પ્રચલિત હોવાથી તે વિશે પણુ ધણ્યા અન્યોમાં પારાની સંખ્યાનો ખાસ ઉલ્લેખ નથી તેવી જ રીતે અગાઉના વખતમાં દરેક ગચ્છના મુનિઓ મુહૂપતિ મુખ ઉપર બાંધતા હોવાથી તે વિરોના પાડો થોડા અન્યોમાં હોવા સંભવે છે.

વળી ધણ્યાએ શાખામાં ડેટલેક રથાને દાંતની કાનિતું વખુંન આવે છે તે પરથી મુહૂપતિ નહિ બાંધતા હોય તેમ કહે છે, પરંતુ તે વર્ણનાં તો ડેવળ વરતુરવહૃપની દ્વારાયેલ છે, અને તેથા મુહૂપતિ બાંધવાના અભાવને સિદ્ધ કરતાર નથી, ડેમકે તેમ કરવા જત્તા તેઓ જિખાડે મુહે બોલતા હતા તેમ સિદ્ધ થઈ જશે.

અમદાવાદમાં મળેલ સાધુ-સમેલન વખતે શ્રીમાનુ નગરશૈઠની વિનંતિથી અમે મુહૂપતિ આહિની ચર્ચા ઉપાડેલ નહી. તે સમેલનમાં નક્કી થયેલ કે સાધુ-સાધુએ વચ્ચે કોઈ વિષયમાં મલબોદ જિનો થાય તો જો એક જ ગામમાં બને પક્ષનો નિવાસ હોય તો રૂખર ખણાને ખુલાસો કરવો, અને જો બહારગામ હોય તો પ્રથમ પત્ર-વ્યવહાર કરી પછી યોગ્ય જણ્યાય તેમ કરશું.

અમે ચર્ચાની પુક બહાર પાડેલ તે પૂર્વેના અનેક આક્ષેપેનાં પ્રતિકાર તરીકે તથા વરતુરિથતિના નિર્ણયના હેતુથી બહાર પાડેલ, આપના પાસે પણુ અમારી નેમ પુરુણ બહાર પાડવાનો ભાગ ખુલ્દો હતો, પરંતુ આપે તે ભાર્ગને અહણ નહી કરતો 'પેપર' માં ચર્ચાની પ્રથમ શક્યાત કરી. એટલે નિર્પાયે અમારે જહેર પેપરમાં આ પ્રશ્નને છણુવો પડ્યો છે. હવે જો આ લેખોની સમાલોચના નહી આવે તો અમારે મંચ પણુ લખવાપણું રહેતું નથી. અસ્તુ,

સુરેષ કિ અહુના?

કેં શાન્તિ:

વજયહુર્ષ સુરીષરણ મહારાજ

ગોડીજ ઉપાશ્રય, મુંબઈ

૭

જવાબ્દિ

તા. ૧૨ ડાસેમ્પર ૧૯૭૪

સિક્ષયક પાક્ષિક, વર્ષ ત્રીજું, અંક બીજામાં આવેલ સમાચારનાનો જૈનાચાર્ય વિજયહર્ષસુરીધરજી મહારાજ તરક્ષથી ખુલાસે

આપ પંચવરસુનો ચર્ચાસારમાં આપેલ અર્થ ખોટા જણાવો છો તથા તેજ ગાથાનો અર્થ આપે સિક્ષયક પાક્ષિક, વર્ષ ડંજું, અંક ૨૦માં નીચે પ્રમાણે કરેલ છે.

“ સુખવાનીકા વિધિગૃહીતયા સ્વર્ગિતસુખકમણઃ ”  
એ પદો હાથમાં પકડેલી મુહૂરતિથી જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું રૂપણે લખે છે. આના જવાબમાં જણાવવાનું જે-ઉપરની ગાથા, સાંભળનાર શિષ્યની સાંભળવાની વિધિનું વિધાન કરનારી છે. આપે તે ગાથાની વર્ણની પંક્તિ લઈને તેના અર્થ વાંચનારને લાગુ પાડવા પ્રયાસ કરેલો જણાય છે, પરંતુ તે ગાથાનો અર્થ કોઈ પણ રીતે વાંચનારને લાગુ પડી શકતો નથી.

જે આપ તેવો અથ વ્યાખ્યાનદાતાને અંગે લાગુ પાડી શકતા હો તો પંચવરસુની ૬૫૬ તથા ૬૫૭મી ગાથાએ પૂરેપૂરી ટીકા સાથે આપી તેનો રૂપણ અથ વાંચનારને હાથમાં મુહૂરતિરાખવાનો લાગુ કરી બતાવો. ૬૫૭મી ગાથામાં આવતો અપિ શબ્દનો અર્થ અમે પૂર્વે કરી ગયા છીએ એટલે હવે તો આગલા પાછલા સંબંધ સહિત આપને તે પ્રમાણે સિક્ષ કરવાનું બાકી રહેલ છે.

વળી ઉપર જણાવેલો તમારો અર્થ જ વ્યાખ્યાનમાં હાથમાં પકડેલી મુહૂરતિથા મેઢું ઢાંકવાનું છેવાથા વ્યાખ્યાનમાં વાંચનારને મારે જ છે એમ સિક્ષ થતું નથી એટલે વાંચનારને અંગે બાંધવાનું સિક્ષ જ છે. સાંભળનાર સાંધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા આદિ પણ મુહૂરતિથા મેઢું ઢાંકતા હોવાથી ઉપરનો અર્થ શોતાને જ લાગુ પડે છે, પણ વાંચનારને નહો.

ચર્ચાસારમાં તે ગાથાના તાત્પર્ય તથા ભાવાર્થમાં આગળ-પાછળના પાઠના અતુસારે બાંધવાનો અર્થ ક્ષેવાનું સૂચયું છે.

વળી સમાચારનામાં આગળ ચાહતાં આપ લખો છો કે “મુહુપતિ—ચર્ચાસાર” બહાર પાડીને જે વારતવિક નિર્જ્ઞય કરવો હતો તો નગરશૈઠની પાસે વ્યાખ્યાન વખતે મુહુપતિ બાંધવાના વિષયને કેમ બાદ કરાવ્યો? તથા સમેકનમાં એક વિદ્યાનું મુનિએ તમને તે ચર્ચી કરવાનું કહ્યું હતું છતાં કેમ ખસી ગયા? હજુ પણ પ્રતિશા કરી મધ્યસ્થીનાં નામ આપી જહેર કરશો તો ખીલાએ તૈથાર જ છે. ચર્ચાસારની માફક જોટા પાડો અને અથી ન આપતાં વ્યાખ્યાનની વખતે મુહુપતિ બાંધવાના વિધાનોનો પાઠ અપાય તો તે પદ્ધતે શોભા-વાળું છે. કાને કાદવા વિગેરમાં કાન વીધ્યાનો પાઠ હોય તો પણ કેખકે આપવો જોઈએ, કારણું હે લાં તો ગરદને ગાંડ વાળવાની વાત છે.

આના જવાયમાં જલ્લાવવાનું કે નગરશૈઠની સાથે અમારી મુલાકાત હડીભાઇની લાડીમાં થયેલ. પ્રસંગોપાત વાતચીત દરમ્યાન મુહુપતિ વિષયક ચર્ચી કરવા આપ તૈથાર છો? એમ તેમજે કહ્યું. પ્રત્યુત્તરમાં અમારા તરફથી પણ તૈથારીસૂચક જવાય અપાયેલો કે વખતે તેમની સાથે ખીલ પણ ગૃહસ્થ હતા.

આપ જલ્લાવવાનો છો કે એક વિદ્યાનું મુનિએ ચર્ચી કરવાનું કહ્યું છતાં કેમ ખસી ગયા? તેના જવાયમાં જલ્લાવવાનું કે મને ડાઢ પણ મુનિએ કે ડાઢએ ચર્ચી માટે કહેલ જ નથી. માત્ર નગરશૈઠની ગંધ, સમાચારી અને મુહુપતિ વિષયક વાત નહી ચર્ચવાની વિનંતિથી જ તે વાત તે પ્રસંગે ઉપરિથિત થયેલ નહી.

વળી આપ અમને પ્રતિશા કરી મધ્યસ્થના નામ સુચવવાનું લખો છો. તો જલ્લાવવાનું કે અમારા એકલા તરફથી અપાયલાં નામો મધ્યસ્થના ઇગમાં કેમ ગણી શકાશે? તે નામો તો અનેની સમૃતિથી જ થઈ શકે. આડી અમે પણ ચર્ચી માટે તૈથાર છીએ, પરંતુ આપનું ઓઢું અનુકરણ કરવા તૈથાર નથી. દણાંત તરીકે માની દ્યો કે આપ ડાઢ ઘતર દર્શાનાં વ્યક્તિ સાથે ડાઢ પણ વિષય પરતે ચર્ચીમાં ઉત્તરી હો અને તેમાં ક્ષીયોપશમની વિચિત્રતાથી અથવા ઝુદ્ધિમત્તાથી આપનો પક્ષ નિર્ભણ પડે તો તેથી આપ કંઈ તેનો ધર્મ રૂપીકારો

નહી તેવી જ રીતે અમે પણ આપતું ખોડું અનુકરણુ તો નહી જ  
દરી શકીએ.

વળી વર્ત્માનમાં જોઈ શકાય છે કે ન્યાયમંહિરમાં સુક્લવાતા  
દરેક હેંસલાગ્રોમાં દરેક મનુષ્યને સાચો જ ન્યાય મહે છે એવું  
કંઈ નથી, પણ જેનો ધારાશાખી પોતાના અસીલના ડેસની રજુ-  
આત સુંદર રીતે કરી શકતો હોય તેની તરફેણુમાં ન્યાયની તુલા નથે  
છે. આ ઉપરથી સત્ય ન્યાય થયો છે એમ ન જ માની શકાય.  
આપતું અથોગ્ય અનુકરણુ કરવા અમે તૈપાર નથી એના સમર્થનમાં  
આપના થોડા કાબોની અત્રે નેંબ કેવી અસ્થાને તો નથી જ.

ઉત્સર્ગ અને અપવાહ ભાર્ગ-એ અને ભાર્ગી પોતપોતાના  
વિષયમાં અથવા પોતાને સ્થાને બળવાન હોય છે. અપવાહ એ  
વિશેષને અંગે છે. એટલે તેને સામાન્ય ઇપે કરવા જરૂરો અથવા  
જ્યાં ઉત્સર્ગની ગ્રાધાન્યતા હોય તેને ગૌણુ કરીને તે સ્થાને અપ-  
વાહનો ઇપચોગ કરવામાં આવે તો અપવાહનો ઇડપચોગ જ થયો  
ગણી શકાય તેમજ અપવાહ એ જ ઉત્સર્ગનું સ્થાન લઈ લ્યે.  
નિમનલિખિત શાખાપાડો રૂપણું ચોમાસાની દીક્ષાનો નિષેધ  
કરે છે. ‘ઉત્સર્ગ ભાર્ગ એ જ છે.’ કવચિત અપવાહી પાડો છે. તે  
વિશેષ પુરસ્કને અંગે જ છે. તેમજ વર્ત્માનમાં ચોમાસાની દીક્ષા  
નહી હેવાનો રિવાજ પ્રયત્નિત છતાં આપે તેનો આદર કરો નથી  
એ જાણુંતી વાત છે. એટલે તે કાર્યથી સમગ્ર ખાંડુસંરથાના  
નિયમનું ઉલ્લંઘન થયું છે તેમજ ગણી શકાય.

ચોમાસાની દીક્ષાના નિષેધના પાડો અર્થ સાથે

વશ્વાંકાલિક હારિમદ્રીય ટીકા અ૦ ૨, પૃ. ૨૦૩

ઉડુબળ્ણમિ ન અણલાવાસા બાસેડ દોડવિણો સેહા દિક્લિ-  
જાંતિ પાર્થ ઠવળા કળ્યો હિમો હોઇ ॥

શેખાડાળમાં અથોગ્યને દીક્ષા ન આપે. અને ચોમાસાની ગ્રાય  
અને અથોગ્ય અનેને (દીક્ષા) ન આપે. મ્રાયઃ આ સ્થાપના કલ્પ છે,

દશબૈકાલ્પિક ચૂર્ણી અ૦ ૨, પૃ. ૨૨૬.

ઉદ્ગૃહે અણલા ણ પવ્વાવિજ્જંતિ, વાસાસુ સંવેદિ,  
અકપ્વઠવણા ગયા કષ્ણો ઇમો ॥ — શૈખાકાળમાં અયોજયને અને  
વર્ષીઅતુભૂમાં સર્વને દીક્ષા ન આપે. અકલ્પ સ્થાપનાગત આ કલ્પ છે.

સાંકુના ભૂતહેઠને ભૂષયતિ બંધનના પાડો અનેક વખત  
આપના વાંચવામાં આવવાનો સંભવ હોના છતાં કિયામાં ભૂક્વાતી  
વાત તો દૂર રહી પરંતુ આપના તરફથી પ્રકાશિત થયેલ ' સાંકુ  
આવસ્યક ' કિયાસુત ' નામની પ્રતમાં પણ તે વિધિને સ્થાન નથી અપ્રા-  
શેલ, તે ખીના આશ્રમ્ય અને ઐદળનક છે.

વળી નીચેના પાડોથી નેર્ધ શક્ય છે કે પરંપરાયથું આગમ  
છે અને તે પ્રથા આત્મિય છે. તેને લોાપ સંસારની વદ્ધિ કરતાર  
છે. " પરંપરાની આચરણું પ્રલૂંગાશાસ્ત્રસમાન છે. " એટથે હાલમાં  
પણ તે સ્વીકાર કર્યો સિવાય આદે તેમ નથી જ.

ઓચરણાયાશ્ચ લક્ષણમિદં કલ્પભાષ્ય—“ અસહેળ સમા-  
ઇણં જં કાચિય કેણદ અસાબજ્જં । ન નિવારિઅપન્નેહિ બહુમણુ-  
મયમેઅમાયરિં ॥૧॥ ” આચરણ ચ જિનાજ્ઞા સમાનૈવ યદુ  
માધિતં ભાઈશાદૌ અસઢાઇણણંવજ્જં ગીઅત્થ અવારિઅંતિ  
મજ્જ્ઝસ્ત્થા આયરણા વિ કુ આણત્તિ વયણઓ સુબહુ મજંતિ ॥૨॥

આચરણાતું લક્ષણું કલ્પભાષામાં આ પ્રકારનું છે—અશાઠ  
પુરુષે ને આચરણ કર્યું અને ડોધ જગ્યાએ પણ ડોધએ સાવદ  
રહિત જાણી નિષેષ ન કર્યું અને અન્ય એવા ધણું પુરુષોએ ને  
સ્વીકારેલું એવું ને આચરણ તે આચરણ કહીએ.

તે આચરણ પણ શ્રી નિનપરમાત્માની આજા સમાન જ છે  
ને માટે ભાષ્યાદિમાં કર્યું છે કે—અશાઠ પુરુષે આચરણ કરેલું હોય  
અને અનવદ હોય ( નિર્દીષ હોય ) ને ગીતાર્થ પુરુષોએ નિવારણ  
ન કરેલું હોય તો તે આચરણ પણ નિશ્ચે નિનાજ્ઞા જ છે. એવા  
વચનથી મધ્યરથ પુરુષો ધણું માન આપે છે.

તેવી જ રીતે સુષ્પયતિ નાક ઉપર રાખી કાનમાં ભરાવીને  
ભાષ્યાન વાંચવાની આચરણ પણ કેઠ શ્રી ગણુધર મહારાજથી જ  
ચાલી આવે છે એટલે તે શ્રી નિનાજ્ઞા સમાન જ છે.

આગમ, નિર્ણિત, ભાષ્ય, ચૂણી, ટીકા, અવચૂરી આહિ શાસ્ત્રો  
પ્રાકૃત, સંસ્કૃત, બાલાવભોધ આહિ ધણી ભાષાઓમાં છે, તે ચચીને  
અંગે આપે કંઈ કંઈ ભાષાનાં શાસ્ત્રો પ્રમાણુભાં લેવા ભાંગો છે?

વળી ધણી અંગોનાં અનેક આચારોના રચેલાં શાસ્ત્રો વિદ્ધ-  
માન છે તો આપ દૈરેકનાં રચેલાં શાસ્ત્રોને પ્રમાણુભૂત માની ચચીમાં  
સમ્મત ગણો છો કે નહીં? તેનું સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા છે.

વળી શાખાનાં રચનાકાળને અંગે કંઈ સદી સુધીનાં રચાયેલાં  
શાસ્ત્રોને પણ માન્ય ગણો છો? તેનો ખુલાસો કરશો.

ચૂણી, ટીકા આહિના પાડોનો અમલ થતો જેવામાં આવતો  
નથી, તો તે નહીં માનવાને લીધે કે પ્રમાણવણ તે જણ્ણાવશો. વળી  
'બાંધનાર તથા નહીં બાંધનાર એ ઐમાંથી આરાધક ડોષ?'

આ  
પ્રશ્નો પણ ખુલાસો કરશો.

કાળને અંગે આપ ગરદને બાંધવાનું જણાવો છો તેના વિરોધી  
અમે પણ નથી, પરંતુ ઉપરી-સ્થાપના વિગરેની પડિલેણુભાં તો  
મુહૂરતિને કાનમાં ભરવાને પડિલેણા કરવાનું ચોક્કું જણ્ણાવેલ  
છે. એટલે જેણોને ન વીંધેલ હોય તેણોને વીંધવાનો લાવાઈ રહેને  
આવી લય છે. આપે કાળની વાત ફર્યાની પણ તેની સાથે જણ્ણાવા  
છતાં આ વાતને કેમ નથી લખતા?

પડિલેણની વિધિ તો દીક્ષાની શરૂઆતથી જ થાય છે. આપે  
આવશ્યક બાલાવભોધનાં પાઠનું નામ સૂચયું છે તે ઉપરથી માની  
શકાય છે કે-ભાષાનાં શાસ્ત્રો અને બાલાવભોધ શાસ્ત્રો વાદ વખતે  
સમ્મત છે, એમ અમે સમજુઓ છીએ.

વળી ધણી વખતે કહેવામાં આવે છે કે બાંધનારની મુહૂરતિ  
ભીની થાય છે, તો તે વિષે લખવાનું કે દાથમાં રાખીને વાંચનારની  
મુહૂરતિ મોઢા પર નહીં રખાતી હોય તેમજ સુખ પર સુહૂરતિના  
અભાવે જીનની આશાતના તથા જીવવિરાધના તેઓ ટાળી શકતા  
નહીં હોય તેમ આપના લખાણ પરથી જ જણ્ણાય છે; કેમકે બાંધ-  
નારની તો નાક પર રહેતી હોવાથી સુખથી કંઈક અંશે દૂર પણ  
રહે છે, જ્યારે દાથમાં રાખનાર જો બરોઅર ઉપયોગપૂર્વક વર્તે

તો તણે સુખને અડાઈને જ રાખવી નેછાંએ અને તેથી તેની તો વધારે બીની થાય જ. પણ જેઓની બીની ન થતી હોથ તેઓ સુખથી દૂર રાખતા હો, અને તેથી ઉપરોગ બરોખર જળવાતો નહીં જ હોથ તેમ જાણી શકાય છે.

મોઢાથી વ્યાખ્યાન વંચાતું તારે પણ ચોગસુદ્રાએ અને પ્રવચન-સુદ્રાએ વંચાતું તો સુદ્રાના અંગે હાથ દૂઠા રખાતા હોછને સુહપત્તિ બાંધવાનો રિવાજ ડેઢથી ચાલ્યો આવે છે.

પાંચમની ચોથ કારણે પ્રવર્તેલી હોવા છતાં હાલ એ કારણ નાખું થવા છતાં પણ આચરણ તરીકે સ્વીકારાય છે તો પછી સુહ-પત્તિ વ્યાખ્યાનમાં બાંધવાનાં કારણો તો—‘જ્ઞાનાશાતના, અવવિરાધના, સાવધવચનનો પરિહાર ઉપરિથિત છે જ તો પછી શા માટે ન બાંધવી ?’

ભીજું કપડવંજના—બાંધેલાનું જ સાંભળવાની પ્રતિજ્ઞાવાળા ગાંધી બાલાભાઈ રખુછોડના કહેવા પ્રમાણે આપે પણ કપડવંજમાં પંચના ઉપાશ્રમમાં સુહપત્તિ બાંધીને વ્યાખ્યાન કર્યું છે અને તેમણે બને રથબે એ રીતે વ્યાખ્યાન સાંભળ્યું છે. તપાસ કરતાં તે વાત સાચી છે, તેના જેનારાઓની પણ હ્યાતિ છે એટલે એ વાતનો સ્વીકાર આપે કર્યો જ છે, છતાં અસ્વીકાર થા માટે ?

નાક ઉપર રાખી કાનમાં સુહપત્તિ બારાવીને વ્યાખ્યાન વાંચ-વાની સત્ય વાતને સિદ્ધ કરવા અમેનો તૈયાર જ છીએ. એ જ.

લેખક : કેનાચાર્ય વિજયહર્ષસ્કુરીથરણ મહારાજ  
ગોડાલ, પાયધુની, મુંબઈ.



### સિદ્ધયુક્ત અંક ઉને, તૃતીય વર્ષ, તા. ૨૧-૧૧-૩૪ યુધવાર

૧. પચાય શબ્દથી કાગળની સિદ્ધ કરનારે અતુગોગદાર પત્ર ૩૪, પૃષ્ઠ ૧ એવ્યક્તાળિ તલતાહ્યાદિ સંબંધીનિ અને તસ્સ-બાતમિષ્યાસ્તુ પુસ્તકાઃ જેવું, નેથી પણ માત્રમાં પડશે કે મુખ્ય-તાથે તાઉપત્રનાં પુસ્તકો હતાં. નાના દાખામાં લુર્જપત્ર હોય.
૨. ચર્ચાસારમાં પૃષ્ઠ ૬૮-૬૯ ઇયરોડાયિ એ ગાથા છૃપત છે તે તેના તાત્પર્યમાં નંદીસુત સંભળાવતી વખતે શિષ્યે પણ મુહુ-પત્તિવડે મુખ્યાંધન કરતું પડે એમ સમન્ય છે, એમ ચોક્કું વિધિગૃહાત્માના પાઠ્યી વિરુદ્ધ-જૂદું લાગેલ છે.

૩. દર્શાવેકાલિક ચૂર્ણિંભાં દુષ્પભક્તાલમાં પુરતક રાખવું સંયમ છે એમ તો ચાં પત્રે જણાવેલ જ છે, પણ શાખોમાં કહેલ કેખન પ્રાયશીતનો તેથા અપવાહ થાય પણ કાગળને આંગે કરવાં પડતાં અંધનો અપવાહ તેમાં નથી એમ જણાવ્યું હતું, તે તેની અવા-રતનિકા કહેનારે તે ચૂર્ણિંભાંથી પુરતકાંધનો અપવાહ સિદ્ધ થાય તેવો પાઠ આપવો.

૪. હાથથી થતી ચોગમુદ્રામાં મુહુપત્તિ ધરાયના બેને જણા-વનાર ભાજ્યગાથા અને આદીશરચિત્રમાં સ્થારવર્ણોડયુપમુલં વિન્યસ્તમુખ્યવાલ્કિકઃ એટલે મુખ પાસે મુખવાલ્કિકાતું રાખવું વિગેર પાડોથા અંધન ટકું નથી. તે તે વિધિમ્રથા માટે પહેલાં જ લઘ્યું છે કે તે પુરતકો કયાં છે ? વળા તેથા પણ બાંધવી જ પડે તેમ સિદ્ધ થાય તેમ નથી. કોઈ પણ પાઠમાં બંધિય કે બંધિક્રણ એવો પાઠ છે જ નહીં. સ્થાપન, સ્થગન વિગેર શબ્દો તો દ્યૂતામાં પણ લાગુ થાય.

૫. સંપાતિમ આહિનો બચાવ તો વ્યાખ્યાન સિવાયના વખ-તમાં બાંધનારા કરરો તેમ બીજા તે અને બીજી બન્ને વખત પણ કરી શકે.

૬. જેમ વસરીત પ્રમાર્જન વખતે ઇકાટિકા અંધ છે તેમ કોઈ પણ જગા પર વ્યાખ્યાનમાં કર્ણુંબધ અંધ હોય તો પાઠ આપવો.

૭. આઠ પડનો બેખ હોવાથી બાંધવાવાળા એ પડે બાંધે છે,  
માટે તેમને તેવો બેખ આપવાની જરૂર છે.

૮. તતો દશનક્વીધિતિ નિર્વલિતતમઃ પટલો સુનીન્દ્રઃ પ્રાહ  
નેવા અનેક પાડો ભવભાવના, પુણ્યમાલા, વાસુપૂરુષચરિત્ર વિગેરેમાં  
વ્યાખ્યાન કરનાર સુનિરાજ્ઞેના સુખધાન વિનાની સાખિતી  
માટે સ્પષ્ટ છે.

(૧) ચોગમુદ્રામાં હાથ સુખ આગળ રાખવાના ન હોય તો  
શક્કરતવમાં કેમ કરવું ?

(૨) સુહૃપત્તિ વ્યાખ્યાન વખતે હાથમાં રાખવાની હોવાથી જ  
ઘરંતિ અને નજરં એ એ પહોં છે.

(૩) કારણુસર થયેલી, કારણું ન હોય તો હેરવવામાં ડહાપણ  
કેમ નહિ ?

(૪) અધિકતા થધ અનંતાનુખંધીના ગ્રસંગને વારવા ચતુ-  
થાંની સંવત્તસરી થાવત તીથે રહે તે સ્વાભાવિક છે.



જવાયુ

તા. ૨૬ ડિસેમ્બર ૧૯૩૪

સિદ્ધયક પાલિક, તૃતીય વર્ષ, અંક નોંધમાં અમારા બેખની સમાચોચના ભેતાં આપ લખો છો કે “‘પત્તય’ શબ્દથી કાગળની સિદ્ધિ ઠરનારે અનુયોગદાર પત્ર ઉંઘ, પૃષ્ઠ ૧ “પત્રકાળિ તલતાલ્યાદિસંબધિની” અને “તત્ત્વસંઘાતનિષ્પત્તાસ્તુ પુસ્તકાઃ” જેવું, જેથી પણ ભાવુમ પડશો કે સુખ્યતાએ તાડપત્રનાં પુરતકો હતાં, નાના ડાખલમાં ભૂર્જપત્ર હોય” – આના જવાયમાં જણ્ણાવવાનું કે-તમે લખેલ અનુયોગદાર સૂત્રનાં પાઠની સાથે જ નીચે લખેલ પાઠ પણ છે. તેમાં વખત ઉપર લખાયેલને પણ પુરતક કહેલ છે. તેમ જ તલતાલ્યાદિમાં આહિ શબ્દ હોવથી ડોધ પણ રીતે કાગળનો અભાવ પુરવાર થઈ શકતો નથી, એટલે તાડપત્ર ઉપર જ લખાયેલ છે એ કુઠન વાર્તાવિક નથી. વળો ગંઠી, કંચળી, સુધી આહિ પુરતકાના ભેદો દર્શોંયા છે તે તે ઉપરથી લાંખી પ્રતો જ હતી એ વાત જિડી જથ છે, અને લાંખી પ્રતોને કારણે જ સુહપત્તિ વાંખતા એ વાત પણ સ્વતઃ જિડી જથ છે.

તાડપત્રની વચ્ચમાં અને બને પડે હોરાતું પરોવવું આપના શબ્દથી દીક્ષાની ભાતર માની લઈએ તો પણ એ તો પ્રતના રક્ષણને અગે છે. એ બંધન મોઢા પર બાંધવાતું અવર્ત્તક અને તેમ નથી. લેમન વાંચતી વખતે બંધાયેલ પ્રત લઈને વાંચવાનો સંભવ નથી, પણ દૂસ્તા પાના લઈને વાંચવાનો સંભવ છે; એટલે એ હાથથી દેરવાની આઈની દીક્ષા રક્ષી શકતી નથી. નીચેના પાઠથી વખત ઉપર લખાયેલ પુરતક, પુરતક તરીકે સિદ્ધ થાય છે.

“ પત્તયપોત્થય લિહિયંતિ પત્રકાળિ-તલતાલ્યાદિસંબધીનિ તત્ત્વસંઘાતનિષ્પત્તાસ્તુ પુસ્તકાઃ તતશ્ચ પત્રકાળિ ચ પુસ્તકાશ્ચ તેષુ લિહિતં પત્રપુસ્તકલિહિતમ् । અથવા પોત્થયંતિ પોતાં વખતં પત્રકાળિ ચ પોતાં તેષુ લિહિતમ् પત્રકપોતાલિહિતમ् ॥ ”

અહીં તલતાત્યાદિમાં આદિ શબ્દ હોવાથી તાડપત્ર, ભોજપત્ર, કાગળ વિગેરે પણું આવી જય છે, અને તેના સમૃદ્ધથી અનેલા તે પુસ્તકો છે. વખતની અંદર લખાયેલાને તો સ્વતંત્ર પુરતકદ્વારે ઉહેલ છે, એટલે તાડપત્રની મુખ્યતા રહેતી નથી.

આ વિષયને જ સ્વતંત્ર જણાવનારો પાઠ અનુચોભાર ચૂંણું પાના ૧૫માં પણ છે.

“ બદ્ધરિતં ઇમે તાલિમાદિ પચાલિહિતં તે ચેવ તાલિમાદિ પચાપોત્થકતા તેમું લિહિતં બદ્ધો વા લિહિતમ् ॥ ”

વળી છસુની પૂર્વની પાંચમી સદીમાં ચીન દેશથી આવેલ એક મુસ્લિમ હિન્દુસ્તાનનું વર્ષુંન લખ્યું છે—તેમાં લખે છે કે—તે વખતે હિન્દુસ્તાનના લોકો ‘ઇને કુટીને’ કાગળ અનુવાત હતા. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે બગવાન મહાવીર દેવનાં આસપાસનાં વખતમાં પણ કાગળાનું અરિતલ હતું, તેમજ લખાયુંમાં તાડપત્ર અને વખતે અમુક જાતનાં સંરક્ષારો કર્યો પછી જ તેના ઉપર લખવાનું અની શકે. જ્યારે કાગળ ઉપર સંરક્ષારની આવશ્યકતા ન હોઈ સીધી રીતે લખી શકાય એવા ઘણું કારણોથી કાગળ પર લખાયેલ પુસ્તકો વિશેષ પ્રમાણુમાં સંભવે છે.

તે સમાલોચનામાં આગળ ચાલતાં આપ કહેઓ છો કે—“ચચી—સાર પૃષ્ઠ ૬૮—૬૯ માં ઇયરોડિપી એ ગાથા ૬૫૭ છે ને તેના તાત્પર્યમાં નંદીસ્ત્ર સંભલાવતી વખતે શિષ્યે પણ મુહુપત્રિનું “ધન કરવું” પડે, એમ સમજય છે એમ લખ્યું “બિધિગૃહીતયા” ના પાઠથી વિક્ષેપ-જૂહું લખેલ છે.” આના જવાયમાં જણાવવાનું કે—ચચીસારમાં તે રથને આસપાસના પાઠ ઉપરથી બાંધવાનો અર્થ ક્ષેવાનું સૂચયું છે. બાકી હાથમાં તો હમેશાં રખાય છે, છતાં “બિધિગૃહીત” શબ્દ જ હાથમાં રાખવા કરતાં કંઈ જુદો જ અર્થ સૂચવે છે. હાલ પણ નંદી સાંભળતી વખતે મુહુપત્રિ વિશેષ રીતે રખાય છે. વળી વાંચનાર મુહુપત્રિ બાંધી વાંચે છે ત્યારે પ્રાયઃ સાંભળનારે પણ મુખ ઢાંકીને સાંભળવાનો રિવાજ હોવાનો સંભવ છે.

વળો આપ લખો છો કે “ દ્વારાનીકાલિક ચૂણીમાં દુઃખમાલમાં પુરતક રાખવું સંયમ છે એમ તો આપને જણાવેલ જ છે, પણ આખોમાં કહેલ કેંધન પ્રાથમિકતનો તેથી અપવાદ થાય, પણ કાગળને અંગે કરવા પડતા બંધનનો અપવાદ તેમાં નથી એમ જણાવ્યું હતું. તો તેની અવારતવિકાસ કહેનારે તે ચૂણીમાંથી પુરતક બંધનનો અપવાદ સિદ્ધ થાય તેવા પાછ આપવો.” આના જવાખમાં લખવાનું કે વાચકવર્ગ ન સમજ થકે તેવું અરપણ અને ભુલાવામાં પડે તેવું ગોળમટોળ લખાણ આપના તરફથી આવે છે એ પણ નવીનતા જ છે. અસ્તુ. તેના જવાખમાં જણાવવાતું કે આપના જણાવવા મુજબ પુરતક દોરીથી બાંધવાતું તેમજ બીજી જાતનાં ઉપરનાં બંધન કરવાનું તો પુરતક રાખવાનાં અજીવ સંયમથી જ આવી જાય છે, કારણ કે તે તેનું રક્ષણું કરે છે. જો શરીર ધર્મસાધનતું અંગ છે તેથી તેના અંગે ઉપાધિ પણ કેવાય છે તેમ બંધન પણ પુરતકને અંગે જણાવું અને તે તો પુરતકરક્ષણને માટે જ હોય છે. એટથે જેઓ એમ કહે છે કે તે કારણથી જ બાંધવાનો રિવાજ પ્રવતેંદ્રો હતો એ વાત અરાસર નથી. આ વિષેનો વધારે ખુલાસો ઉપરના જવાખમાં આવી જાય છે.

આગળ ચાલતાં આપ જણાવો છો કે “ હાથથી થતી યોગ-મુદ્રામાં સુહપત્તિ ધારણના બેદે જણાવતાર ભાષ્યગાથા અને આદીશર ચરિત્રમાં “સૂરિવર્યોઈપ્યુપસુખ વિન્યસ્તમુખવસ્ત્રિક:” એટથે સુખ પાસે સુખવસ્ત્રિકાનું રાખવું વિગેરે પાડોથી બંધન ટક્કું નથી. ન તે વિધિ પ્રથા માટે પહેલાં જ લઘું છે કે તે પુરતકો કથાં છે? વળો તે ઉપરથી : બાંધવી જ પડે તેમ સિદ્ધ થાય તેમ નથી. કોઈ પણ પાઠમાં “ બંધિય કે બંધિઉય ” એવા પાઠ છે જ નહીં. રથાપન, રથગન વિગેરે શખ્દો તો દ્વારામાં પણ લાગુ થાય.” આના જવાખમાં જણાવવાતું કે મોઢા પર ધારણું કરે એ જાયની ગાથાનાં લખાણ ઉપરથી બાંધવાનું સિદ્ધ થાય છે, કેમકે યોગમુદ્રા એ હાથથી અને છે. એટથે જો સુહપત્તિ મોઢા પર બાંધેલી હોય તો જ યોગમુદ્રાને અભાંડિત રાખીને વાંચવાતું બને; અન્યથા નહીં. વળો

આપના તરફથી આદીશર ચરિત્રની ને પંક્તિ પ્રમાણું તરીકે આપવામાં આવી છે તેમાં વ્યાખ્યાનસૂચક શણદ જ નહીં હોવાથી એ પ્રસંગનું જ લખાય છે એમ કેમ કેમ માની શકાય ? જે તેમજ હોત તો તે સર્વ પ્રસંગનું જ્યાન આપના તરફથી લખાયેલ હોત. અમારે અને તમારે વ્યાખ્યાનપ્રસંગને અંગે સુહપત્તિ અંધનની ચર્ચા છે નથીરે આપે આપેલી પંક્તિમાં તે વાત સુદ્ધા નથી, કેમકે વ્યાખ્યાનાહિ વિના ભીજી પ્રસંગોમાં તો અમે પણ સુદ્ધા વિગેરે કરવાનું વિધાન નહીં હોવાથી તે વાતને સમૃત છીએ.

વળી આપે જણ્ણાવેલા પાઠથી હાથમાં સુહપત્તિ રાખીને વ્યાખ્યાન વાંચવાની વાત સિદ્ધ થતી નથી, કેમકે “ સુરિષ્યોડ્ગ્રાપમુલ્લં વિન્યસ્તમુખ્યાલ્લિકઃ ” અહીં આચર્થવર્દ્ધ મોઢાની પાસે વિરોધ રીતે સ્થાપન કરી છે સુહપત્તિ નેમણે એમ કહેવાથી મોઢા પર રાખી કાનમાં ભરાવીને જ વ્યાખ્યાન કરે તો જ વિન્યસ્તને અર્થ ધ્યાર્થ ધરી શકે, નહીં તો હાથથી મોઢા પર ધારણ કરવાનું લખ્યું હોત. વળી હાથમાં સુહપત્તિ રાખીને વ્યાખ્યાન વાંચવાનું વિધાન કરનાર પાઠ આપ ન આપો ત્યાં સુધી આપની વાત સિદ્ધ થાય તેમ નથી, તેમજ આપના તરફથી આવસ્થક બાલાવણોધનાં પાડના આખારે આઠ પડી સુહપત્તિ વાંચવાનું કહેવામાં આવે છે એટલે નહીં વાંચવાનો પાઠ ભળવો શક્ય નથી, કારણ કે તમારે અને અમારા શાસ્ત્રો એક જ છે. અમે વાંચવાનું સ્વીકાર્યું છે ત્યારે તમો વાંચવાના પાડો આપો છો અને તે પાડો જ તમારે માટે પણ વાંચવાનું વિધાન કરે છે.

વળી એક તરફથી આપ પ્રશ્ન પૂછો છે કે વિધિમથ્ય આદિ શાસ્ત્રો કયાં છે ? અને બીજી જ તરફથી લખો છો કે તેથી અંધન સિદ્ધ થાય તેમ નથી. આવા આચર્થકારક કથનના જવાબમાં લખવાનું કે એ વિપયનો સ્પષ્ટ પાઠ તે અન્યોમાં હોવાથી કોઈથી તેનો ધ્યાનકાર થાય તેમ નથી તથા જુદો અર્થ પણ નીકળો શકે તેમ નથી. વળી પૂર્વે અમે લખી ગયા છીએ કે નહીં વાંચનારાઓ તો બાંધતા થશે તો તે ગ્રતોને પણ રજૂ કરવાનો અયતન કરીશું.

વળી બંધીય, બંધીઉળ એ શખ્દો જ બંધનના અર્થવાળા છે અને બીજા બંધનના અર્થવાચક શખ્દો જ ન હોત અને એમ જ જણ્ણાવેલ હોત તો વારતવિક ગણ્ણાત, પરંતુ તે શખ્દો સિવાય પણ બીજા ધાર્થા શખ્દો બંધનવાચક સાંઘોમાં છે, એટલે બંધનવાચક શખ્દોથી બંધનના અર્થના નિપેશ થાય તેમ નથી. ‘સ્થાપન,’ ‘સ્થગન’ વિભેર શખ્દો તો છૂટામાં પણ લાગુ થાય. અહીં ‘પણ’ કહેવાથી જ બંધનનો અર્થ પણ આપના લખાણ પ્રમાણે પણ નીકળી શકે છે, અને જે જ સ્થાપન બંધનના અર્થ અન્યકારે કર્યો હોય તે પણ સ્વીકારવો જ જોઈએ.

વળી આપ કહેા છો કે—“સંપાતિમ આદિનો બચાવ તો બ્યાખ્યાન સિવાયના વખતમાં બાંધનારા કરશે તેમ બીજા તે અને બીજી વખતે પણ કરી શકે.” આના જવાબમાં જણ્ણાવવાતું કે ‘બીજા દાઈમાં મુદ્દાતું વિધાન નથી’ અને બ્યાખ્યાન સમયે તો મુદ્દા કરવાતું રૂપ્ય વિધાન છે એટલે બાંધ્યા વિના બીજા પ્રસંગની ભાઈક સંપાતિમ આદિ જીવોની રક્ષા થઈ શકે તેમ નથી.

તે જ સમાચોચનામાં આગળ ચાલતાં આપ જણ્ણાવો છો કે “જેમ વરતી ગ્રેમાર્ન વખતે ફૂકાટિક બંધ છે, તેમ કોઈ પણ જગો. પર બ્યાખ્યાનમાં કર્ણુંવેધ બંધ હોય તો પાઠ આપવો.” આના જવાબમાં લખવાતું કે આ વિષય પરતે આ પૂર્વે ધણી વખત લખાઈ ગમેલ છે. તેમજ અને સંક્ષેપમાં જણ્ણાવવાતું કે પડિશેલખુની વિધિ કરતાં ડાનમાં મુહૂરતિ ભરવાવાતું જણ્ણાવેલ છે એટલે જેમો તે વિધિને યથાયોગ્યપણે જગતવના હશે તેમોને કર્ણુંવેધ તો હશે જ. ન વીધેલ હોય તો તેને વીધવાનો અર્થ સામર્થ્યથી આવી જ જય છે. વળી પડિશેલખુની વિધિ તો દીક્ષાના પ્રથમ દીનથી જ જગતવાની હોય છે. જ્યારે બ્યાખ્યાન દેવાતું તો ડાળાંતરે બને છે. ઉદાચ બ્યાખ્યાનને અંગે કર્ણુંવેધનું વિધાન એછું હોય તે! સંભવ; પણ પડિશેલખું આદિની વિધિથી વીધવાતું પ્રથમ થખેલ હોવાને લીધે હશે.

વળી આપ કહેા છો કે “આઠ પડનો સેખ હોવાથી બાંધ-

વાવાલા એ પડે બાંધે છે, માટે તેમને એનો બેખ આપવાની જરૂર છે.” તો લખવાતું કે આઠ પડતું વિધાન જહેર કરનારે વ્યાખ્યાન સમયે આઠ પડ બાંધતા ચલું જોઈએ અને તેવા પાડો રજૂ કરવા જોઈએ, અને બાંધવાતું રવીકારી નહીં બાંધવાની ચચીને અંખ કરવી જોઈએ. ‘બાંધવારાઓ’ એ પડે બાંધતાં જ નથી એવું કહેનાર સત્ય વસ્તુસ્થિતિથી અજાત જ છે.’ ‘આર પડની મુહુપત્તિ જ બંધાય છે’ ‘અને તે ડેઢુથી ચાલી આવેલી પરંપરાગત આચારણું છે’ એટલે તેને વિષે પાઇની આવસ્થયકતા ન જ હોય તે સ્વામ્ભાવિક જ છે. બાકી આઠ પડના રૂપણ કેચો છે તેમ દશ્ચોવનારની તથા-પ્રકારની આચારણું જોવામાં આવતી નથી. તેવા પાડો આપવા જેથી તેના ઉપર વિચાર કરવામાં આવશે, તેમ હવેથી મુહુપત્તિ બાંધવાના પાડ નથી તેમ કહેવું પણ ન જોઈએ.

તે સમાદોચનાની સમાસિ કરતાં આપ જણ્ણાવો છો કે “તતો દશનદીધિતિ નિર્દીલિતતમઃ પટલો મુનીન્દ્રઃ પ્રાહ” જેવા અનેક પાડો લખબાબના, પુષ્પમાલા, વાસ્પપૂજય ચરિત્ર વિગેરેમાં વ્યાખ્યાન કરનાર મુનિરાજેનાં મુખભંધન વિનાની સાધિતી માટે રૂપણ છે” આના જવાખ્યમાં લખવાતું કે-એ જે સ્થાને તેવા મુનીન્દ્રવચોનું વર્ણન કરાયેલ છે તે વસ્તુવસ્તુપની દાણીએ કરાયેલ છે એમ સમ-જરૂરું ખટે છે, પરંતુ તે ઉપરથી તે તે ભહાપુરુષોએ વ્યાખ્યાન સમયે મુહુપત્તિ બાંધી નથી એમ સિદ્ધ કરવા જરૂરો તો આપની વાત તો સિદ્ધ થણી દૂર રહી પરંતુ તેઓ ઉધાડે મુખે બોલતા હતા તેવું વિપરીત સિદ્ધ થશો.

સિદ્ધચક્ક પાક્ષિકના તે જ પૃષ્ઠ પર જૈનમાં આ વિષે આવેલ બેખની સમાદોચના આપે લીધી છે તેમાં પ્રથમના બે પેરેઆઇનો જવાય તો ઉપરના જવાખ્યેમાં આવી જાય છે. આગળ ચાલતાં આપ લખો છો કે “કારણુસર થયેલી પ્રવત્તિ કારણું ન હોય તો ઇરવવામાં ડાખણું કેમ નહીં ? ” આના જવાખ્યમાં લખવાતું-કે સલા સભક્ષ કુદ્ધસ્ત્રવાંચવાની અને સાંભળવાની પ્રવત્તિ કારણુસર થયેલ તેમજ પ્રતિકભણ્ણની અંતર્ગત ‘દ્વાતસ્ય’ ની રહુતિ તે પણ કારણુસર દાખણ

કરેલ. આત્મારે તે અને કારણોનો અભાવ છે, અને કારણો સહિતર નાથું થયાં છે છતાં તે અને પ્રવિદ્ધિને ડારાપણ માનીને કેમ ફેરવતા નથી? એ જ પ્રમાણે કેમ ચાલુ રાખો છો? જ્યારે મુહૂરતિ બધનમાં તો એક પણ કારણ નાથું થયું નથી. જેનાં કારણોનો અભાવ છે તેને ચાલુ રાખો છો, અને જેનાં કારણોનો અભાવ નથી તેવા પ્રવિદ્ધિને કોણો છો એ સખેદ અનિયાનીય છે.

વળી આપ લખો છો કે “ અધિકૃતા થઈ અનંતાતુધારીના પ્રસંગને વારવા ચતુર્થીની સંવત્સરી યાવતીર્થ રહે તે સ્વાભાવિક છે.” આ વિષે જલ્દીવાતાનું કે ચોથની સંવત્સરી કારણુસર થયેલી એ અરોપર છે, વચ્ચા ગાળામાં ડેટલાડોનો તેને અંગે વિરોધ થયેલ અને તેથી ડેટલાક ગચ્છવાલા હાલમાં પણ તેમ કરતા નથી છતાં ચોથની સંવત્સરી તીર્થની હયાતી સુધી રહેવાની છે, તો પછો મુહૂરતિ બધનનાં કારણો મોણુદ છે છતાં તેનો નિષેધ કેમ કરી શકાય? બાંધવી યા ન બાંધવી તે અલગ વાત છે પરંતુ સત્યને સલ તરીકે કખૂલ કરતું એ જ ખરા આત્માર્થી મુખુક્ષુ જનોનું લક્ષણું છે. અરતુ.—

જૈનાચાર્ય વિજયહર્ષસૂરીશ્વરલ્લ મહારાજ

પાયધુની, ગોડાળ ઉપાશ્રય, સુંધરી બાંહર



### પ્રક્રિયા

સિદ્ધચક્ર, તૃતીય વર્ષ, અંક ૪ છે, તા. ૬-૧૨-૩૪ ગુરુવાર

૧. ચૂંખીંડાર મહારાજે પુરતક રાખવામાં ચરણુકરણ અને અભ્યુચ્છેષ એ કારણો કલાં છે.

૨. બાંધનો અધિકાર તો ત્યાં નથી જ.

૩. ઐધ્યા પ્રતો મોટા તાપત્રોની છે એમ રૂપી લખાણ છે ત્યાં અન્યથા લખવું કે ચર્ચાવું તે શાબાદપ નથી.

૪. રૂપચવસુમાં મુહૂર્તિના પ્રમાણમાં એ પક્ષ છે, પણ એ મુહૂર્તિઓ નથી.

૫. ઉદ્ઘિગૃહીતયા પદથી બાંધવાનો અર્થ કરનારે સત્ય સમજવાની જરૂર છે. શું એ પદ ન હોય ત્યાં વસતિ પ્રમાર્જનાહિના બાંધવાનો અર્થ નહિ કરવો ?

૬. ઈઆમા ચર્ચાસારમાં એક પણ પાઠ વ્યાખ્યાનની મુહૂર્તિનું વિધાન કરનારે નથી.

૭. પચર્ચાસારના ફોટાઓ તો કલિપ્ટ જ છે ને !

૧. એસલમેર વિગેરે બાંદારોમાં ધ્યા પ્રતો નાની પણ છે. આપની દિક્ષિદોપથી કદાચ રમૃતિ બહાર જય તેમાં હોય કોનો ?

૨. મુહૂર્તિના એ પક્ષાની યાદી મૂકવાની આવસ્થાકરા હેખાતી ન હતી ?

૩. વિદ્ઘિગૃહીતયા પદને આગળ-પાછળના સંધાણુ સિવાય બહાર ફોનારે સત્ય સમજવાની જરૂર નથી લાગતી શું ?

૪. આમા ચર્ચાસારમાં એક પણ પાઠ મુહૂર્તિ વગર વ્યાખ્યાન બાંધવાનું વિધાન કરનારે નથી.

૫. હાથમાં મુખવિનિકા રાખી વ્યાખ્યાનાહિના ફોટાઓ બધાએ અસત્ય અને કલિપ્ટ જ છે ને ?

: ૬૫ :

૧. એચ્યોસારનો એક પુષ્પ પાડ કાન વીધવા અને વ્યાપ્ત્યાન વખતે સુહપત્તિ બાંધવાનું વિધાન કરનારો નથી.
૨. મોટાં તાડપત્રોને ત્રણુ હોરીથી બંધાય છે ને તેનું અનુક્રમણ કાગળની પ્રતોભાં પણ જગા આખી રાખી થયું છે.
૩. એચ્યોસારમાં દ્વારા ગાથા છે તેનો અર્થ એવો છે,
- ૪ વસતિપ્રમાર્જન વખતે કાંદિંગ બંધ છે, કાન વીધવાનું નથી.
૫. આઠ ઉપડનું જ્યાદે વિધાન કણ્ણ છે, તે પછી વ્યાપ્ત્યાન વખતે એ પડ થાય છે તેનો બેખ આપવો જોઈએ.

૧. એચ્યોસારમી સહી પહેલાંની પ્રતો જેનારા રૂપણપણે, કશી શકે છે કે પ્રાચીન કાળમાં ધણે ભાગે તાડપત્રની અને ધણ્ણા ભાગે ભોટા પાનાની પ્રતો લખાતી હતી. ( તાડાં પાનાં મોટાં હોય તે સ્વાભાવિક છે. નારા પાનાં પણ ભાત્ર આચાતના ટાળવા જેવાં હોય તે પણ ઉપયોગમાં લેવાયાં હોય. )

૨. એચ્યો અઠી, ત્રણુ ત્રણુ કુટની પાઠલીએ પાના સાથે એક હાથે રાખી વાંચવી ન હોવે તે સ્વાભાવિક છે.

૧. એચ્યોસારના પાડો વ્યાપ્ત્યાનાદિમાં સુહપત્તિ બાંધવાના વિધાન કરનારા છે, સત્ય વસ્તુ ન સમજય તેનું શું ?

૨. એચ્યોસારમાં દ્વારા મી ગાથાનો અર્થ સત્ય જ છે. દીકાના વચ્ચી લીઢી લેવાય તે હેવા જ ઓણો ને ?

૩. વિપાક સૂખકાર પ્રથમ અધ્યયનમાં ચર્ચપુરુણું બત્સેણ સુહ બદ્ધમાણી આ પાડ ચાર પડ કે આઠ પડ તે ધ્યાનમાં લઈ વિચારશે, તો અધું યે સમજશે, પણ સમજશું કોને ? કેને જે જ્ઞાનું લાગે તે પ્રસ્તુત પડે ને ?

૪. એચ્યોસારમી સહી બાદ નાનાં તાડપત્રો કે પાનાં થગાં ને ? તેમ આપણું કહેણું તો નથી ને ? પણ વ્યાપ્ત્યાનાદિની પ્રથ્યાલિક પરાપ્રેષણી થાલી આવે છે, એની સાથે શતાંધનો સવાલ જ રહેણો નથી.

૫. મોટા મોટા પાનાની પ્રતો, આપના વિચાર પ્રમાણે સાપડા ઉપર

૩. જેમણિથી પત્ર સખાવીને અંધવાળાએ જ કરી ચંચી શકું હોય.

૪. દ્વારાસારના કથા પાને વ્યાખ્યાનમાં મુહુપત્રિના બંધનનો વિધાનનો રૂપણ પાડું છે તે જણાવવું.

૫. જેમણિકાશનું અતુકૃષ્ણ કરવા અંધવાળા પણે જ કર્યું છે.

૬. ઈપાઠની માંગણૂં વખતે પ્રવત્તિ કે ડાખના અભિપ્રાયો જણાવવા તે ઘોંય નથી.

૭. તે અનુભૂતિનું અને શ્રી જ્ઞાતસ્થિતિમાં તેમણે જણાયે હોયને મુખ્યાંત્રાણ આંધ પડનો છે, નહિ કે એ પડનો.

૮. પવિધાનની અચીમાં પુરુષ પ્રવત્તિને ગોડવની એ નથળાઈ છે.

રાખી પૂર્વે આચાર્યો વ્યાખ્યાન તો નહી વાંચતા હોય ને ? તો મુખ્ય-વિજ્ઞાની જરૂર શું હતી ? તે જ એચાલ સરલ હૃદયમાં આવે તો અણું ય સમન્ય ને ?

૧. મુખ્યિથી બાંધવાળાણી કઈ વ્યક્તિએ પત્ર લખાયો હતો ? અસત્ય વરતુંને રલીકારી આપના હૃદયમાં અસત્યતાં રહેલી હોય એમ રૂપી તરી આવે છે. જૈન રાખી સત્યતાના અવલંખનમાં જ આજ સુધી અનિષ્ટમપણે ચાલ્યું આવે છે અને ચાલશે. સત્યતાના ધર્મની કસોદી છે. સત્યતાવાળો. આત્મા સત્યતાના પણે ચાલી બનશેમણુંને નાખૂં કરે છે.

૨. ચંચાસારના ધર્ષણાએ પાના પર મુહુપત્ર બંધનના પાડો છે.

૩. વ્યાખ્યાનાદિમાં મુખ્યવિજ્ઞાનું વિશિષ્ટ પ્રયોગન પૂર્વના સમય આચાર્યોએ ક્રિયાં અને અમેયે તેચાનું અતુકૃષ્ણ કર્યું. આપે નથી કર્યું તો જ મહાન આચાર્યની અવળા તો નથી કરી ને ? ખૂદ આપના ગુંફની અનજા તો નથી ને ?

૪. પઠણી માંગણૂં દેખોમાં આપ જ કર્યા કરે છો ને ?

૫. વિધાનની ઉત્પત્તિકરનાર પુરુષ, તો પુરુષ પ્રવત્તિ નહી માનનારકેવો ?

૬. વસતિ પ્રમાર્જન કરતાં કાન વીધ્યા વગર પણ મુહૃપતિ અંધાય છે તેમ ભૂતકેને પણ અની શકે.

૧૦. રશેષ વખત વાચનાહિકમાં જેમ ઉપયોગ રખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રાખી શકાય. (પ્રસંગે પુસ્તક સાપ્તા ઉપર પણ રાખી શકાય છે.)

૧૨. ઉત્તેત્વદંન બૃહદ્ભાગમાં ‘ધરંતિ મુહ્યોચ્ચિય નવરં’ એ પાઠથી જ જિનેશ્વર ગણારાજની યોગમુદ્રા કરતાં શૈખ વ્યાખ્યાન કારોની યોગમુદ્રામાં લેછ છે એમ રપણ છે.

૧૨. અપુરસ્તક સાપ્તા ડિપર હોવાથી એક હાથે સુહખપત્તિ અને એક હાથે પ્રવચનમુદ્રા પણ બની શકશે. (ને કે આચાર-દિનિકર અને વિધિપ્રયાને તરે પણ સર્વાંશી ભાન્ય કરી શકો તેભ નથી.)

૧૩. પચાસો વર્ષત બોલતાં જેમ મુહુપતિ મુખ પાસે રખાય તેમ વ્યાખ્યાન વર્ષતે પણ રખાય અને તેને સ્થાપન કહેવાય તેમાં નવાઈ નથી.

૧. કાન વીધવાતા પાડો ને છે તે તમારા મન્ત્ર્ય પ્રમાણે નકામા અતાવ્યા ને ?

૨. વાખ્યાન વખત સિવાય આપણી સંરથામાં મુખવચ્છિનો કેટલો કૃપ્યોગ રખાય છે, તે તમારી અને મારી ધ્યાન બહાર નથી ને ? સાપદા પર પુરસ્તક રાખી વ્યાખ્યાનાં કરતાર કેટલી વ્યક્તિઓ દેખાય છે ? આપ પણ એ પ્રમાણી જ વાચતા હશી ને ?

3. તીર્થકરના કલોમાં અને આચાર્યાના કલોમાં ફેર તો તમોને દેખાતો હો ?

४. पुस्तक सापडा उपर राखी व्याध्यानवंचाय अभ्याप्तुं कडेतुं छे, पछ  
चतुरंगुलं विहस्ती एवं मुहण्टतगस्स उ पमाणं, बितीयं मुहप्पमाणं ॥ १ ॥  
एक देंत अने चार आंगण प्रभाष्टे लेट्टी मुहप्पति अने भीज़ मुखना  
प्रभाष्टे लेट्टी, आ ख अने मुहप्पतिने बरोबर व्यवस्थापूर्वक आप गोड्ही  
होशाने ? मुखना प्रभाष्टे मुहप्पति अताववातुं प्रयोजन शुं ते विचासरो ?  
एक ध्यानथी विचारो तो सापडा राखाशो ने ?

૫. આજે દિવસ સુહપત્તિનો કંપ્યુટર હતો ? ક્યારે કે જ્યારે વ્યાપકાનિમાં પ્રચાર આપના જીવાચે રાખેલ હતો ત્યારે ને ? બાકી થતું તો નથી ને ?

૧૪. વ્યાખ્યાનમાં નાક ઉપર રાખીને સુહપત્તિ કાનમાં ભરાવવી એવા વિધાનનો લેખ કેમ નથી આપતા ?

૧૫. રૂપચંચવરસુતુના પાઠ્યી નંદીસૂત્ર સાંભળતાં વિધિગૃહી-તથા શખદ્ધી હાથમાં રાખવાનો અર્થ થાય છે, માટે બાંધવાનો કરેસો અર્થ બોટા છે અને નંદીસૂત્ર સાંભળનારો કોઈ બાંધતો પણ નથી.

૧૬. ઉચ્ચાશાતના ટાળવા બાંધવી હોય તો સબાના વ્યાખ્યાન વખતે એકલી ન બાંધતાં સગચ્ચ વાંચન વખતે બાંધવી જોઇને.

૧૭. નવકારવાળીના ભષુકા માટે ઉપરોક્તસાચણુભાં રૂપણ સ્થયનો લેખ છે, છતાં તે ભષુકાની સંઘાને જેમ પરંપરા-મૂલક જણ્ણાવાય છે પણ તેમાં લેખનો તેણ કરવામાં આવતો નથી તેમ જે સુહપત્તિ બાંધનમાં પણ કરવામાં આવે તો ચચ્ચી સહેને ઓછી થાય.

૧૮. પ્રદાંતની કાનિતનું વ્યાખ્યાન વખતે વર્ણન સુહપત્તિ ન બાંધી હોય તો જ ચોણ્ણ ગણ્ણાય.

૧૯. સંમેલનમાં સકળ સંધ સમસ્તં શ્રીમાન નગરશેડે

૧. વ્યાખ્યાનાદિમાં સુખવિદ્ધિ નાક ઉપર રાખી કાનમાં ભરાવવાના પાડો ચર્ચા-સારમાં આપી હીધેલા છે, તેને વિચારો. બાદ બીજ નવીન પાડો આપારો. જેને જેટલી શક્કા થાય તેટલું જ અપાય ને ?

૨. લખનાર વ્યક્તિને બાંધવાની જાવના છે જ કયાં ?

૩. વ્યાખ્યાન સમયમાં એક ધારાઓ ને વાંચન થાય અને ઓતા-વગને આનંદ આપાય તેવું તે સમય બાદ કરી કહી શકો છો ને ? વ્યાખ્યાન-સમય સુદ્ધાના ઉલ્લેખો જેમ રાખ્યામાં કરાયેલા છે તેમ બીજ સમયમાં સુદ્ધાનો ઉલ્લેખ આપના ચ્યાનમાં આવો તો હોય ને ?

૪. નવકારવાળીના ભષુકાનો ઉપરોક્તસાચણુભાં જે ઉલ્લેખ છે તે તો હેખાડવો હતો ને ?

૫. સુખવિદ્ધિ કાન પર ચઢાવેલી હોય કે ન જ હોય છતાં ક્રિયા શું વર્ણન નથી કરતા ?

૬. સંમેલનમાં સકળ સંધની સમક્ષ નગરશેડે શું ઉચ્ચારિષ્ટ હતું તે વ્યાન આપી નિહાળો :

જથ્યાંથું હતું કે તેમના ( વ્યાખ્યાનમાં મુહૂરતિ બાંધવાવાળાના ) કહે-  
વાથી મુહૂરતિ બંધનની ચર્ચા નહી કરવા હું વિનંતિ કરું છું.

તા. ક. વ્યાખ્યાનમાં લીધેલા એ ડાનમાં મુહૂરતિ ભરાવીને  
અને તે નાક ઉપર રહે તેવી રીતે મુહૂરતિ રાખી વ્યાખ્યાન વાંચ-  
વાનું વિધાન છે એવો સ્પષ્ટ પાડ બાંધવાવાળા તરફથી જ્યાં સુધી  
નહી આપવામાં આવે લાં સુધી આ પત્રને પિણેખણું નેતું સમા-  
દોચન કરવું હીક લાગતું નથી.

### જવાબ

સિદ્ધચક્ર પાક્ષિક વર્ષ ઉજ્જું, અંક ઈથામાં આવેલ સમા-  
દોચનાને વિજ્યહૃદ્દ્યસૂરીકૃતરણ મહારાજ તરફથી ખુલાસા.

પાક્ષિકના કેખક લખે છે કે—“ વિધિગૃહીતયા ” પદ્ધતિ  
બાંધવાનો અર્થ કરનારે સત્ય સમજવાની જરૂર છે. શું એ પદ ન  
હોય ત્યાં વસતી પ્રમાર્જનાદિમાં બાંધવાનો અર્થ નહી કરવો ? ”  
આના જવાખમાં જથ્યાવવાનું કે “ વિધિગૃહીતયા ” એ પદ્ધતિ  
વાંચનારને અંગે મુહૂરતિ હાથમાં રાખવાનો અર્થ કાણું કરનારે  
સત્ય સમજવાની જરૂર છે. વળી એ પદ ન હોય ત્યાં બાંધવાનો  
અર્થ ન કરવો એવું કોણે કહું છે ? તેમજ વસતી પ્રમાર્જનની

વિનંતિને સૂચના કરું છું કે—“આ સમેલનના કાર્યમાં ગંગા સમા-  
ચારી અને મુહૂરતિના વિષયો વિષે ચર્ચા થશે નહી એમ હું જસ્તારે સર્વ  
ગાઢ્યાના મુનિગોને આમંત્રણું આપવા મળયો હતો. ત્યારે રહે ( વાતાવરણની  
શાન્તિ માટે ) કુલૂલ કુલૂં છે તેથી સમેલનમાં આ વિષયોની ચર્ચા ન  
થાય તેમ કરવા મારી વિનંતિ છે. ”

ઉપર પ્રમાણે નગરશોહદું વર્ષાન છે જયારે સિદ્ધચક્રકાર અસત્ય વાતના  
ગાઢ્યાના ફેંકતાં, ખોલના ઉપર નાંખતાં કાઈ ડર ખાય છે ! અસત્ય વાતની  
કુંભેશ તે તો સિદ્ધચક્ર પત્રકારની કરજ.

વ્યાખ્યાન વિધાનના સ્પષ્ટ પાડો ચર્ચા-સારમાં આપી લીધેલા છે  
તે જ પર આપની શુદ્ધિને અચળા રહ્યે હોરી અર્થ ન સમજાય લાં સુધી  
આપના જ તરફથી પિણેખણુંની વાતો પેપરમાં આવતાં જવાય તો  
આપાય ને ?

અંદર પણ કુકટીના બંધનો નિષેધ ડાખ્લે કર્યો છે કે જેથી તમારે  
વારંવાર તે વાતતું પુનરાવર્તન કરવું પડે છે.

ચચ્ચી—સારમાં મુહુપત્તિ બંધનો એક પણ પાડ નથી એસ  
લખો છે, પરન્તુ ચચ્ચીસારમાં તો વ્યાખ્યાનના પ્રસંગનું આપું  
પ્રકરણ છે (૫૦ રૂપના), અને તેમાં બંધન વિષયકાના વિધિપ્રભા  
આહિ ધર્યા શાસ્ત્રોના પાડો રૂપજીવનું આપેલા છે. તે જાણવા છતાં  
નકાર બણ્ણો છા એ મૃપા છે.

વળી પાક્ષિકના બેખાલ લખે છે કે “ચચ્ચીસારના હેઠાંએ તો  
કલ્પિત જ છે ને ?” પરંતુ આ પ્રશ્ન જ અસ્થાને છે; કેમકે તે હેઠાંએ  
એમાં મુહુપત્તિ નાકથી નીચે હોઢ પર રખાયેલ છે. તેતું કારણ એ  
છે કે તેમ કરવાથી મુખનો સંપૂર્ણ આકાર નોંધ શકાય. એ હેઠાંએ  
પરથી બંધન જોડું છે અને હેઠા કલ્પિત છે એમ કહેવું એ ‘ઉતા-  
વળીએ અભિપ્રાય’ છે. કેમકે વર્ત્તમાનમાં આધનારાએના હેઠા પણ  
આધ્યા વિનાના જ પડેલા છે. એથી તેઓ આધનારા નથી એમ  
સિદ્ધ થઈ શકતું નથી. વળી માચીન યારસાની પ્રતોમાં તેવા બાંધ  
વાવાળા હેઠા છે તેમ અમારા સાંભળવામાં આવેલ છે. પ્રસંગ  
આવે પ્રયત્ન કરીને તેવા હેઠાએ રજૂ કરાશ. આપનું વાંચન જ્ઞાનું  
છે તેમ આપે ધર્યા દેરાસર આહિના ચિંતા જોગેલાં હશે, કારણ કે  
આપનો વિહાર ધર્યો થયો છે એટથે તેની જાતના બંધનવાળા  
હેઠાએ આપના જોગમાં નહી આવ્યા એમ પ્રતિજ્ઞાપૂર્વક તમે  
પણ કણી શકો તેમ સંભવતું નથી. કહેવાનો ભાવાર્થ એ જ છે  
કે ચચ્ચી—સારમાંહેના હેઠાથી બંધન જોડું છે, અને હેઠાએ કલ્પિત  
છે, એમ સિદ્ધ થઈ શકે તેમ નથી.

વળી પૂર્વે ધર્યી વખત જે વિષે પ્રત્યુત્તર અપાઈ ગયેલ છે તે  
વિષે જ દરી લખો છો કે—“આચીન કાળમાં તાડપત્રની પ્રતો હતી.”  
તેના જવાબમાં જણાવવાતું કે—અનુચોગદાર ચૂણ્ણું તથા ટીકાચાં  
રૂપજીવનું વચ્ચે ઉપર લખાયેલાંને પણ પુરતક કહેલ છે અને પાટથીના  
આચીન અન્યથાંડારોમાં તેવા પુરતક હાલ પણ મોજુદ છે. તાડપત્રને  
પાડ લઈને તેની નીચે જ વખતનો સ્થાન પાડ છે. તેને છાડી હેલો તેમાં

સત્યમિથતા સમાયેલી નથી. તેમજ તાડપત્રની સાચે રહેલ આહિ શંકાથી બેવાતા કાગળ, જોઝપત્ર વિગેરે અર્થને છોડી દઈને તાડપત્ર પરજ જ્ઞાન લખાયેલ છે એગા કહેલું એ પણ ચોગય નથી. વળી શાખામાં જણ્ણાવેલા પુસ્તકાના બેહો ગંડી, કર્ણપી, મુષ્ટિ વિગેરે ધણી વખત અમે જણ્ણાની ગયા છીએ, તે જણ્ણવા છતાં એની એ વાત-લાંબા તાડપત્ર પર લખાયેલ છે તેવા આખાડ કરવો અને પુસ્તકના બેહોનો જ્યાદા ન કરવો તે ધર્થિત નથી. તાડપત્રની લાંખી જ પ્રતો હતી તેમ વારંવાર કહેલું એ એક પ્રકારનો આખાડ નહી તો બીજું શું છે?

આગળ ચાલતાં પાકિઝિકાના લેખક લખે છે કે—“મુખ્યમંદિરી પત્ર લખાવીને બાંધવાવાળાએ જ કરી ચર્ચા શરૂ કરી છે.” આ શંકાની સત્યથી તહેન વેગળા છે. અર્થાત કે અમારા તરફથી તેવા પ્રકારનો કોઈ પણ પત્ર લખાયેલ જ નથી. ને લખાયેલ હોય તો નામ-ઠામ સાચે તે કાગળને પ્રસિદ્ધ કરો. અમે તે વાતનો સાંક ધન્કાર કરીએ છીએ, કારણું કે તેવા પત્ર અમે લખ્યો. નથી તેમજ કોઈને લખવા માટે પ્રેરણું કરી નથી, એટલે તે આશ્કેપ તહેન ખોટો છે. તેને બદલે સિદ્ધયક્ષણાં તંત્રી પર તમે પત્ર લખેલ. તેમાં તંત્રીને અમને સુચવવા જણ્ણાવેલ કે-પાકિઝિકાં મુહૂરપત્ર વિષે અમારે નોંધ કેવી પડશે માટે તે વિષે ખોટું ન લગાડશો. આના પ્રત્યુત્તરમાં અમે કહેલ કે-શાખીય બાધતમાં ખોટું લગાડવાનું અમને કશ્યું પ્રયોજન નથી. આકી કંઈ છૃપાશો તો અમારા તરફથી ચોગય જવાબ આપાશો. આ ઉપરથી રૂપી જોઈ થકાય છે કે-ચર્ચા કોણે શરૂ કરી છે અને સરમેલનના હરાનને કોણે તોઓ છે? અમારા પર કાગળ ડેાત તો તેનો જવાબ અમે આપત, પરંતુ તેને બદલે તે પ્રશ્નને પેપરમાં છણ્યો એટલે અમારે પણ જહેર પેપરમાં જવાબ આપવાનો રહ્યો. સત્યગ્રિમ જનતા આમાંથી સત્ય તારવી શકે છે. વળી આપ લખો છો કે—“વિધાનની ચર્ચામાં પુરુષ પ્રવાતિને જોડવાની એ નખળાઈ છે.” આના જવાયામાં જણ્ણાવવાનું કે-અમારા પર નખળાઈનું આરોપણ કરનાર પાસે ધણી વખત હાથમાં મુહૂરપત્ર રાખીને વ્યાખ્યાન વાંચવાની વિધિનું વિધાન કરનાર શાખાપાડો માગ્યા છતાં મળતાં

નર્મિ અને તેને સ્થાને અસંગત દ્વારો કરાય છે તે નથળાઈ નહીં  
તે હું છે ? અમે તો વિધિપ્રપા, ચૈત્યવંહન મહાભાષ્ય વિગેરેના  
બાંધવાતું વિધાન કરનારા પાડો આપેલા પણ છે. વળી દ્વિવાલી પર્વ  
દેશક ફરે તે જ હિસે આપણે પણ કરીએ છીએ, એ તો કક્ષા શીમાનું  
ખીરસ્તરીશ્વરજ મહારાજનાં વચ્ચેનાથી કરીએ છીએ, તો પછી તે જ  
મહ્યાપુરુષે મુહૂરતિ અંધન કરેલ છે તેને આપણે સ્વીકારણું લેધુંએ.  
તેને બહલે તેનું ખંડન કરવામાં આત્માનું એથ નથી. તેમના વચ્ચને જે  
આપણે અનુસરીએ છીએ તો પછી તેમની કરણી તો વિશેષ આચ-  
સથીય હોય તે રવાભાવિક જ છે, એટલે તેમની કરણીનું ખંડન  
કરણું તે તેમની અવજ્ઞા કરવા સમાન છે, તેમ આપણા સર્વના  
પૂર્વલેની પ્રવૃત્તિનું ખંડન કરવા સમાન છે. આગળ ચાલતાં તે સમા-  
દ્ધેચનામાં બેખુલ લખે છે કે—“શૈષ વખત વાચનાદિકમાં જેમ ઉપયોગ  
રાખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રાખી શકાય. (પ્રસંગે પુરુષક  
સાપડા ઉપર પણ રાખી શકાય છે.)” આના જવાબમાં લખવાનું  
કે—વ્યાખ્યાન આદિ પ્રચંગમાં જે બીજા પ્રસંગની માફક ઉપયોગ  
રાખી શકતો હોત તો મહાપુરુષોની બાંધવાની પ્રવૃત્તિ ન હોત તેમજ  
તેવા અંધના શાખામાં વિધાન પણ ન કરત; બાકી વ્યાખ્યાનમાં  
સાપડા ઉપર કલ્પસૂત્ર આદિ શાસ્ત્રોના પાનાએઓ રાખીને વાંચનારા  
એવા કેટલા સાધુએઓ અનુભવમાં આવ્યા છે ? આ વિધાન તો જાતિને  
અંગે છે, વ્યક્તિને અંગે નથી.

નિનેશ્વર દ્વેદીની ચોગમુદ્રાથી વ્યાખ્યાનકારની ચોગમુદ્રા અલગ  
છે એમ લખેણ છે તો માંગવા છતા તેવા પ્રકારના પાઠ કેન આપતા  
નથી ? અને ‘ધરંતિ સુહપત્તિ’ એ પદ પરથી જ બેદ છે એમ કેમ  
સાંખત કરવા ચાહેણો છે ?

નવકારવાળો માટે ઉપદેશરસાયથુમાં પાઠ છે તથા સુહપત્તિ  
ખંડન પરંપરાસૂલક છે તેસ માનો તો ચર્ચી એકી થશે. એમ આપ  
લખેણ છે તો જણાવવાનું કે-નવકારવાળી માટે કચાંબ પણ વિધાન  
આવા પાઠ નથી જ એમ અમે નથી કહ્યું, પરંતુ તે વરસુ અતિ

પ્રચલિત હોઈને જણુા અન્ધોમાં તેનું વિધાન નહીંડોવાનું જણુાયું છે. આકી મુહુપત્તિ અંધન માટે તો અમે પૂર્વે લખી ગયા છીએ કે તે પ્રવૃત્તિ પરંપરાગત હોઈને જિનાસા સમાન છે. પાઠ તો વારંવાર તમે જ માંગો છો. જે પરંપરાને સ્વીકારી હોત તો ચર્ચાન જ લંબાત એ સત્ય છે, પરંતુ આ શફ્ટોથી એમ જણુાય છે કે તમે પણ પરંપરામૂલક પ્રવૃત્તિને સ્વીકારો છો. એ હર્ષની બીના છે, એટથે હવે પરંપરાગત પણ પ્રવૃત્તિનું મુહુપત્તિ અંધનનું ખાડન તો નહીં કરી શકો એમ અમે માનીએ છીએ. અને વળો આઠપદી મુહુપત્તિ અંધવાનું આવશ્યક બાળાવણોધનું વિધાન જણુાવીને તમે પણ શાખદિશે અંધવાનું સ્વીકારો છો. આકી વાત કરતાં વિતંડાવાદ વધે છે, એટથે ચર્ચા લંબાયા કરે છે.

એ સમાલોચનામાં છેવટે આપ લખો છો કે-સંમેલનમાં સકળ સંધ સમક્ષ શ્રીમાન નગરશેઠ જણુાયું હતું કે-“તેમના (વ્યાખ્યાનમાં મુહુપત્તિ અંધવાવાળાના) કહેવાથી મુહુપત્તિ અંધનની ચર્ચા નહિ કરવા હું વિનંતિ કરું છું.” આના જવાબમાં લખવાનું કે-આ શફ્ટો પણ સત્ય પરિસ્થિતિથી તફન વેગળા છે. તેને રહેજ વિસ્તારથી જોઈએ.

મુનિસંમેલન સમાજ થયા બાદ તેના દ્રાવ વિગેરેની પ્રસિદ્ધ માટે તે વિષેતું પુસ્તક મસિદ્ધ થયેલ છે. તેમાં નગરશેઠનું ભાષણું પણ છપાયેલ છે. તે પુસ્તકના છદ્રા પાના પર નગરશેઠનાં ભાષણ-માંથી નીચે પંક્તિઓ ઉત્તાવામાં આવે છે તે ઉપરથી જોઈ શકાય છે કે-પાક્ષિકના લેખક નગરશેઠના મુખમાં જે શફ્ટો મુક્કા છે તેનાથી આ ઉત્ત્યારાયેલા મૂળ શફ્ટોમાં કેટલો મહાન તકાવત છે ?

નગરશેઠના ભાષણના તે શફ્ટો જોઈએ.

“ વિનંતિને સૂચના કરું છું કે-આ સંમેલનના કાર્યમાં અચ્છ, સમાચારી અને મુહુપત્તિના વિષયો વિષે ચર્ચા થરો નહિ, એમ છું જાયારે સર્વ ગચ્છાના મુનિઓને આમંત્રણ આપવાને મળ્યો હતો ત્યારે અહે (વાતાવરણું શાન્ત માટે) કાખલ કર્યું છે, તેથી સંમેલનમાં આ વિષયોની ચર્ચા ન થાય તેમ કરવા મારી વિનંતિ છે.”

આ ઉપરથી રૂપદ્ધ જાણી શકાય છે કે-નગરશેઠના પોતાના જણહોથી તમારી વાત બેશ પણ રૂકી નથી, છતાં જો તમે તે જ વાતને પછી રાખવા આગતા હો તો રૂપદ્ધાણે જાણુંને કે-સંમેલનમાં મુહુરતિની ચચ્ચી નહી કાઢવા માટે અમારા સમુદ્દરના કયા ભાંડુંએ નગરશેઠને કંદેલ, તે વાત નગરશેઠ દ્વારા જ પ્રસિદ્ધ કરાવો કે જેથી જનતાને સત્ય વરસુસ્થિતિની ખમર પડે. જિલ્લાનું અમે તો નગરશેઠની સાથેની વાતમાં જાણુંને કે તેવા પ્રકારની ચચ્ચી માટે તૈયાર છીએ. વળા અત્યાર સુધીમાં તમારા તરફથી ને પાડો આપાયા છે તે સમૃપૂર્ણ નહી પણ ટૂંકી પંક્તિઓ જ હોય છે અને તેમાં વ્યાખ્યાનતું નામ પણ નથી હોતું. તથા હાથમાં રાખવાનો અર્થ પણ નથી નીકળી શકતો.

આપે હમણાના પાક્ષિકમાં જાણુંને કે-ચતુર્થીંની સંવત્સરી માવત તીર્થ સુધી રહેશે, તો આપે ચોતે સર્વ સંધ્યા અલગ પડીને ચેટલાદ આહિમાં નીજની સંવત્સરી કરેલ છે, એ ભૂલ તો ખરી ને? આશા છે કે આપ તે ભૂલને સરલતાથી રૂપારી બેશો.

ઉપરોક્તા સમાચોચનામાં કેટલાક પ્રશ્નોને અમારે છાડી દેવા પણા છે, કેમકે ધર્માદી દલીલોના જવાબ પ્રથમના કેષોમાં અપાઈ ગયેલા છે. કણ્ણવિધનો સંસ્કાર તો આદ્યાવરસ્થામાં જ થઈ જય છે. જુઓ આચારહિનકર આહિ શાસ્ત્રો, એનું સુનિના અંગે તેનું ઓઝું વિધાન હોવનો સંભવ છે, કારણું કે પ્રથમ તે દરેકને થયેલ હોય છે, કવચિત જ પ્રથમ ન જવાનાં કારણે કરવાનો પ્રસંગ સંબંધે છે.

તેમજ કેટલીક બાબતો અર્થશ્લ્ય, અરૂપદ્ધ અને પિષ્ટપેણપણ વળા જાણુંનાથી તેના જવાયમાં પુનરુક્તિ દોષને નહી નહોરતાં તે વાતને જવા દેવી ધૃત સમજીએ છીએ. અરતુ.

**કૈનાચાર્ય વિજયહર્ષસ્તૂરીશ્વરાજ મહારાજ**  
ડ. ગાડીજ ઉપાશ્રય, પાયધુની, સુંબદ.



### પ્રશ્ન—સિદ્ધચક્ર.

ઇતીય વર્ષ, અંક ૫ મેં. તા. ૨૦-૧૨-૩૪ ગુરુવાર.

૧. ૧૦યાખ્યાન વખતે મુહૂરતિ બાંધવી તે તે માટે કાન વીધવાનું વિધાન કરનાર એક પણું પાડ આપો.

૨. રજિનેશ્વર મહારાજ અને અન્ય વ્યાખ્યાનકારોની મુદ્રાની બેદ ખૂદ ચૈયવંદ્ન ભાષ્પકારે ઘરન્તિ સુહપોત્તિયે નવરં એમ ડાઢીને સ્પષ્ટ જણાવ્યો છે.

૩. ૩પુરતક વગર અગર પુરતક સાપડા હિપર રાખી વાંચે તો યોગમુદ્રા અને નાના પુરતકને એક હાથમાં રાખી પ્રવચનમુદ્રા ભાને તો મુહૂરતિ હાથમાં રહી શકે છે.

૪. ૪૦યાખ્યાન સિવાયના સ્વાધ્યાયાદિમાં જળવાશે ને સ્વાવચ વચન નહિ થાય તો વ્યાખ્યાનમાં પણ તેમ ડેમ નહી થાય ?

૫. ૫આવકને તેની રીતિએ પુરતકની કે તેમાંની સ્થાપનાની

૧. કાન વીધવાને પાડ આચારદિનકર દરમા ઉદ્ય કા. ૧ લાનું પાનું ૧૭, કર્વેષ સંસ્કાર વિધિમાં જ્ઞાત તસ્થી લેવી.

૨. ઘરન્તિ સુહપોત્તિયે નવરં આ પાડ પરથી રજિનેશ્વર મહારાજ અને અન્ય વ્યાખ્યાનકારોની યોગમુદ્રાનો બેદ દેખાતો નથી. વારતે રાત્રેના આખા પાડો લખો, નહી તો હુભવા તૈયાર થયો ને ?

૩. આપના પૂર્વના આચાર્યો ( હીરવિજયસ્થરીશ્વરજ મહારાજ, કિયોઝ્ડરક પંચસળ સત્યવિજયજ મહારાજ વિગેર ) આપના કાખવા પ્રમાણે કરતા તો હશેને ? કે આપે નનો જ માર્ગ સ્વીકાર કરેલ હોય એમ મને લાગે છે. યોગમુદ્રા, પ્રવચનમુદ્રા વાપરવાની બુદ્ધિ અદ્વાકિક ને ?

૪. વ્યાખ્યાનકાર ને સમયે વ્યાખ્યાન કરવા પાટ હિપર યસે તે સમયનું ચિત્ર આપેણો એટલે માહિતી બધીએ આવી જશે. આવી તો હશે, પણ કણૂલ કરાય તો દોષના કાળીદાર બને ને ?

૫. આપ હમેરાં આવકનું અનુકરણ કરવા કાગચાળા અન્યા હશો ? પણ શાબ્દકાર તો સાધુનું અનુકરણ આવકે કરવાનું વિધાન પ્રતિપાદન નથી હું ?

આશાતના ટાળવા અંધકારું હોમ છતાં તમારે તેતું અતુકૃષ્ણ કરવું  
હોય તો અધી વખત પુરતક જાસતાં આંધવું.

૬. મસુડા માટે ઉપહોરસાબન દેખવો.

૭. એકિરણોનો રવભાવ પ્રસરવાનો છે ને તેથી કાન્તિનું કથન  
અનુભનને જણાવે છે. વર્ણનનો અધિકાર પણ નથી.

૮. રામાંધનાર ખ્યે મુંખધ્યી ચર્ચાપત્ર લખતીને ચર્ચીની  
જરૂરાત કરી છે. ——————

૧. ઉપચ કરતુની હૃપ્યમિ ગામાનું ચર્ચા-સરવાળું તાત્પર્ય  
ગાથાની ટીકાથી સંગત નથી એમ હવે તમે પણ માનો છો, તેમાં  
તેમાં આપેલ અધિક શબ્દ વક્તા અને શ્રોતાની સરખી અવસ્થા  
જણાવે છે તે તે વિચારો.

૨. ઐચ્ચરીં ન કરવાની તમારા પણે કખુલાત લીધી એ વાતતું  
મીઓડિક તત્ત્વ જ્ઞાન દર્શાવે, પણ ખુદ શેઠાનીનું ભાષણ વાંચવું. તે  
વખતે છાપું કાઢનારને મૂછો કે જેથી ખસ્યાનું માલામ પડે.

૩. પટરસ્થથી સાચો નિર્ણય મળે નહીં એમ તમો માનો

૧. કબિયો શરીરના આખા અવધોનું વર્ણન આનંદથી કરે છે  
તમાં દાંતનું વર્ણન પણ આવી જય ને ? કાન્તિનું વર્ણન અને બાળમાનાદિ  
સમયે મુખવિક્રિકા બંધનને કોઈપણ જતનો સંબંધ નથી તે જ્યાનમાં  
તો હશે ને ?

૨. નહીં બાંધનાર પણે પત્ર લખતી ચર્ચા જાણી કરી હેઠળ એમ  
તમેને શું નથી લાગતું ? બીજી જતાની મામામાં કદાચ આપ ઇસતા  
તો નથી તેને ?

૩. પંચ વરસ્થની હૃપ્યમિ ગાથાનો અર્થ પૂર્વે કર્યો તે જોણો ને ?  
પોતાની ખુલ્લને અગે શાસ્ત્રીના અર્થોને પણ તે રસ્તે હોરવા પ્રયત્ન  
કરાય તેનું શું ?

૪. ચર્ચા નહીં જ કરવાની આપના પણે કખુલાત લીધેલ છાં અન્ધને  
માંબે નાંખવા પ્રયત્ન કરાય તેનું શું ?

૫. તટરસ્થ જાનમાં આપ તો રહ્યા છો ને ? આપના પર ભાગ છોડાય  
તો આપ તૈથાર છો ને ?

છે તે હીં નથી. તમો મદ્યસ્થ યુદ્ધિત્રે જેઓને તરસ્થ તરીકે  
નિમો તે કણૂલ હતા તેથી તમને નીમવા લખ્યું હતું.

૪. ચોમાસાની દીક્ષાનો પુરાણ અને લાવિત આદ માટે  
નિષેધ નથી એ હડીકત વિરોષ ભાષ્ય ૧૦ ઉ.થી ૨૫૪ છે. અન્ય  
માટેના નિષેધમાં દર્શા વૃત્તિકાર મહારાજ પણ પ્રાય શાંદ લેખે છે.

૫. ૨૫૨૮૮૩પે કહેવું તે શાખાના અનર્થક પાડો આપવા એ  
કેમ શોબે ?

૬. આચરણાને આગમોકત કહેનારે સમજવું જરૂરી છે.

૭. તનિહેતુક તેમજ સાવદ્ર આચરણા માનવાની શાખકારો  
સ્થાને રથાને મનાઈ કરે છે.

૮. કાલિકાચાર્ય મહારાજે અંતરાચિ પાઠી આચરણા  
કરી છે તો તમારી આચરણામાં ડોઘ પાઠ કે ?

૯. ૫૫૮૮૮૩થું અપવાદના લેખો છે.

૧. ચોમાસાની દીક્ષા લાવિત કોણું ? દીક્ષા લેનાર આત્મા લાવિત  
તો હોય ને ? ભાવિક વગર દીક્ષા અપાય ને ? ધોરી માર્ગનું અવસ્થાન  
ખાનું પર રાખી આપની યુદ્ધિત્રા અધરને આગળ ધરનાર કરો તે જ  
વિચારણીય ? આપણે માનીએ તે ભાવિક ને ?

૨. ૨૫૨૮૮૩ના સંબંધ સાથે ચાસોના પાડોનો સંબંધ અસ્થિત-  
પણે રહેયો છે. અનર્થ કરનાર જ સંસારની કીરતા વગરના ને ?

૩. વ્યાખ્યાનાહિકમાં સુખવિદ્ધિ બાંધન સાવદ્ર અગર નિહેતુક છે તે ને ?  
એમ આપની માન્યતા હોય તો આપના વહીલો પણ સાવદ્રનું અગર  
નિહેતુક કિયાતું ચોષણ કરતા હશે એમ તો આપની માન્યતા નથી ને ?

૪. કાલિકાચાર્ય મહારાજ વ્યાખ્યાનાહિકમાં સુખવિદ્ધિકા બાંધતા  
હતા ને ? તેનો ૨૫૪ પાઠ મળવો નેથીએ. ન બાંધતા હોય તો પણ પાઠ  
તા છ ને ?

૫. અપવાદના લેખો આપની સમક્ષ ઘણાએ હશે પણ હિતસર્જના  
લેખો તા આપ રાખતા નહી હો !

૧૦. રોગખંડર ભાડારને વ્યાખ્યાન વાંચ્યાનો પુરાવો આપવો.

૧૧. રોગખંડાન વાંચવામાં સુહપત્તિ વીધેલા કાનમાં ભરાવવી એવો પુરાવો વિધાનવાળો આખ્યા પછી તેની પ્રમાણિકતા જોવાય.

૧૨. કાન ન વીંધ્યા હોય તો પણ વસતિ પ્રમાર્જતાં સુખ બાંધી શકાય છે એમ તમે માનો છો એટલે સાંધુ થતાં પડિલેલણું કરવા કાન વીધવા એવો પાડ તો તમારે આપવો.

૧૩. ઉથેડે અંતરે સુહપત્તિ રહેવાથી તે સુકાશે ને થતના પણ થશે. બાંધનારે સંમૂચ્યભી ઉત્પત્તિ ને હિંસામાં બચાવનો પાડ હોવો.

૧૪. ઐચોથનું કારણ અધિકતા છે ને તે ચાલુ છે તેમજ તેની પ્રષ્ટિનો નિશીથ આદિમાં રૂપી બેખ છે.

૧૫. પ્રાંખ્યાની વાત કરેનાર સર્વથા જૂડા છે. તમોએ તે માની તે પણ નવાધ છે.

૧. એપત્ર શાખદથી કાગળ જ કેવા એ જૂહુ હતું ને ? શાખાકારે તો તાડપત્રાદિ લીધાં જ છે.

૨. વિભાક સૂત્રના મૂલ પાડમાં મુગાપુત્રને દેખવા ગયા ત્યાં ગોતમ પ્રષ્ટાચે ચાર પડથી સુખ તા બાંધ્યું હતું ને ? શાથી ? કેવા હેતુચે ? તે વિચારતું. જે કારણ હતું તેના કરતાં આ કારણ અધિક તો નથી ને ? કાન વીંધ્યાબેદ્ધ હોય ને ?

૩. પ્રેમાણિકતા તો આપની હાલ જોવાધ રહેલી લાગે છે. પ્રેમાણિકતા વગર પૂવોચાર્યેની સહેતુ તથા અનવદ્ય પ્રેણાલિકાનો ધ્યાસ આપના જાણાણુંથી આપ શું નથી કરી શકતા ? એ જ પ્રેમાણિકતા.

૪. અમારી સુહપત્તિ થાડે અંતરેજ રહે છે. હાથમાં રહેલી સુહપત્તિ હાથના તેમજ મોંના નીઠલેલા ચુંકથી લીની પણ અને તે આપ પ્રત્યક્ષ નહીં નેતા હો. ચારોર પર રહેલા લીના કપડામાં સંમૂચ્યામ જીવોની ઉત્પત્તિ તો નહીં થાય ને ?

૫. કેમ ચોથનું કારણ અધિકતા આપ માનો છો તેમ સુહપત્તિકાની અધિકતા આપને શું નથી લાગતી ?

૬. આપે બાંધી, સાંભળનારે દેખા તો હોય ને ? તે પણ તેવા.

૭. તાડપત્રને સુખ્ય ગણું વચ્ચાહિનો પાડ એક જાણું મૂર્ખી અર્થ કરે તે જૂહું ને ? શાખાકારે તાડપત્રાની સાથે વચ્ચ, કાગળ નિગેરે પણ લાગેલ છે.

૨. નણું કાણુંથી પ્રતનું લાંબાપણું ને તેથી મુહુપતિનો હેતુ ગણ્યામ.

૩. વખતમાં લખેલ પત્રક કહેનારે અતુંનો દનદ બોવો.

૪. ધ. સ. પૂર્વે પાંચમીનો બેખ આપવો.

૫. રેઝરોડવિ માં બાંધવાનો અર્થ ડિપિત છે એમ આન્યું તે ટીક છે. વિધિગૃહિતશાઠી બાંધવાનો અર્થ કહેનારે શું કહેણું?

૬. ઉપધિમાં અશક્તિ કારણ ગણ્યાય, અંદો તો દરેક આટે પ્રાયશ્રિત છે.

૭. હાથથી યોગમુદ્રા છે તો તેમાં આપેલ મુહુપતિ ધારણનો અપવાહ મુખ્યને નહિ વળો.

૮. ઉપમુખ્યને સ્થાને ઉપમુખ્યકર્ણનો પાઠ લાવવો.

૯. ડિઅાડ પડ મુહુપતિના હોય એ વાતને બાંધવામાં સમજન-  
ારે વાંચતાં ધ્યાન આપવું.

૧૦. તે દેશનાના અધિકારે છે, જુઓ શુશ્રાવ દેશનાં

૧૧. વિધિપ્રધા નથો એમ નહી પણ જિનભદ્ર અને  
શીકાંકાચાર્યની વિધિપ્રધા બતાવવી.

૧. વખતમાં પુસ્તકો લખાયેલાં દેખાય છે, નેતી દિષ્ટમાં ન આવે તેનું  
કેમ?

૨. ચર્ચા-સારતમાં ઇયરોડવિ ગાથાને અર્થ સત્ય જ લખેલ છે, પણ  
નેતી તેમાં ચોતાના ભતિ ન ચાલે તેનું કેમ?

૩. આપના હાથમાં રહેલી મુહુપતિ કેટલા પડની છે? તે તપાસાચ  
તો જ સત્ય વરસુ હાથમાં આવે. ચતુર્દિનચર્ચા-સાવસ્ત્રીમાં મુહુપતિનું  
પ્રમાણું ચતુરમુલં વિહસ્તી રાય... વીયં મુહુપતિના આ એ પ્રમાણ વિચા-  
રાય તો બધુંએ સમજય. મુહુપતિ રાખવાનું પ્રયોજન શું?

૪. તમે જ્યારે બંધનના સન્મુખના કાગમાં આવરો, હુદયની સરણતા-  
અમારા જાણવામાં આવરો ત્યારે જ વિધિપ્રધા અથે બતાવવામાં આવરો.  
અન્ય કૃપા રાખવા તે અમારો આચાર નથી, પાઠોને બોળવવાનું તે અમારો  
ધર્મ નથી, સત્ય વરસુની ગવેમણ્ણા તે જ આચાર.

૧૨. શ્રી ઉત્તરાધ્યયન, પંચવરતુ, એધનિર્દૂક્તિ આદિમાં પડિ લેખણું વિધિ છે. ત્યાં ઉપથિ પડિબેદણું કરતાં અધન છે.

૧૩. જીવન્યો ન વાંચે ને સ્નાતક્યા ન કરે તેમાં છતરતુ જેર નહીં.

૧૪. પાંચમ કરનાર નિશીથ ચૂંઝિને માને છે ને તેમાં એકજ તિથિ કહી છે.

૧૫. ૨“ મુહુપત્તિના વિષયો વિષે થચી થશે નહીં એમ હું જ્યારે સર્વ ગરછેના સુનિશ્ચેને આમંત્રણ આપવાને ભલ્યો હતો ત્યારે મેં (વાતાવરણું શાન્તિ માટે) કણૂલ કર્યું છે.” એ વાક્ય વિચારણા તો કણુલાત ડાણે લીધી તે જણ્ણાશે.

## જવાય

### સિદ્ધયઙ્ક, તૃતીય વર્ષ, એંક ૫ મો.

આપના તરફથી વારંવાર કણૂલ્યેખ સંખ્યમાં કહેવામાં આવેલ છે. તે વિષે જણ્ણાવાતું કે જુઓ, આચારહિનકર, દ્શમો સંસ્કાર, પૃષ્ઠ ૧૭ મું. બાલકોને નીળ, પાંચમા અને સાતમા વર્ષે કણૂલ્યેખ સંસ્કાર કરવાતું જણ્ણાયું છે. તેમ જ હિન્દુ સંસ્કાર અન્યોમાં પણ કણૂલ્યેખ નામનો દ્શમો સંસ્કાર છે, એટલે આ ઉપરથી એમ સિદ્ધ થામ છે કે જેન તેમ જ હિન્દુ શાઓ સુજય ગૃહરથપણું જ યાને બાબ્યા-

૧. અન્ય ન બાંધે તેમાં અન્યનું જેર નહીં. વાતને સ્વીકારે નહીં તેમાં પણ અન્યનું જેર નહીં.

૨. આપની પાસે વિનંતિ કરવા નગરશોઠ આવેલ. ઉપરની વાત કરેલ હશે તો તે કણુલાત આપે લીધીલી હશે, એટલે આપ તે વાક્યને ન સમજના. એટલે ધીન ઉપર તે વાક્યને કાઢવા તૈયાર બનના છો. કણુલાત કેનાર નગરશોઠ અને આપનાર આપ. આંદો જ અર્થ આપ સ્વીકારી ફળયમાં રાખી આત્મા સાથે ખુલાસા તો કરોડા ને ?

વરથામાં જ છુંબેધ સંસ્કાર થવો જોઈએ એટલે દીક્ષા લીધા પણી તે વાત દરી કરવાની જરૂર રહેતી જ નથી; કેમકે ગુહસ્થપણુંમાં તે સંસ્કાર પ્રાયે થધ ગયા હોય છે. શાસ્કાર મહિંદ્રાએ તેને ઉત્સર્ગ માર્ગ કહેલ હોઢ તેવા ઉત્સર્ગને અપવાદૃપે કરવાથી વિરાધક થવાય છે. તેમજ અપવાદને ઉત્સર્ગરૂપે કરવાથી આરાધ-કમાં વિરાધકપણુંની ભજના છે એમ પંચકદ્વિંદ્રિયમાં કહેલ છે.

ઉસ્સગો અષ્વદાયં આચરમાણો વિરાહ ભળિઓ ।

અષ્વદારા પુણપત્તે ઉસ્સગ નિસેબણે ભયણા ॥૧॥

**અર્થાત્**—ઉત્સર્ગમાં અપવાદતું આચરણ કરતા તેને વિરાધક કહ્યો છે અને અપવાદને પ્રસંગે ઉત્સર્ગતું સેચન કરે તે વિરાધકપણુંની ભજના જાણુંના. ચોમારી દીક્ષા એ વિશેષ પુરુષને અંગે છે અને અપવાદૃપ જ છે, તેમ છતાં આપ તો તે વાતને ઉત્સર્ગરૂપે કરવા માગો છો. એમાં ૨૫૪૮૫થી વિરાધકતા જ સમાચેરણી છે. અપિ શષ્ઠિનો અર્થ શુસ્તની માદ્દા જીબા રહીને સાંભળવાની સમાનતાનો સૂચ્યક છે એ વાત પૂર્વી ધખી વાર કહેવાધ ગધ છે.

આધ્યકારની ગાથાથી “ધરંતિ સુહપત્તિયં નવરં” એ પદ્ધતિ થાગમુદ્રાનો બેદ કોઈ રીતે સિદ્ધ થધ શકતો નથી.

મુહુરતિ બાંધિને બ્યાઘ્યાન કરવું એ સાવદ્ર આચરણુા નથી, પરંતુ નિર્વિદ્ધ આચરણુા છે, એ તો નિઃથંક છે. સાવદ્ર આચરણુા હોત તો પૂર્વ મહાપુરુષો તે આચરણને સ્વીકારત જ નથી. તેમ હાથમાં રાખીને વાંચનારનો ઉપયોગ પ્રાયે અરોઅર રહેતો નથી, એ સૌના અતુભુની વાત છે, એટલે ઉપયોગશન્ય વાચન એ સાવદ્ર વચન કહેવાય. એ બાખત અગનતી સ્ક્રતના પાઠ્યી સિદ્ધ છે. વળા તેમાં સંમૂચ્યિત જીવોની ઉત્પત્તિનો સંભવ નથી, કેમકે નાક ઉપર રહેતી હોણાથી કદાય થૂંક લાગ્યું હોય તો નાકમાંથી નીકળતા પવનથી સુકાધ જય છે, એટલે ભીની થવાનો સંભવ નથી. બાકી હાથમાં રાખનારને પણ જેઓને થૂંક ઉડતું હશે તેમની તો ભીની થશે જ. અને તેથી સંમૂચ્યિત જીવો ઉત્પત્ત થવાના જ. તેને નીવારવા

જિધાડે સુખે બોલવાનો પ્રસંગ ડુપરિથિત થશે, અને એથી જિધાડે સુખે બોક્ષાચેલું વચન ભગવતીણા કથન સુજાપ સાવદ્રા વચન અનશે. આ ભર્ત્વ દૈક્ષણે ટાળવા માટે વ્યાખ્યાનસમ્બે સુહપતિ બાંધવી તે જ ચોણ્ય છે. વળી પહેરવાનાં કૃપણાં તો પ્રસ્વેદથી, સુહપતિ કરતાં પણ વધારે ભીનાં ચાય છે, તો હિગંબરપણું સ્વીકારવાનો સમય આવશે માટે ભીતી ચવાની દ્વીપ ડેવલ અસ્થાને છે. પૂર્વે આપે પોતે સુહપતિ બાંધવીને વ્યાખ્યાન વાંચેલ છે, એમ આપના કેટલાક પરિથિત ભાષણેનું કહેલું છે, નેચો સુંભદ્ર અને અમદાવાદમાં મોણુદ છે એ પ્રસંગે રખ્યું થઈ શકશે.

પંચવસ્તુનો દ્વારા ભી ગાથાનો હાથમાં રાખીને વાંચવાનો આપે કદેશો અર્થ જોડો તો ખરો ને ? કેચકે તે ગાથા સાંભળતારને અંગે છે.

‘તાડપત્ર ઉપર જ લખાયાની સુઘ્યતા કહેનારે તેની સાચેનો જ વચ્ચે પર લખાયાનો પાઠ છોડી હોયો છે, તેમજ તેની સાચે આદિ શબ્દથી બેવાતા કાગળ, બોજપત્ર ધર્ત્યાદિ અશોને પણ જતા કર્યો છે’ એ જેરંધ્યાજથી તો ખરું જ ને ?

વિજય વીરસ્ફુરિણા ભાંડારની અને આગે શોધીને છપાવેલી નંદીસુત્રની પ્રતોને જેળવી જોતાં આપના તરફથી પ્રસિદ્ધ થયેલ પ્રતમાં ધણ્યી ગાથાઓં નથી. એ પરથી લાગે છે કે પાઠ છોડી દેવાની આપની રીત પ્રાચીન છે.

સિદ્ધચ્યક્તના ગતાંકમાં આપ લખો છો કે “આચરણુને આગમોક્તા કહેનારે સમજવું જરૂરી છે.” આના જવાબમાં જાણું વવાતું કે સુત્ર શબ્દનો અર્થ અને આચરણુનું પ્રમાણિકપણું—

સૂત્રણમેત્તં સુત્તં આયરણાઓ ય ગમમદ તયસ્થો ।

સીસાયરિય કમેણ હી નજીંતે સાસ્પસતથાં ॥૧૮॥

બહુસુધકમાળુપસા આયરણ ધરદ સુત્ર વિરહે વિ ॥

શ્રીજાનારો વિ પદ્ધતે નજીદ વીંદુ સુવીઢીહિ ॥૧૯॥

ચैत्यवंदन મહાભાગ્ય—અથીત કે સૂચન ભાગ કરે તે સૂત્ર કહેવાય છે પરંતુ તે સૂત્રનો વાસ્તવિક અર્થ તો આચરણાથી જ જાણી શકાય છે. શિષ્ય અને આચાર્યના કબુવડે શિદ્ધપણાણો જાણ્યાય છે. સૂત્રના અભાવે અહૃતુતના કંભથી ચાલી આવેલી આચરણ માન્ય કરાય છે. નેમ દીપક ઓલસવાઈ ગયેલો હોય તો પણ સારી દાષ્ટિવાળા માણ્યસે જોએલી વરતુને જાણી શકાય છે.

આચરણ એ સૂત્ર તુલ્ય છે:—

તમ્હા અનાયમૂલા હોંસારહિયા સુહક્ષણ જણણીય,  
સુરિપરંપરપત્તા સુતદ્વા પમાળમાયરળા ॥ ૨૫ ॥

ચैત्यવંદન મહાભાગ્ય—અથીત તે જ કારણ માટે આ પ્રવૃત્તિ હાણી ચલાવી છે તેના મૂલ પુરુષની ખખર ન હોય અને હિંસારહિત શુભ ખ્યાનને ઉત્પન્ન કરવાળા આચાર્યોની પરંપરાથી ચાલી આવેલી આચરણ સૂત્રની માદ્ક જ પ્રમાણજૂત જ છે.

ચैત्यવંદન મહાભાગ્યની આ ગાથાઓથી ૨૫૪૪થી જાણી શકાય છે કે સૂત્રમાં કાંઈ પણ વરતુ વિસ્તારપૂર્વક કહેલી નથી. તેમાં તો સૂચન ભાગ છે. વિશેષ ને કાંઈ જાણી શકાય છે તે તો પૂર્વ મહાપુરુષોની આચારણુદારા જ જાણી શકાય છે. એમાં કેશ ભાગ પણ શંકને રથાન નથી. સૂત્રના ઉપર ભાષ્ય, ચૂંણી આદ્વિલભાયા તે પણ આચરણાથી જ લભાયાં છે. સૂત્ર તો દશ પૂર્વધરતા લખેલાં જ માન્ય છે, તેથી એછું જ્ઞાન પ્રરાવનારે આચરણ આદ્વિ જોડને તેના પર ભાષ્યાદિ રચેલ છે. એટદે નિર્વેદ્ધ એવી પૂર્ણ પ્રવૃત્તિને નહિ માનતા તેનું ખંડન કર્યું એ સુધે જનોનું કર્તાંય નથી જ. ‘સંસારશુદ્ધિનો ભય નેઓને ન હોય તેવી જ વ્યક્તિ આવી સત્ય સનાતન અને આચારણુસિદ્ધ વરતુનો વિરોધ કરે.’ બાકી નેઓને સંસાર પર વાસ્તવિક નિર્વેદ્ધ ઉત્પન્ન થયો તે પુરુષ કહામહથી મસિત અની સત્ય પ્રવૃત્તિનો વિરોધ કરી પોતે વિરોધક બને જ નહીં.

કાંઈ વરતુની કારણવણાત્ આચરણ ન થાય કે અલગ વાત

એ પરંતુ તેથી વસ્તુસ્વરૂપને ખોટું પાડવા પ્રયાસ કરવો તે બોધ નથી. ચૈત્યવંદન ભહાભાઈની ઉપરોક્ત આથાયોથી આચરણું એ પ્રમાણશુલ્ક છે એ આપણે જોઈ ગયા, તેમ છતાં આચરણું એ સૂત્રાગ્રા સમાન જ છે અથવા ગણ્યખર વચ્ચનતુભૂ છે, એ આપણે પ્રવચનસારોકારના પાઠી પણ જોઈએ.

**ગीતાર્થાવરણ તુ મૂલગણધરમળિતમિષ ।**

**સર્વ વિધેયમેવ સર્વૈરપિ સુમુદ્રભિરિતિ ॥**

પ્રવચન સારોકાર, પત્ર ૧૦૬, પૃષ્ઠ ૧૯૪

અથોત કે ગીતાર્થ પુરુષની આચરણું મૂલ ગણ્યખરના કરેલા વચ્ચનની ભહાઇ જ સર્વે મોક્ષની ધ્યાનાવાળાઓએ સર્વ કરવા બાયદ જ છે. આચરણું વિષેના આવા રૂપણ પાડો પછી કોઈ પણ પણ સરલ પુરુષ પૂર્વ ભહાપુરુષોની નિર્વાચ પ્રવૃત્તિને વિશે શંકા ઉઠાવે જ નહી તેમજ તેનું ખંડન પણ કરે. આક્ષી તે જેણે નથી જ સમજનું અને કદાઅહ ધારણ કરવો છે તેને ઉપકારીએ પણ સમજની શકતા નથી. કાણ્યિક નરેશને ‘તું ચક્વર્તિ નથી’ એમ કહેનાર અન્ય કોઈ નહી પણ ખૂદ બગવાનું ભહાવીર હેવ જ હતા. તે છતાં કદાઅહથી અસિત બનેલ તે દુર્મીતિ રાજ પ્રકૃતિની તે વાતને નહી સહૃદાતો થકો કુલપનાથી ૧૪ રત્નો ઉપજાની લડવા ચાન્યો. અને પ્રાણ ચુમાવી નરકગામી થયો. આમ ન સમજનારને કાણ્ય સમજની શકે? નહીતર આચરણું એ પ્રથમ ગણ્યખર ભહારાજના વચ્ચન તુદ્ય છે એમ જાણવા છતાં તેને નિર્ષેખ અને ખંડન કરાય અરા? અત્યારે ધાર્થિએ એવી બાયદે આપણે આચરી રહ્યા છીએ કે જે વિષે સિદ્ધાન્તમાં રૂપણ ઉત્ત્સેખ નથી જણાતો, તેમ છતાં પૂર્વની આચરણાથી તે પ્રવૃત્તિ ચાલુ રહેલી છે. જેમકે સિદ્ધાણ્ય ખુદ્દાણ્યની તણુ ગાથા બોલવા માટે વયહાર બાધ્યમાં પાડ છે, પરંતુ ચોથી, પાંચમી ગાથા કે જે હાલમાં બંને વખત પ્રતિક્રમણુમાં બોલાય છે તે તો માત્ર આચરણાથી જ બોલાય છે. આમ આચરણું એ દરેકને રવીકાર્ય જ હાવી જોઈએ. “આચરણાને આગમોકતા

કહેનારે સમજવું જરૂરી છે” આ ગ્રભાળે કહેનાર વ્યક્તિને અમે પૂછીએ છીએ કે “પૂર્વ મહાપુરુષોની પૂર્વધરોની આચરણાનું ખંડન કરતારે સમજવું જરૂરી છે.” આચરણાનું ખંડન કરતારે સમજવું જરૂરી છે કે આચરણ આગમેકૃત છે એ વાત પ્રવચનસારોકાર અને ચૈત્યવંદન મહાકાણયના કુપર આપેલ પાઠ્યી સિદ્ધ છે. સિદ્ધચક્ષના છેલ્લા અંકમાં અને તે પૂર્વના અંકમાં આપ લખો છો કે, “બાધનાર પણ સુઅધથી પત્ર લખાવીને ચર્ચા શરૂ કરાવી છે.” આ વિષે સ્પષ્ટ ખુલાસો અમે પૂર્વના સેખમાં કરી ગયા છીએ તેમ છતાં જણાવવાનું કે આ વાત ખોટી છે-પાયા વિનાની છે અને સમજને જાંધા પાટા બંધાવવા જેવી છે એટલે ને તે વાત સત્ય હોય તો તે પત્ર તથા લખનારના નામ-ઠામ સાથે પ્રસિદ્ધ કરો. બાધી એક વિદ્યાનાનું ચિરસ્થાયી વાક્ય છે ‘બોડા માણુસોને બોડા વખત સુધી અવળું સમજવી શકાય છે પણ સર્વ જ્ઞનેને કાંબા સમય સુધી અનાવી શકાતા નથી.’ એટલે સમજમાં આવી જિલ્લાઈ રીત આપતી હવે ચાલની અશક્ય છે. સિદ્ધચક્ષના અંકમાં લીધેલ સમાવોચનામાં ડેવળ પીષ્ટપેણથું હોંચ કેટલીક બાધતાને જતી કરી છે.

શાસનહેવ સફુને સન્મતિ આપો એવી શુલેચ્છા.



### પ્રશ્ન

સિદ્ધયંક, તૃતીય વર્ષ, અંક ૭ ચેા, તા. ૧૬-૧-૩૫

૧. શ્રી પંચવરસુની હૃદોડવિ ગાથાની ટીકામાં વિધિગુહીસયા પાડનો સાક્ષાત અર્થ સુધે સુહપતિ બાંધી નનિસુત્ર સાંભળું એવા નથી. માત્ર ચર્ચાસાર સુખખંધનની સિદ્ધિ માટે હોવાથી તેવા અર્થ કર્યો છે એમ તમારું કથન ખંધનમાં તેની નિરૂપયોગિતા રૂપ-કારાવે છે.

૨. તે ગાથાનો અધિક શબ્દ નનિસુત્રના વક્તાની ઓતા નેવી હ્યા જણ્યાવી વક્તાને પણ સુખખંધન ન હતું એમ રૂપી કરે છે તે વાત તમારે અસ્વીકાર્ય નથી,

૩. શ્રી શાલાંકાચાર્ય ને શ્રી જિનબદ્રાચાર્યનો વિધિપ્રથાનો પાડ તે અન્થની પ્રાપ્તિ વિનાનો છે. તિલકાચાર્યની સમાચારીમાં કાશમહાય વિધિમાં કાને સુહપતિ રાખવા જણ્યાવે છે, પણ વ્યાપ્તયાન કે બાંધનની વાત જ નથી.

૪. પોતાથ શબ્દનો પોત પર્યાય કરતાં પત્રક અને પોતાનો દનંદસમાસ ભૂલાઈ ગયો છે. પત્રક શબ્દથી કાગળ જ કેવામાં ભૂલ થઈ એમ હવે સમજાયું હશે.

૫. રમુખ આગળ સુહપતિ રાખવાની શ્રી આહીશ્ર ચરિત્ર

૧. શ્રી શાલાંકાચાર્ય ને શ્રી જિનબદ્રાચાર્યનો વિધિપ્રથા નામનો અન્થ આપના હરતકમાં ન આવ્યો. એટલે તે અન્થ જ નહી એમ કહેનારાએ. દોષિત કરે છે. એવા કેટલાચે અન્યો આપના હાથમાં નહી આવેલા હોય એમ આપને શું નથી લાગતું ?

૨. આહીશ્રચરિત્ર કે સુખમાલાનું નામ આપી આપની અભિલાઘાને પૂર્મ કરવા ચાહતા હો તે તે ગલત છે. નામ આપવાથી કાર્યસિદ્ધ નથી પણ સંખંધપૂર્વક પાડ આપવાથી કાર્યસિદ્ધ છે તે ધ્યાનમાં રાખશો. અસંખંધવાળા પાડાથી પણ કાર્યસિદ્ધનો અભાવ આપને શું નથી હેખાતો ?

અને પુષ્પમાલા વિગેરની વાત દેશના વખતની છે તેમ તો તે સ્થાન  
નેવાથી સમજ શકાશે.

૬. ચર્ચાસારમાં આપેલા હોટા મુખ સોંક હેઠાડવા માટે  
આથી મુહૂરતિવાળા કથી છે તે કથન તે હોટાએની ડિપિતતા  
જણુવવા બસ છે.

૭. એએક પણ પુરાવો હજ સુધી વ્યાખ્યાન વખતે મુખ  
બંધનનો ચર્ચા-સારથી કે આટલા કેઝાથી આપી શકાયે નથી  
માટે તેની જહેરત કરવી જરૂરી છે.

૧. આટલા કેઝામાં કટલાએ પુરાવાએ આપની આગળ મૂકેલા  
જ્ઞાન તે પુરાવાએ આપની બુદ્ધિમાં ન આવે તે હોથ કાનો ? બુદ્ધિનો  
કે આગુનો ?



## જવાય

સિદ્ધચક, અંક ઉમો, તા. ૧૬-૧-૩૫.

વ્યાખ્યાનાદિમાં મુખવિભિન્ન બાંધવાતું પ્રમાણું નીચેના પાઠોથી  
આપ સ્વીકારી બેશો.

૧. શ્રી હિરવિજયસૂરીશ્વરજી અહારાજ મુહૂરતિ બાંધતા હતા  
તેના પુરાવામાં હિરવિજયસૂરિરાસના નંબાવત્યા ગામના અધિકારમાં  
નીચેની કઠીએ ભજથૂલ ટેકાર્ય છે.

“ હબિબદો હરખ્યેં ભનમાણિ,  
દીસે અવલ ઇકરૈ;  
ગુણુ હેઠી શાહ અકબર,  
મને મેટા હિંદુ પારૈ।

॥.૨ ॥

હાનિથદો એક પ્રશ્ન પૂછતો,  
કપડાં કયું બંધેછ ?  
શુંક કિતાય ઉપર જઈ લાગે,  
તેણે બંધા હે એહી ॥૨॥

હાનિથદો દ્વિર એમ પૂછતો,  
શુંક પાક કે નાપાક ?  
હીર કહે “ મુખમાં તવ પાકી,  
નીકલે નામ નાપાકી.” ॥૩॥

ઉપરનાં વાક્યમાં વિજયહીરસ્કરીશ્વરજી મહારાજના સમયમાં હાનિથદાનો ઝૂદ હીરસ્કરીશ્વરજી મહારાજને પ્રશ્ન છે, પણ આજના વીસળી સહીના જમાનામાં નાના-મોટાં તાડપત્રોનાં પાનાના પ્રશ્નો. આ બાંનેની અવસ્થાતું જ્ઞાન આપણું કેટલું કરાવે ? એક મુસલ્માન સુધ્યાનો પ્રશ્ન-હીરસ્કરીશ્વરજી મહારાજે મુખવચ્છિકા મુખ પર બાંધી, વ્યાખ્યાનની એણી ચાલતાં પ્રશ્ન. જવાય-ભિતાય પર શુંક પડે વારતે મુખે મુખવચ્છિકા બાંધેલ છે. પ્રશ્ન— ‘શુંક પાક કે નાપાક ?’ જવાય-જયાં સુધી મોંબાં રહે ત્યાં સુધી પાક અને ઝહાર નીકળે ત્યારે નાપાક. આટલા જવાય-સવાલમાં બધીએ વાત જણુકારને આવી જાય છે ત્યારે અમારા મુરખણી મુનિરાજે સાદી અને સરદા વાતો ધ્યાનમાં નહી બેતાં ખંડનાત્મક ન્યાયની શૈલી રવીકારી કાર્યમાં ગુંઘાય તે કેવું આશર્ય ?

૨. આદીશ્વર ચરિત્રમાં ગુરુષર્યોચ્યુપમુખ વિન્યસ્તમુખ-બસ્તિકા એ પાઠમાં વિન્યસ્ત શબ્દનું હોવાપણું અને હસ્ત શબ્દનું ન હોવાપણું બાંધવું જ સાબિત કરે છે.

૩. જે રીતે અમો સાબિત કરીએ છીએ કે યુટેરાયજ મહારાજના વખતથી જ હાથમાં મુહુપત્રિ રાખી વ્યાખ્યાન વાંચવાતું શરૂ થયું તેવી રીતે કાંચા તાડપત્રથી જ બાંધવાતું શરૂ થયું એતું પુરુષપ્રમાણુ કે શાબ્દપ્રમાણ પણ આપ આપી શકતા નથી.

: ૬૭ :

૪. પરંતુ અમે સેજાડ પુરાવો વિપાકસૂત્રનો આપી શકીએ છીએ કે-

ભગવં ગોયમ ! તુંમે વિયણ ભંતે ! મુહ્યોત્ત્ત્વાપ મુહં બંધા તતે ણ ભગવં ગોતમે મિયાદેવીએ એવં બુસે સમાણે મુહ્યોત્ત્ત્વાપ મુહં બંધતિ ।

**અર્થ:-**—ભગવાન ગૌતમબ્રહ્મો ! આપ પણ મુહ્યપત્તિવડે મોં બાધે તથી તે ભગવાન ગૌતમસ્વામી મૃગાદેવીએ એ પ્રમાણે કંઈ એટબે મુહ્યપત્તિથી મોં બાધે છે. મૃગાદેવી બીજા વભાદ્રિકથી જાંધવાનું ન કહેતા મુહ્યપત્તિથી જ જાંધવાનું કહે છે, એથી સામિત શાખ છે કે પ્રસંગેમાત ગણુધરોમાં પણ મુહ્યપત્તિ જાંધવાનો રિવાજ હતો. અને મુહ્યપત્તિ જાંધવાના પ્રસંગેમાં વ્યાખ્યાનનો પ્રસંગ મુહ્ય અને મહાસ્યનો છે.

૫. ઉપરની વરસુને પ્રશ્નોત્તરસાર્વશતક ગઢની પણ સમ્યગું અનુભતિ છે.

ગણધરાદિભિરપિ યથાવસરે મુખે મુખઘણ્ણિકા બદ્ધ-  
સીતું ન સર્વદા યદિ સર્વદા બદ્ધા ભવેત તહીં વિપાકસૂત્ર-  
પાઠાસંગતિઃ સ્યાત ।

**શાલાર્થ:-**—ગણધરાદિનિવડે પણ પ્રસંગેમાત મુહ્ય પર મુહ્યપત્તિ બંધાતી હતી ( સર્વદા નહિ ), જો સર્વદા બંધાયેલી હોય તો વિપાક સૂત્રના પાઠને વિરોધ આવે.

૬. તદ્વપરાંત અહૃકૃત શ્રીમાન् વિજયાનંદસ્થરીધરજી ભણારજ (આત્મારામજી) પણ વરસુને જો કે અમલમાં નહોતી મૃકી છત્તાં આ વાતને સમ્ભત હતા એમ તેઓશ્રીના કખેલા અને મુનિશ્રી વધ્યાદિષ્ટ ( શ્રીમાન् વિજયવક્ષભસ્થરિજી )ના સહીવાળા કાગળ પરથી સામિત શાખ છે. આ રણ્ણો તે પત્ર.

શ્રી

સુ. સુરત ખંડર.

મુનિશ્રી આલમચંદજી યોગ્ય લિંગ આચાર્ય મહારાજ

श्री श्री १००८ श्रीमद्विजयानंदसूरीश्वरजी (आत्मारामजी) महाराजजी आदि साधु मंडल डाणे ७ के तर्फ से वंशानु-वंदणा १००८ बार बाचनी। चिठी तुमारी जाई, समाचर सर्व जाप्य है। यहां सर्व साधु सातामें है, तुमारी साता समंबार लिखना:-

मुहपत्ति चिशे हमारा कहना इतना ही है कि मुहपत्ति बंधवी अच्छी है और घणे दिनों से परंपरा चली आई है इन को लोगना यह अच्छा नहीं। हम बंधना अच्छी जाणते हैं, परन्तु हम दुंदीए लोक में से मुहपत्ति तोड़के नीकले हैं इस बास्ते हम बंध नहीं सके हैं और जो कंडि बंधवी इच्छाप तो यहां बड़ी निर्दा होती है और सत्य धर्म में आये हुए लोको के मनमें हीलचली होजाए इस बास्ते नहीं बंध सके हैं सो जाणना। अपरंच हमारी सलाह मानते हो तो तुमको मुहपत्ति बंधन में कुछ भी हानि नहीं है, क्यों कि तुमारे गुरु बंधते हैं और तुम नहीं बंधो वह अच्छो ब्रात नहीं है। आगे जैसी तुमारी मरजी, हमने तो हमारा अभिप्राय लीख दीया है सो जाणना।

और हमको तो तुम बंधोगे तो भी बैसा हो और वही बंधो तो भी बैसा ही हो, परन्तु तमारे हितके बास्ते लिखा है, आगे जैसी तमारी मरजी।

१९४७ कारतक चदि ०)) बार बुध दसखत बळभविजय वंदणा चाचनी। दीवालो के रोज दश बजे चिठी लिखी है।

[ श्रीभद्र आत्मारामज्ज्ञे मुहपत्ति आंध्रा संघे सुरत शिराजता भुनि भहाराज्ज श्री आलभयंद्ज्ञने आपेक्षा तेमना पत्रनो प्रत्युत्तर-श्री मुहपत्ति चर्चासारना ज्योक्त परथी। ]

७. वर्ष अंड २० भाँ आप लगें छो। हे—“वांचा ताडपत्र परथी व्याख्यान वांचती वर्षते पूर्वपुरषोंमे मुहपत्ति आंधी।” आगल ज्तां अंड २२ भाँ आप लगें छो। हे—“ताता

કે કાગળના પુરતકો પહેલાં હતાં તેનો પુરાવો હેવો.” તો અમો જખ્યાનીએ છીએ કે નિશિથયુણ્ણિભાં રૂપણ પાડ છે કે—

દિહો બાહ્ય પુહુચેણ તુલો ચતુરસ્સો ગંડીપુસ્થગો, અંતે તગુશ્યો મજ્જે પિહુલો અધ્ય બાહ્યો કચ્છભી ચતુરઙ્ગુલો દીહો વા બૃત્તાકતિ મુદ્રી પુસ્થગો અહવા ચતુરઙ્ગુલો દીહો ચતુરસ્સો મુદ્દી પુસ્થગો, દુગ્રાં ફલગા-સંપુડગાં, દીહો હસ્સો વા પિહુલો અધ્ય બાહ્યો છિવાડી, અહવા તગુ પચેહિં ઉસિસાઓ છિવાડી” તિ

આભાં મુણિ પુરતક વિગેરે પાડ રૂપણ સુચવે છે કે પહેલા એટલે દેવધિંગણ્ણિ પહેલા પણ પુરતકો હતાં અને તે નાના પણ હતાં.

૮. આના દર્શિત પુરાવાભાં અત્યારે પણ કાગદ, તાડપત્ર, વાનશુન, પત્રાદિ પર લખેલી પ્રતો મળો આવે છે અને સૌથી વધારે રૂપણ અને સુંદર પુરાવો આપના જ શખ્ફો છે. વર્પ્પ ૩, અંક ૧૩-૧૪-૧૫ પાનું ૩૪૨-૩૪૩માં નીચેના ઇકરાભાં આપ ચોતે જ તે વાતની ઇચ્છાત આપના જ શખ્ફોમાં કરો છો. “ભગવાન ભહા-વીર વખતે પણ પુરતકોની હોવાથી. આ ઉપરથી તેમજ ભગવાનું ભહાવીર ભહારાજના ડેવળજાનની પહેલાં જિનિહાસ નામનો શેષ અષ્ટભી અને ચર્ચાદિશાએ પીપથ કરીને પુરતકો વાંચતો હતો, આ વાત આવશ્યક વિગેરે સુનોમાં રૂપણ હોવાથી સિદ્ધાન્ત અને શાસ્ત્રના પુરતકોનું લખ્યું શ્રી દેવધિંગણ્ણિ ક્ષમાશ્રમણ્ણું પઢી જ થયું છે અને તેથી આ શ્રીપાણ ભહારાજે કરેલી શાનની આરાધનાભાં પુરતકા લખવા સંબંધી આવતો અધિકાર અસંગત છે એમ કહી શકાય નથી. ભગવાન દેવધિંગણ્ણિ ક્ષમાશ્રમણ્ણાએ આગમો પુરતક પાના ઉપર લખ્યાં, અર્થાત् પહેલાં ભીજાં શાસ્ત્રો પુરતક પાના ઉપર લખા-એલાં હતાં પણ આગમો પુરતક પાના ઉપર લખાએલાં ન હતાં એમ કહેલું પરન્તુ શુતરકંધના અધિકારમાં દ્રવ્યશ્રુત તરીકે પુરતક પાના લીધેલાં હોવાથી અને શુતરકંધ તરીકે વિભાગ આગમભાં જ પડતા હોવાથી આગમો પહેલાં લખાતાં જ ન હતાં એમ કહી શકાય નથી. એટલી વાત જરૂર છે કે અંગાદિકનું શાન આચાર્યાદિક પરંપરાદારાએ

શાખનમાં પ્રવત્તતું હોવાથી નિર્યાથ અમણું ભગવાંતોને આગમ પુસ્તકાં જાપાનિ જરૂર રહેતી ન હતી અને તેથી પાંચ પ્રકારના પુસ્તકોમાંથી કોઈપણ પ્રકારનાં પુસ્તક રાખવા, લાખવા કે બાંધિને સાચવવાં એ દરેકમાં નિરૂપથોળિતા હોવા સાથે ઉપાધિપણાને વીજે પ્રાયશ્વિત આપત્તિ શાખાકારોએ જલ્દીવેલી છે. પણ ભગવાનું વજસ્વામીજી સરખાને કરાવેલા અભ્યાસની સ્થિતિનો વિચાર કરતા ધારણા રહીત એવા અમણું નિર્યાથાદિ માટે પણ પુસ્તકોનો ઉપયોગ થતો નહોતો કે ? આગમના પુસ્તકો રખાત્તાં નહીંત્તાં કે ? એમ કહી શકાય તેમ નથી. વળી પહેલા કાગળના પુસ્તકો નહોતા તેનો આપ જ શા પુરાવો આપી શકો છો ?

૬. તો છેવટમાં અમો આપને પૃષ્ઠાઓ છીએ કે પરંપરાથી અગર શાખપાઠી કોઈ પણ રીતે આપત્તિ આ વસ્તુ ( સુહપત્તિ-તું વ્યાખ્યાન સમયે બાંધવું ) માન્ય છે કે નહીં ?

૭૦. અને “ વ્યાખ્યાનકારમાં સુહપત્તિ બાંધનાર અને નહીં બાંધનારમાં આરાધક કોણું ? અને વિરાધક કોણું ? ” એ અમારા પ્રશ્નનો પ્રત્યુત્તર હજુ સુધી કેમ મળતો નથી ?

૭૧. પ્રતિ-સમાદોયનાની સમાપ્તિમાં અમો એટલું જ કહેવા માંગીએ છીએ કે વરતુંનું પિષ્ટપેણું નહીં કરતાં છેદ્ધા એ પ્રશ્નનો ( ૬-૧૦ ) જાહેર ખુલાસો જેન જનતાને આપી દેશો, અને પાંચ પ્રકારનાં પુસ્તકો ડેઢથી હોવાથી અસુક વખતે લાંબા તાડપત્રના જ પુસ્તકો હતાં અને તેથી જ સુહપત્તિ બાંધવાતું શરૂ થયું તે કહેવું પુરૂષ અને શાખપ્રમાણું વિનાટું હોવાથી બાજખી નથી. આપને પણ તેવા ચિન્તા જોવામાં આગ્યાં હશે, તેથી જ પૂછવા છતાં પણ નિષેધ કરેશો નથી. એટસે આપના જોવામાં પણ તેવાં ચિન્તા આગ્યા હોવાતું અનુમાન થાય છે. સુહપત્તિ બાંધવાનો પરિવાર સહિત આદર કરશો તો ચર્ચાસારનાં ચિન્તા કરતાં પણ પ્રાચીન ચિન્તા પ્રથળ કરીને રજુ કરશું.

આચાર્યશ્રી વિજયહર્ષસ્તૂરીશ્વરાજ મહારાજ, પુનાસીદી

### પ્રશ્ન.

સિદ્ધયક, તૃતીય વર્ષ, ભાદ્રવા વદિ ૦)) શુક્રવાર ૧૬૬૧ અંક ૨૪.

૧. વિપાઠનું બંધન દુર્ગંધથી બચવા.
  ૨. નાના વખતે બંધનનો બેખ નથી. આરોહ મોટામાં ધણો છે.
  ૩. વિન્મરત શબ્દ છે તે ન્યાસ કરનારને એંગે છે. સુખદ શબ્દ નથી
  ૪. કાગળ કખનારને માનતા હોય તેને પૂજનું.
  ૫. અર્ચા-સાર જોડા અર્થવાળા ને ઉત્પિત ઝોટાવાળા જ છે.
  ૬. બ્યાખ્યાનની વખતે બાંધવાનો બેખ હોય તો ડાઈને પણ માનસામાં વધા હોય જ નહીં, પણ હજુ સુધી એક પણ તેવો બેખ છે જ હ્યાં ?
  ૭. શાસના અર્થને ફેરવે તે પરંપરા છે. તે વખત ઉપરોગ નથી રહેતો માટે બાંધું છું ધારી બાંધે તો અથવા લિંગ ફરી નથ છે, પ્રમાદને પોષણ મળે છે, વિધિશાસ્કોમાં બેખ નથી અને ઉપરોગ શક્ય છે; માટે ન બાંધવી સારી છે. માને ને બાંધે તો તે બંને આરાધક થાય.
- 

### જવાબ

૧. વિપાક સૂતમાં જે ગૌતમરવાભી પ્રશ્નથે સુખવિદ્યાને બાંધી પણ નાક અને ડાનના સંબંધવાળા બાંધેલ હશે કે અન્ય રીતે ? દુર્ગંધથી બચવા પ્રશ્ન ગૌતમરવાભીએ બાંધી તે વાત તો સ્પષ્ટ રીતે સૂતના મૂળમાં જ વર્ણવેલ છે. ન્યારે જ્વો દુર્ગંધીથી બચવા સુખવિદ્યાનો બાંધવા રૂપમાં ઉપરોગ કરે છે તો ખૂદ તીર્થીકરની વાણીદારાએ નીકળેલા શબ્દોને ગણુધર પ્રશ્નથે શુંથી જે આગમ રૂપમાં રજૂ હ્યાં છે તે આગમોની આચાતના ફૂર કરવા મૂર્ખ મહાપુરુષના ધીરી રરતાને નાખુફ કરવા ભાગ્યથાળી બને તેને સરજન નરો કેવી ઉપમાને આપે તે વિચારણીય છે.

૨. ચચ્ચો—સારમાં નેટલા ક્રેઝો જે કે વિદ્યાનમાં આપેલા છે તે તે પાડો અર્થસંખ્યી લગારે ફેરફાર નથી. દુનિયાની કહેવતનો આશ્રય લઈએ તો ‘કેને કમળો થયો હોય તે તો દરેકને પીળા રૂપમાં હેબે.’ આ કહેવતને યાદ કરાય તો જ ધ્યાનમાં આવે, નહીં તો જ બધું એ અવળા રૂપમાં જ હેખાય ને? પણ મારા મુરખ્યી ભાઘ્યો, જેટલું આપણાથી જની શકે તે જ પ્રમાણે વિવારણા કરાય. ‘શાશ્વત ગહન. શાશ્વતનાં અથી પણ ગહન’ જે માણુસની જેવી પ્રણાલિકા હોય તે જ તેવું રવીકારી શકે છે. આપણામાં પણ આપની વાતને જે સત્ય રૂપમાં રવીકારી કે તે આપણું ખૂબ જીસો લાગે છે? પણ ન સ્વીકારી શકાય તો તે વ્યક્તિને આપ હલકો પાડવા પ્રયત્ન નથી કરતા શું?

આટલું આપ વિચારો એટલે ખસ. સત્ય વરતું આપની પાસે અવસ્થ આવી જાણી રહેશે. સત્ય વરતુની અવગાહના આપણાથી જ્યાં સુધી કરાય નહીં ત્યાં સુધી આપણે પરિઅમણું કરવાનું ખરું ને?

‘ચચ્ચો—સાર સત્ય જ છે.’ એદું કહેનાર આતમા આત્માને અગ્રિત જનાવે છે. પોતાનો કંક્ષો ખરો કરવા પ્રયત્ન કરે છે ને?

૩. શાશ્વતનાં અર્થને ફેરવે તે ભવોની પરંપરા વધારે છે અને શાશ્વતને શાશ્વતપે પરિણામવે તેવું શું? વારતે વિચારાય તે જ યુદ્ધિ-ગ્રાહી કંઈ શકાય ને?

૪. તે વખત ઉપયોગ નથી રહેતો વારતે બાંધું શું. આ પ્રશ્નને અવકાંખી લખાય કે જેનાચાર્ય વિજયહીરસર્વીશ્વરજી મહારાજને ઉપયોગ રહેતો ન હતો એટલે બાંધતા હતા ને? આ વીસમી સહીના જમાનામાં આપણ્યા જેવા ઉપયોગ રાખતાર છેવા ખૂબ જ છે ને? આપણ્યા કરતાં વિજયહીરસર્વીશ્વરજી મહારાજ જેવાને ઉપયોગનો અભાવ હતો ને? એટલે બાંધતા હશે. વાહ! ! ! જમાનાની બલિલારી છે! જેનામાં ઉપયોગ, કિયા વગેરેનો અભાવ દશ્ટિગોચર કરતા હોઈએ ત્યાં ઉપયોગના સહભાવનાને પોષવા મન લખાય ત્યાં બાકી રહ્યું શું?

બાંધતાર બાંધવા માને અને નહીં બાંધતાર શું મરાહના

ઃ ૪૬ ૩

ચોષણુરૂપ અને નિઃ ? પૂર્વે મહાન પુરુષો વ્યાખ્યાનાદિમાં સુખ-  
વલ્લિકા બાંધી વ્યાખ્યાનાદિ કરતા હતા તો તે આત્માઓને પ્રમાણિત  
ચોષણુ થયું ને ? તમારા જ લખાણ પરથી પૂર્વે કેટકેટલા  
આચ્છાદી વ્યાખ્યાનાદિમાં સુખવલ્લિકાનું વંધન સ્વીકારી બાંધતા  
તે બધાએ પ્રમાણના ચોષણુરૂપ થયા ને ? આપના કરતાં પૂર્વ  
મહાપુરુષો નિઃપ્રમાણી હતા તે તમારે સ્વીકારયું જ પડશો.

યશોવિજયળ મહારાજ, પંન્યાસજ સત્યવિજયળ મહારાજ  
વિગેરે મહાન પુરુષો અપ્રમાણી હતા તે તેઓના શ્વવન પરથી  
આપણુને માલુમ પડે છે, તો તેવા પુરુષોને પ્રમાણી બનાવતાં  
આપણે શું પ્રમાણી નથી બનતા ?

સુખવલ્લિકાને વ્યાખ્યાનાદિમાં નહી બાંધતારો આત્મા નિર્વિદ્ધ  
પ્રણાલિકાનો ધ્યાસ કરનાર શું આપને નથી લાગતો ? સાવધ  
પ્રણાલિકાને સ્વીકારનાર આપણુને નથી લાગતી શું ? એક વરસુનો  
નાશ કરવા કેટલી ડોશીશ થાય તેટલી જ આપણી ભવપરંપરા શું  
ઈછી પામતી દેખાતી નથી ? સાથે હાનાવરણી કર્મ અને આશા-  
તના નથી દેખાતી શું ? અને ત્યારથી આપણુ ચારિત્રનું અંગ  
સુખવલ્લિકાને અમુક અંશો ગુમાવેલી નથી શું ? હિપયોગ રાખનારા  
પણ કેટલા ઉપયોગપૂર્વક વર્તી રહેલા છે તે તો તમારી અને  
મારી દિશી બહાર નથી.

નાનામાંથી આપણુ મોદું ધણું યે ગુમાવ્યું છે અને ગુમાવતા  
જઈએ છીએ તે જો ધ્યાનમાં આવે તો નજરોનજર બધુંએ  
તરી આવે છે.

જમાલી જેવા તીર્થી કરની અમુક એક બાયત નહી માનનારા  
નિહૃવરૂપમાં મૂકાયા, તો આપણુની ગણુતરી શેમાં ?

લેખક:-પંન્યાસ કદ્યાણવિજય

## સમાક્ષોચના પર દિશાપાત્ર

તા. ૧૮ નવેમ્બર ૧૯૩૪

હાલ શ્વેતાભ્યર નૈન સાહુઓમાં એ પક્ષ છે. એક પક્ષ વ્યાખ્યાન સમયે મુહુપતિ મુખ ઉપર આવે છે ત્યારે થીને પક્ષ નથી બાંધતો. અને ભાનસિક કલ્પનાઓથી સત્ય વરતુને અસત્યના ઇપમાં જહેર કરે છે. વ્યાખ્યાન સમયે મુહુપતિ બાંધવાનો રિવાજ મારી સમજ પ્રમાણે અને વાહીવેતાલ શાન્તિસૂર્વિવરચિત ચૈત્યવંદન મહાભાષ્યના આધારે તીર્થની રથાપના થઈ ત્યારથી ચાલુ થયેલ હોવો જોઇએ. યતઃ—

લિંહાનળે નિસળો પાણ ડચિડજ પાયપીડંમિ ।  
કરથરિય જોગમુહો જિણનાહો દેસણ કુળા ॥ ૮૪ ॥  
તેણ ચિય સુરિધા કુણંતિ બક્ખાણ જોગમુહાપ ।  
જં તે જિણપદિદ્વા ધરંતિ સુહૃપત્તિં નઘરં ॥ ૮૫ ॥

અર્થ—નિનેશ્વર લગવાન् સિંહાસન ઉપર બેસી, પાદભીડ ઉપર પગ સ્થાપન કરી, હાથમાં યોગમુદ્રા ધારણ કરીને દેશના આપે છે, તથી નિનેશ્વરના પ્રતિશ્રય ( પ્રતિનિધિશ્રય ) ગણ્યધર મહારાજાઓ પણ યોગમુદ્રાએ જ ધર્મદેશના આપે છે. વિશેષમાં એટલું કે તેમો મુહુપતિ ધારણ કરે છે. અહિં ગણ્યધરને ભાટે મુહુપતિ ધારણ કરીને યોગમુદ્રાએ દેશના આપવાનું લખ્યું છે.—યોગમુદ્રા-મે હાથની અન્યોન્ય દશ આંગલીઓ ભરાવીને હાથની કોણી પેઢ ઉપર રાપે તે યોગમુદ્રા કહેવાય. અર્થની દેશના આપવાર આચાર્ય તીર્થંકર તુલ્ય છે એમ વ્યવહાર ભાષ્યના ૬ ટા ઉદ્દેશાની ગાયા ૨૦૨ માં કહ્યું છે. અહિં યોગમુદ્રા નિનેશ્વરના અનુકરણને ભાટે છે અને સાવદ્ર ભાષાના પરિહાર ભાટે મુહુપતિ ધારણ કરવાનું કહ્યું છે. અને નહિ બાંધનાર પક્ષ ધરંતિ પદનો અર્થ હાથમાં રાખવાનો કરે છે, પરંતુ મુખ ગાથાની અંદર તો હાથમાં ઇક્તા યોગમુદ્રા જ ધારણ કરવાનું વિધાન છે. સાથે મુહુપતિ રાખવાનો નિર્દેશ નથી એટલે મુહુપતિ જુહી

પડે છે, તથી તે સાર્વભૂતાંના પરિહાર માટે મુખ પર ધારણ કરવી જોઈએ. યોગમુદ્રાની સૌથે ને મુહૂરતિ હાથમાં રાખે તો તે યોગમુદ્રા સાવદ્ર ભાષાના પરિહાર માટે ડેઢ મુખ સુધી લઈ જવી પડે. ત્યાં સુધી લઈ જવાનું અખવા મુખને નીચું રાખવાનું વિધાન આ જાથીએં નથી, માટે ઘરંતિ પહેનો અર્થ મુહૂરતિ હાથમાં રાખવી જોવો કરતાં મુખ પર ધારણ કરવી જોઈએ બાંધવી જો અર્થ જ અર્થાપત્તિ વ્યાખ્યાન સુસંગત લાગે છે. જો મુહૂરતિ અંધન પુરતક ઉપરથી વ્યાખ્યાન વાંચવાનું હોય ત્યારે ચુંફુંથી થતી શુતરીનાની આશાતના અને સાવદ્ર ભાષાના પરિહારને માટે છે. નહિ કે પ્રમાણ ! હાલ ને કે તથાપ્રકારના શારીરિક અલના અભાવે વ્યાખ્યાન પૂર્ખ થાય ત્યાં સુધી યોગમુદ્રા રહી શકતી નથી, મંગલાચરણ સુધી રહે છે તેથી મુહૂરતિ મુખ ઉપર ન બાંધતા ડાંધાં ને રાખવી જેમ ન કણી શકાય; કેમકે મુહૂરતિ બંધનનો વિષય જ જિન્હે છે. જેઓ મુહૂરતિ બાંધતા નથી અને પુરતક ઉપરથી વ્યાખ્યાન કરે છે, તેઓ ચુંફુંથી થતી શુતરીનાની આશાતના અને સાવદ્ર ભાષાના પરિહાર કેટથોડો કરી શકે છે એ તો શ્રોતાઓને ગ્રત્યક્ષ જ છે. નહિ બાંધનાર પક્ષ જોવી દલીલ કરે છે કે બીજા સમયમાં શુતરીનાની આશાતના દૂર કરવા ભાટે કેમ બાંધતા નથી ? અના પ્રશ્નુતરમાં કહેવાનું કે ગંધદરે મહારાજ આદિ પૂર્વપુરુષોએ બાંધિલ નથી, પણ મુહૂરતિને ઉપયોગ જ રાખેલ છે; તેથી અમે પણ ઉપયોગ રાખ્યો છીએ. જેમ હાલ કાળની વિષમતાને લઈને ચારિત્રના શાસ્ત્રોક્તા ઉત્તરશુદ્ધીનું સંવીશે પાલન થતું નથી, તેથી કંઈ મૃદુશુદ્ધોનો ત્યાગ થોડો જ કરામ ? અને કરે તો ચારિત્રનો અભાવ થાય તેવી રીતે ક્રમદીક્ષના સમયે યોગમુદ્રા ન રહી શકે એટલે મુહૂરતિ અંધનને પણ છોડી દેવું એ શું જોગ્ય છે ? નહિ બાંધનાર પક્ષની શાખાશરૂણ્ય અને માનસિક કલ્પનાથી ઉદ્ભવેલી અસત્ય દલીલોથી ભદ્રિક જીવો જિધે રસ્તે ન હોરાય, જિનેશ્વરની આગામાના આગામાન અને અને સાચ વસ્તુને જોગ્યે તે માટે જ બાંધનાર પક્ષ તરફથી “મુહૂરતિ ચર્ચાસાર” નામનું પુરતક પ્રકાશિત થયેલ છે તે વાંચવાથી સુસ સમદાચિ મનુષ્ય તેની ઉપયોગિતાનાણણી શકે છે. એ જ પુરતકની

સમાચારના કરતા સિક્ષિધક્કાર તાં ૨૬-૭-૩૪ ના અંક-  
માં લખે છે કે “ લાંબા તાડપત્ર ઉપરથી વ્યાખ્યાન વંશસા વખતે  
પૂર્વપુરુષોએ મુહૂરતિ બાંધી અને તે ઓક હાથે પાણાં વંશાય તેવી  
પ્રતોના વખતમાં ચાલુ રહી, પણ તે નીકળાં જવી ચેંધ હોઢ  
નીકળી ગઈ છે એમ માનવું શું જોડું છે ? ” અતિહાસિક દાખિયે  
વિચાર કર્તા એમ લાગે છે કે વીર સં. ૬૮૦ માં અંતિમ પૂર્વધર  
શ્રી દેવર્ધિગણી ક્ષમાક્ષમણુ મહારાજાએ આગમો પુસ્તકારણ કર્યો  
એટથે તાડપત્ર પર લખાયા તે સમયથી વ્યાખ્યાન વખતે મુહૂરતિ  
આંધવાની શરૂઆત થઈ હોય એમ સાગરજી પોતાના શંહોથી મુહૂરતિ  
આંધવાનું જહેર કરે છે. આજદિન પણ્ઠત એ પ્રવૃત્તિ ચાલે છે,  
એમ નૈત જગત સારી રીતે જાણે છે. તાડપત્ર ઉપર પુસ્તકો લખા-  
યાને આજે (૧૫૦૦) વર્ષ થયાં છે એટથે મુહૂરતિ આંધવાનો રિવાજ  
સમાચારનાના કથન પ્રમાણે આજકાલનો તો ન જ ગણ્યાય; પણ ૧૪૦૦  
અથવા ૧૫૦૦ વર્ષનો પ્રાચીન ગણ્યાય. વિક્રમ સં. ૪૧૨ની આસ-  
પાસ ચૈત્યવાસ શરૂ થયો હતો. અને મુનિસુંદરસૂરીશ્વરજીના સમયમાં  
તેનો અંત આવ્યો હતો. પૂર્વધર શાસ્ત્રિકાચાર્ય મહારાજે શાલિવાહન  
રાજના કહેવાથી ભાદ્રવા શુ. ૪ ના હિવસે સાંવત્સરિક પર્વ  
કર્યું અને તે સમયના સર્વ ગીતારીએ એને સંભતિ આપો. એટથે  
પૂર્વીચારોની પરંપરાથી ચોથના હિવસે એ પર્વની આરાધના કરાય  
છે. વિક્રમ સં. ૧૧૫૬ માં ચંદ્રપ્રભસુરિએ ચોથનો વિરોધ કરેં એમ  
ધૂતિહાસ કરે છે. આ ચોથની આરાધના પરંપરાથી છે એમ ધર્મ-  
સંગ્રહમાં પણ લખ્યું છે; ડોઈ રથથે સુત્રમાં વિધાન નથી. નિશિથ-  
ઘૂર્ણિયાં ચોથને કાગળિક કહેલ છે, જ્ઞાતાં આ બાધન સાગરજી જરાએ  
વિરોધ કરતા નથી અને પરંપરાને સૂત્ર તુલ્ય માનીને તેનું સમર્થન  
કરે છે, તો પણી આ મુહૂરતિ અંધની પરંપરાને તર્ફાશી કેમ તોડે  
છે એનો. હેતુ સમજાતો નથી. પરંપરા તોડનારને માટે આનંધનજી  
મહારાજ શું કહે છે ?

ચૂરણ ભાષ્ય સૂત્ર નિર્યुક્ત વૃત્તિ પરંપર અનુભવ રે ।  
સમયે પુસ્તકના અંગ કહ્યા એ જે છેદે તે દુરમજ રે ॥ ૪ ॥ ૮ ॥  
( નેત્રિકાય સ્તરન )

વ्याख्यान सમये મુહૂપતि બાંધવાની પ્રવृત્તિ અસુક આચાર્યથી શરૂ થઈ છે, એવું ઐતિહાસિક પ્રમાણ સામ્રાજ્ય મહારાજ પણ આપી શકતા નથી તેમજ અંતિમ પૂર્વધર ટેવદ્વિગણી ક્ષમાક્ષમણ મહારાજથી આરંભને અત્યાર સુધીમાં માનતું ગમુરિલું યાકિની-મહત્તરાસુનું ફરિબદ્ધસુરિલું, કલિકાલસર્વજ્ઞ હેમયદ્રસુરિલું, સોભપ્રભ-સુરિલું, મુનિસુદરસુરિ, આણંદવિમળસુરિ, જગદ્ગુરુ હીરવિજયસુરિ, પ્રભર વિદાન ઉપાધ્યાયથી યશોવિજયળગણી વિગેરે ધાર્યા વિદાનો થયા છે, એથાંથી અસુક આચાર્ય મુહૂપતિ બાંધવાનો વિરોધ કર્યો એવો પણ ઐતિહાસિક પુરાવો આપી શકતા નથી, છતાં સમાચોચક ગેતાના શષ્ઠોમાં એમ જાહેર કરે છે કે “નીકળો જવી ચોગ્ય હોય” તો તેઓશ્રી કદ અપેક્ષાએ ૧૫૦૦ વર્ષની જરૂરી પરંપરાને નીકળો જવી ચોગ્ય સમને છે? ને એમ માનતા હોય કે મુહૂપતિ બાંધવી એ કુલિંગ છે (?) તો અણુધર મહારાજાએ પણ અવસરે અવસરે મુહૂપતિ બાંધી છે એમ પ્રભોતરસાધશતકમાં ક્ષમણું છે અને વિપાકસુત્રમાં ગૌતમસ્વામીજીનો દાખલો છે, એટલે કુલિંગ પણ કહી શકાય નહીં. કદાચિત સાવદ્રની અપેક્ષાએ નીકળો જવી ચોગ્ય માનતા હોય તો તે પણ વ્યાજાની નથી. ડેમકે “વ્યાખ્યાન વાંચવા વખતે પૂર્વપુરુષોએ મુહૂપતિ” એમ તો સિદ્ધયક્કાર પણ ગેતાના શષ્ઠોમાં કણૂલ કરે છે. બીજું સભાની અંદર કદ્વસ્ત્ર વાંચવાની શક્કાત વીર સં. ૬૬૩ થી થઈ છે. ને કે બીજ વ્યાખ્યાનો માટે સમયનો નિયમ નથી, મરણ પ્રમાણે વાંચાય છે; પણ કદ્વસ્ત્રનાં વ્યાખ્યાનો તો પૂરા કરવા જ પડે એટસે વધારેમાં વધારે ત્રણ ચાર કલાક તો ચાલે જાય પણ મુહૂપતિ નાક પર રહે, એ તેથી કોઢ કોઢ વાર થુંક લાગે તો પણ નાકમાંથી નીકળતા પવનથી સુકાદ જાય છે તેથી મુહૂપતિ બાંધનમાં પૂર્વપુરુષોએ જીવો-ત્પત્તિનો સંભવ માનનો નથી. ને વ્યાખ્યાન સમયે મુહૂપતિ બાંધવી એભાં જીવોત્પત્તિનો સંભવણ્ય હોય હોય તો પૂર્વપુરુષો એવી પ્રવૃત્તિ કરે જ કેમ? ડેમકે પૂર્વપુરુષો ત્રિવિધે નિવિધે સર્વ સાવદ્રના ત્યાગી હતા અને એમણે સાવદ્ર પ્રવત્તિનો વિરોધ કર્યો છે તે વાત નિર્વિવાહ છે.